

ભેદરેખા!

બહુ પાતળી છે

: લેખક :

વર્ધમાન તપોનિધિ સંઘહિતચિંતક
સ્વ. ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના
શિષ્યરત્ન સાધુસેવાતત્પર સ્વાધ્યાયપ્રેમી
સ્વ. પૂજ્યપાદ **મુનિરાજ શ્રી દેવસુંદરવિજયજી મહારાજના**
શિષ્યરત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ

૩૯૦

: પ્રકાશક :

રત્નત્રયી ટ્રસ્ટ
કલ્પેશ વિ.શાહ

૧૪, ઈલોરા પાર્ક સોસાયટી,
નારણપુરા ચારરસ્તા પાસે, જૈન દેરાસર સામે,
નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩
ફોન : ૦૭૯-૨૭૬૮૦૭૪૬ (બપોરે ૧૨થી ૭)
મોબાઈલ : ૦૭૩૮૩૯૪૯૫૫૫

Email: ratnatrayeetrust@gmail.com

Website : www.ratnaworld.com

પ્રાપ્તિસ્થાન

૧. રત્નત્રયી ટ્રસ્ટ

પ્રવીણકુમાર દોશી

૨૫૮, ગાંધી ગલી, સ્વદેશી માર્કેટ,
કાલબાદેવી રોડ, મુંબઈ - ૪૦૦૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૬૦૮૨૬
(બપોરે ૧૨ થી ૭)

૨. કિશોરભાઈ વિક્રમ

અલંકાર લેડીઝ ડિપાર્ટમેન્ટ,
૬૧૫, લક્ષ્મી રોડ, પુણે - ૪૧૧૦૩૦
ફોન : ૦૨૦-૨૪૪૫૫૫૧૯, ઘર. ૨૪૪૫૩૨૮૪
મોબાઈલ : ૯૮૨૨૩-૩૪૬૯૨

૩. દલીયંદ મણિલાલ મહેતા

C/o. કે. ડી. ઓટો, કોમર્સ કોલેજ સામે,
ભૂજ - કચ્છ
ફોન : ઓ. : ૦૨૮૩૨-૨૩૨૫૦૧ / ૦૨
ઘર : ૨૫૩૩૫૧, ૨૫૦૩૫૧,
મોબાઈલ : ૯૮૨૬૧-૫૦૩૫૧

૪. રાજેશ-મોલિક

રોયલ ઈન્વેસ્ટમેન્ટ, ‘આંગી’ બાલમંદિર સામે,
પેટ્રોલપંપની પાછળ, સરદારભાગ,
બારડોલી-૩૯૪૬૦૨
ફોન : ૦૨૬૨૨-૨૨૦૩૪૫
મોબાઈલ : ૯૯૯૮૩૦૯૯૯૧

૫. નવભારત સાહિત્ય મંદિર

પતાસા પોળની સામે,
મહાવીર સ્વામીના દેરાસરની બાજુમાં,
ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧.
ફોન : ૦૭૯-૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧

૬. દીપક-મિલન

૧૦૧ ન્યુ ડી.ટી.સી., રજે માળે,
હાટકલ્વીયા, હરીપૂરા,
સુરત - ૩૯૫૦૦૩
ફોન : ૦૨૬૧-૩૦૦૯૦૪૨
(બપોરે ૧૧ થી ૫)

૭. રત્નત્રયી ટ્રસ્ટ, કલ્પેશ વિ. શાહ

૧૪, ઈલોરા પાર્ક સોસાયટી,
નારણપુરા ચાર રસ્તા પાસે,
દેરાસર સામે, નારણપુરા,
અમદાવાદ - ૩૮૦૦૧૩
ફોન : ૦૭૯-૨૭૬૮૦૭૬૬
મોબાઈલ : ૦૭૩૮૩૯૪૯૫૫૫
(બપોરે ૧૨ થી ૭)
Email: ratnatrayeetrust@gmail.com

૮. કેયુરભાઈ અશોક મેટલ્સ,

ઢેબરભાઈ રોડ, મ્યુ.કો. ઓફીસ સામે,
રાજકોટ - ૩૬૦૦૦૧
ફોન : ૦૨૮૧-૨૨૨૪૪૦૮, ૨૨૩૭૦૨૯

૯. મયુરકુમાર રસિકલાલ શેઠ

‘નવકાર’ ૧૫૫, પ્રીતમ સોસાયટી નં ૧,
કસક, ભરૂચ - ૩૬૨૦૦૨
ફોન : ૦૨૬૪૨-૨૪૫૧૩૬
મોબાઈલ : ૯૯૯૯૮૦-૧૪૦૦૧
Email: mayursheth1955@yahoo.co.in

૧૦. ડૉ. રશ્મિન એમ. પુરોહિત

‘ભગવતી કૃપા’, હાઈ-વે,
એચ.એમ. પી ગેટ સામે,
જલારામ કોલોની, પોરબંદર - ૩૬૦૫૭૫.
ફોન : ૦૨૮૬-૨૨૪૩૦૦૩, ૨૨૪૫૬૦૧
મોબાઈલ : ૦૯૪૨૮૨ ૮૭૨૭૫
Email: shrutdevimandir@gmail.com

૧૧. જૈન એલર્ટ ગ્રુપ ઓફ હિંમતનગર

ભાવેશ શાહ,
કે.ડી. કોમ્પ્લેક્સ, મોટાભાઈ માર્કેટની સામે,
ગાયત્રી મંદિર રોડ, મહાવીર નગર,
હિંમતનગર-૩૮૩૦૦૧. મો. ૯૪૨૮૮૩૨૬૬૦

૧૨. રત્ન એસોસીએટ્સ

C/o. કચ્છ શાહ, ‘ધર્મવીર’, જૈન મંદિર સામે,
દેહરા પોળ, રાજમહલ રોડ, વડોદરા-૩૯૦૦૦૧
ફોન : ૦૨૬૫-૨૪૨૪૪૫૩
મો. ૮૦૦૦૯૧૫૮૩૯
Email: guru.seva2018@gmail.com

સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન

કુલ પ્રકાશિત નકલ : ૨૩,૦૦૦

પ્રકાશન તારીખ : ૨૮-૧૧-૨૦૨૧

ગુજરાતી : ૧૩,૦૦૦

હિન્દી : ૫૦૦૦

અંગ્રેજી : ૫૦૦૦

કિંમત : રૂ. ૨૦૦.૦૦

(રૂપિયા બસો પૂરા)

: મુદ્રક :

શાર્પ ઓફસેટ પ્રિન્ટર્સ

૩૧૨, હીરા પન્ના કોમ્પ્લેક્સ,

ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧

ફોન : ૦૨૮૧-૨૪૬૮૪૬૧,

મોબાઈલ : ૯૮૨૫૦-૭૫૦૬૧

અમદાવાદ ફોન : ૦૭૯-૨૬૫૮૪૪૧૪ / ૧૫

E-mail : sharpoffset@hotmail.com

વાસના: શરીરની જરૂરિયાત ?
કે મનની માગ ?

સાતી અને સંપત્તિ,
સંલંઘી અને પ્રસિદ્ધિ
આ બધું શરીરથી ખૂબ ખૂબ
દૂર છે અને એટલે જ
એ લગભગ યિના માણ
શરીરને સ્વસ્થ રાખવામાં અને
મનને મસ્ત રાખવામાં
કોઈ જ લડલીક પડતી નથી
માણ હિન્દીયો ?
એ લો શરીરની સાથે જ છે
અને એટલે જ
એ લગભગને સ્વસ્થ રાખવા
તમોજન. જલ અને માણ વાયુની
જરૂર પડે જ છે.
એ એની ઉપેક્ષા કરવામાં આવે છે
લો હિન્દીયો મુડદાલ બની નવ્ય છે
અને એક સમય
કહાવ્ય એવો માણ આવી નવ્ય છે કે
શરીરતં 'રામ બોલો ત્યારે રામ'
બઈ નવ્ય છે.

માણ સજીર !

વાસના એ છે શું ?

શરીરની જરૂરિયાત કે મનની જરૂરિયાત ?
એની પૂર્તિ યિના

શરીર ખતમ થઈ જ નવ્ય ?

મન સ્વસ્થસ્થ બન્યું જ રહે ?

આ પ્રશ્નનો જવાબ છે, ના.

વાસના એ શરીરની જરૂરિયાત
લો નથી જ.


કારણ કે
 શરીરની જરૂરિયાત
 એને કહેવાય કે એના યિના
 શરીર ખોલાયું અસ્તિત્વ જ ગુમાવી બેસે.
 વાસના પૂર્તિ માટે એવું કહી શકાય તેમ નથી
 એની માંગ એ મનની માંગ છે
 અને મન એની પૂર્તિ માટે
 શરીરને ઉશ્કેળા કરે છે.

એ સમ્યક્ સમજના માધ્યમે
 મનમાં ઉઠતી ક્રોધની લાગણીને જેમ
 નિયંત્રિત કરી હેવામાં આવે છે
 તેમ મનમાં ઉઠતી વાસનાના વિચારોને
 પણ સમ્યક્ સમજના સહારે
 નિયંત્રિત કરી હેવામાં અને
 વિખયાતરના માધ્યમે સંપૂર્ણ શાંત
 કરી હેવામાં અનેક આત્માઓને
 જ્વલંત સફળતા મળી છે અને
 આજે પણ જ્વલંત સફળતા
 મળી જ રહી છે.
 સંદેશ સ્પષ્ટ છે.


અન્ન-જળ-પ્રાણવાયુ શરીર માટે
 જે શરે અનિવાર્ય છે, વાસનાની
 સામગ્રી શરીર માટે એ શરે અનિવાર્ય
 નથી જ.

આ લોકોકતને અલગ અલગ અભિગમોથી
 સમજાવવાના અર્થ કરેલા પ્રયાસોમાં
 નાણે. અનાણે ક્રી જિનાશાયિદુદ્ધ
 કાંઈ પણ લખાણ થઈ ગયું હોય તે
 એવું હું ત્રિવિધ ત્રિવિધે
 મિરલામિ કુકકકં માયું છું.

ક.
 રતનજીવભુર



● ઝવેરાત ● ઝરખો
● ઝરણું ● ઝલક
● ઝાંખી
એટલે કે સાધુ/સાધવીજી/
શ્રાવક/શ્રાવિકા/
જેનેતર
લગભગ ૧૦૦૦ થી પણ
વધુ આત્માઓના
ગુણ વૈભવ પર
પ્રકાશ પાડતા
પુસ્તકનો સેટ



૧૦૦૦ રૂપિયાની કિંમતનો
પાંચ પુસ્તકનો સેટ

ફક્ત
૫૦૦
રૂપિયામાં

1

કિનારાની મર્યાદામાં રહીને વહેતી નદી અને કિનારાની મર્યાદા તોડીને વહેતી નદી વચ્ચે જે ફરક છે એ જ ફરક સદાચારથી નિયંત્રિત વાસના અને સદાચારહીન વાસના વચ્ચે છે.

સદાચાર નિયંત્રિત વાસના માણસને હજી 'માણસ' રહેવા દે છે, પણ સદાચારહીન, બેફામ અને બેકાબૂ બની જતી વાસના તો માણસને 'પશુ' ચાવત્ 'રાક્ષસ' બની જવા મજબૂર કરીને જ રહે છે.

ગાંડો હાથી સાંકળે સલામત, બેફામ મન સદાચારે સલામત.

2

'વાસનાનો સ્વભાવ અતૃપ્ત જ રહેવાનો છે' અનંત જ્ઞાનીઓના આ ઉપદેશને અસ્થિમજ્જા બનાવી દેવો એ 'જ્ઞાન' છે, પણ વાસનાના સ્થાન-સામગ્રી-સંગથી જાતને દૂર કરી દેવી એ તો 'બોધ' છે.

જાતને પૂછતા રહેવાની જરૂર છે-આપણે 'જ્ઞાન' સુધી જ અટકી ગયા છીએ કે પછી 'બોધ' સુધી પહોંચી ચૂક્યા છીએ ?



3

સૈનિકના હાથમાં ભલે ને AK 47 છે, પણ જો એના હૈયામાં એને ચલાવવાની હામ જ નથી તો એ દુશ્મનને હરાવી શકતો નથી.

વાસનાને કમજોર બનાવી દેતું સાધન મન ભલે ને આપણને હાથવગું જ છે, પણ એ સાધનને તાકાતપ્રદ પુરવાર કરતું મનોબળનું સામર્થ્ય જો આપણી પાસે નથી તો વાસનાને પરાસ્ત કરવામાં આપણને સફળતા મળવાની નથી જ.

4

ઘાણીમાં જોડાયેલ ઘાંચીનો બળદ ચાલે છે કદાચ સેંકડો કિલોમીટર પણ પહોંચતો ક્યાંય નથી.

ચગડોળમાં બેસતો બાબો કલાકો સુધી ધૂમતો રહે છે ચારે ચ બાજુ છતાં પહોંચતો ક્યાંય નથી.

રીંગ રોડ પર સાઈકલ ચલાવતો યુવક કલાકો સુધી સાઈકલ ફેરવતો રહે છે છતાં પહોંચતો ક્યાંય નથી.

વાસનાપૂર્તિનો આખો ચ માર્ગ ઘાણી જેવો છે, ચગડોળ જેવો છે, રીંગ રોડ જેવો છે. દોડવાનું ઘણું છે, પહોંચવાનું ક્યાંય નથી, પામવાનું કશું જ નથી.





5 ઉપાસનામાં લાગણી ઉપકારક છે, પણ વાસનામાં તો વિચારો જ ઉપકારક છે. કારણ ?

ઉપાસનામાં ફેલાઈ જવાનું છે જ્યારે વાસનામાં નિયંત્રિત રહેવાનું છે. મીઠાના સ્થાને જો સાકર નહીં જ તો વિચારના સ્થાને લાગણી નહીં જ.

6 ઢાળ જો ગંગાના પવિત્ર જળની પણ શરમ રાખતો નથી. ભૂકંપ જો તારક એવા જિનમંદિરની પણ શરમ રાખતો નથી. દાવાનળ જો નંદનવનની ચ શરમ રાખતો નથી તો વાસનાના નિમિત્તો ગમે તેવા સજ્જનની કે ઉત્કૃષ્ટ કોટિના સંતની પણ શરમ રાખતા નથી.

નીચે ઉતરતા અટકવું છે ? ગલત નિમિત્તો આગળ અટકી જ જો.



7

મનની એક ખાસિયત ખાસ સમજી રાખજો કે એને પ્રભુની વિદેયાત્મક આજ્ઞાઓના પાલનમાં કોઈ જ વાંધો નથી, એને જે પણ તકલીફ છે કે મુશ્કેલી છે એ નિષેધાત્મક આજ્ઞાઓના પાલનની જ છે.

વાસનાને આદીન ન બનવાની આજ્ઞા એ પ્રભુની નિષેધાત્મક આજ્ઞા છે અને મન એટલે જ એમાં અકળામણ અનુભવે છે.



8

લાકડું ફર્નિચર બને છે, કપાયા પછી જ. પથ્થર પ્રતિમા બને છે, તૂટ્યા પછી જ. ઘડો મજબૂત બને છે, આગમાં ગયા પછી જ.

જીવન સંસ્કારિત બને છે, મનની અનાદિની સુખશીલતાની અને સ્વચ્છંદતાની ચાલ પર અને માગ પર કાપ મૂક્યા પછી જ. આપણે એ માટે સજ્જ ખરા ?

9 આંખ પર ચશ્મા હોતા નથી ત્યારે તો આંખના કમજોરને ખાડામાં પડી જવાનું બનતું જ હોય છે, પણ આંખ પર ખોટા નંબરના ચશ્મા હોય છે ત્યારે ચ અને સાચા નંબરના ચશ્મા હોવા છતાં ચશ્માના કાચ પર ઘૂળ હોય છે ત્યારે ચ ખાડામાં પડી જવાનું બનતું હોય છે.

સમ્યક્ બોધનો અભાવ, વિપરીત બોધ અને સમ્યક્ છતાં મંદ બોધ મનને વાસનાના સુખ પાછળ પાગલ બનાવતો હોય એવી પૂરી શક્યતા છે.

એ અનિષ્ટથી ઊગરવાનો એક જ વિકલ્પ છે, સમ્યક્ સ્પષ્ટ બોધ!

10 વાસનાના જગતનું એક નમ્ર સત્ય બરાબર સમજી લેવા જેવું છે. મનની વાસના ક્ષેત્રની ઈચ્છાશક્તિ ભલે અનંત છે, પણ અનંત ઈચ્છાશક્તિની સામે વાસનાની સામગ્રી પ્રાપ્ત થાય એવી પુણ્યશક્તિ મર્યાદિત છે અને જે સામગ્રી પ્રાપ્ત થાય એને ભોગવવાની શક્તિ તો એથી ચ મર્યાદિત છે. આ સ્થિતિમાં તૃપ્તિની અનુભૂતિ શેની ?



11 વિધાર્થી કોની આજ્ઞામાં છે એ મહત્વનું નથી, નોકર કોની આજ્ઞામાં છે એ ય અગત્યનું નથી, શિષ્ય કોની આજ્ઞામાં છે એ ય પૂછવાની જરૂર નથી અને ભક્ત કોની આજ્ઞામાં છે એ જાણવાની પણ જરૂર નથી, પણ આપણું મન કયા અને કેવા વિચારોની આજ્ઞામાં છે એ જાણી લેવું અતિ જરૂરી છે.

કારણ ? એ વિચારો જ આપણને કાં તો રમાડવાના છે, કાં તો રખડાવવાના છે.



12 ઘોબીઘાટ એ જો વસ્ત્રો માટેનું ‘વિશોધિ સ્થળ’ છે. બાથરૂમ એ જો શરીર માટેનું ‘વિશોધિ સ્થળ’ છે. આગ એ જો સુવર્ણ માટેનું ‘વિશોધિ સ્થળ’ છે તો બ્રહ્મચર્ય એ આત્મા માટેનું ‘વિશોધિ સ્થળ’ છે.

જેણે પણ આત્માની વિશુદ્ધિને અનુભવવી છે એણે બ્રહ્મચર્યના શરણે આવ્યે જ છૂટકો છે.



13 ખીણ તરફ ઘકેલાતો પથ્થર જેમ ખૂબ ઝડપથી પોતાની ઉંચાઈ ગુમાવતો હોય છે તેમ વાસનાના વિચારોમાં જ આળોટતું અને અટવાતું, ભટકતું અને અટકતું મન ખૂબ ઝડપથી પોતાની ઉત્તમતા અને ઉદાત્તતા ગુમાવતું હોય છે. સાવધાન!

14 એવા અપરાધો જેમ બહુ થોડા હોય છે કે જેને આપણે જીવનમાંથી દૂર ન કરી શકીએ તેમ એવા ગલત વિચારો પણ બહુ થોડા છે કે જેને આપણે મનમાંથી રવાના ન કરી શકીએ. જરૂર છે માત્ર વિચારોની ટોચની દિશા બદલી દેવાની.



15 પાણીથી વેરાતો વિનાશ પૂરની અપેક્ષા રાખે છે, પણ આગથી વેરાતો વિનાશ દાવાનળની અપેક્ષા નથી રાખતો. એને માટે તો ચિનગારી જ કાઢી હોય છે.

વેરથી વેરાતો વિનાશ હજી ક્રોધના પૂરની અપેક્ષા રાખે છે, પણ વાસનાથી વેરાતો વિનાશ તો કેવળ સ્ત્રીકથાની ચિનગારીથી પણ શક્ય બની જતો હોય છે. એક કામ કરશું ?

જે ગામ જવું જ નહીં એનું નામ લેવું જ નહીં.



16 જે સુખ ભોગવટા પછી ખાલીપાની અનુભૂતિ કરાવી જતું હોય, મનને વિષાદગ્રસ્ત બનાવી દેતું હોય, એના સાતત્યને ત્રાસરૂપ બનાવી દેતું હોય અને ભવાંતરમાં અનેક અપાયને આમંત્રણ આપી બેસતું હોય એ સુખને ‘સુખ’નું લેબલ લગાવવું એ સુખનું અપમાન છે એવું નથી લાગતું ?



17

વાસનાના સુખ (?) ની અન્ય જે પણ વ્યાખ્યા હોય તે, પણ મુખ્ય વ્યાખ્યા આ છે કે 'બંધ મુકીનું સુખ એનું નામ છે વાસનાનું સુખ'. જ્યાં સુધી મુકી બંધ છે ત્યાં સુધી કલ્પનામાં સુખ અનુભવી શકાય છે, પણ મુકી ખૂલી જતાં જ કલ્પનાના સુખનું બાષ્પીભવન થઈ જાય છે.

18

સાથે જ આપણે જો વાસના પર નિયંત્રણો મૂકવામાં સફળ બન્યા રહેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે આપણે વિચારશીલ અને વિવેકશીલ બન્યા રહીએ. પ્રકાશની ઉપસ્થિતિમાં અંધકાર ગાયબ થઈને જ રહે છે એ આપણને યાદ તો ખરું ને ?

19 પીડાની ક્ષણોમાં માણસને ટકાવી રાખવાની જવાબદારી જો 'મન'ની છે તો પ્રલોભનોની ઉપસ્થિતિમાં માણસને અડીખમ ઊભો રાખી દેવાની જવાબદારી 'અંતઃકરણ'ની છે.

રોગ વખતે વકીલની સલાહ લેવાની ભૂલ જો ન જ કરાય તો પ્રલોભનોની ઉપસ્થિતિ વખતે મનની સલાહ લેવાની બેવકૂફી ન જ કરાય.

20 તીવ્ર ગતિથી ભાગી રહેલ ગાડીની ખતરનાક ગતિ માટે જો 'સ્પીડબ્રેકર' જ અવરોધક બની શકે છે, પૂર જોશમાં વહી રહેલ પાણી માટે જો 'ખડક' જ અવરોધક બની શકે છે તો, વાસનાના કળણમાં ખૂંપી જવા ઉતાવળા બની ગયેલ મનને 'વિવેક' જ અવરોધક બની શકે છે. આપણી પાસે આ વિવેક ખરો ?

21 નાનું કાણું મોટું વહાણ ફૂબાડી શકે છે. એક આંકડાની ભૂલ ગણિતના મોટા દાખલાને ખોટો પાડી શકે છે. ગળામાં થયેલ એક ગાંઠ ‘રામ નામ સત્ય છે’ બોલાવી શકે છે. વાસનાનો એક જ વિચાર, પવિત્રતાની વિશાળ પણ ઈમારતને ઘરાશયી કરી શકે છે.’

સાવધાન !



22 સીતાને રાવણ પ્રત્યે નફરતભાવ હતો અને એના રક્ષણની જવાબદારી રામે સ્વીકારી હતી અને નિભાવી હતી.

વાસનાના રાવણ પ્રત્યે આપણાં હૈયામાં જે નફરતભાવ હોય તો પ્રભુ આપણી પવિત્રતાની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારવા અને નિભાવવા તૈયાર છે.



23 સાગર જ્યારે શાંત હોય છે ત્યારે નાવિક ‘કોણ છે ?’ એની ખબર પડી જાય છે અને સાગર જ્યારે તોફાની હોય છે ત્યારે નાવિક ‘શું છે ?’ એની ખબર પડી જાય છે.

પતન માટે પ્રેરિત કરે એવા એક પણ નિમિત્તો હાજર હોતા નથી ત્યારે આપણે ‘કોણ છીએ’ એની ખબર પડી જાય છે અને પતન માટે ઉત્તેજિત કરી દેતા નિમિત્તો જ્યારે હાજર હોય છે ત્યારે આપણે ‘શું છીએ ?’ એની ખબર પડી જાય છે.

24 વરસાદ ભલે બે ઘડી માટે જ વરસે છે, પણ મંડપ પર પ્રસરી ગયેલ એનું પાણી કદાચ છ ઘડી સુધી ટપકતું રહે છે.

વિજાતીયનું દર્શન વિકારી આંખે ભલે બે પળ માટે જ થયું છે, પણ મનમાં એના વિચારો બાવીસ કલાક સુધી ચાલ્યા કરે એવી પૂરી શક્યતા છે. સાવધાન !






25 પાણી એક વાર માથા પરથી વહેવા લાગે પછી બે ફૂટ હોય કે બાર ફૂટ હોય એનાથી જેમ કોઈ જ ફરક પડતો નથી, તેમ પતનની ગર્તા તરફ ધકેલાઈ જવા મન તૈયાર થઈ જાય છે ત્યારે પતનના નિમિત્તો બે છે કે બાર છે ? પ્રલોભનો પાંચ છે કે પંદર છે ? કોઈ જ ફરક પડતો નથી. આ હકીકત આપણે સતત આંખ સામે રાખવાની જરૂર છે.



26 વાંઢાને વેવિશાળ કરવા મોકલો તો શક્ય છે કે એ જેમ પોતાનું જ કરી આવે, તેમ વિકારોની શાંતિ માટે તમે જો મન પાસે માર્ગદર્શન લેવા જાઓ તો શક્ય છે કે એ પોતે જ તમને વિકારોના જંગલમાં ભટકાવી દે.

સંદેશ સ્પષ્ટ છે. દૂધ લેવા બિલાડીને ક્યારેય ન જ મોકલાય.



27 વ્યક્તિ પ્રત્યેના ડંખથી મનને મુક્ત રાખવું એ તો બરાબર છે, મનને દંભમુક્ત રાખવું એ ચ બરાબર છે, પણ મનને દમન માટે સંમત કરવું અને સજ્જ રાખવું એ જીવનને પતનના માર્ગે જતું અટકાવવા અતિ જરૂરી છે.

કારણ ? ડફલાં ખાધા વિના ગઘેડો જો કામે લાગતો નથી, દોરીથી બંધાયા વિના વાંદરો જો સખણો રહેતો નથી તો પરાણે પણ મન પર નિયંત્રણો મૂકી દીધા વિના મન પણ સીધું રહેતું નથી.

દમન માટે આપણે તૈયાર ખરા ?



28 વાસનાના રસ્તા પર પા પા પગલી માંડી રહેલ મનને દોડતું કરી દેનારા પરિબળો બે છે. એક તો ગંદા ચિત્રો અને બીજા લબાડ મિત્રો.

ચિત્ર અને મિત્રની પસંદગીમાં જે પણ થાપ ખાઈ ગયો એ પોતાના ચિત્તને અને ચારિત્રને નિર્મળ કે પવિત્ર રાખી શકે એ વાતમાં કોઈ માલ નથી.

આજના કાળે ખરાબ ચિત્રની અને લબાડ મિત્રની ગરજ સારતા મોબાઈલના ઉપયોગમાં વિવેકને ગેરહાજર કરી દેવાની ભૂલ કરશો નહીં.

29 જેમાં નુકસાન નિશ્ચિત હોય અને લાભ શંકાસ્પદ હોય એવા ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલાં લાખ વાર વિચારવું તો પડેજ.

બસ, વાસનાનું ક્ષેત્ર આવું જ છે. એમાં પ્રવેશ કરી લીધા પછી જાતને કેટલી સલામત અને સ્વસ્થ રાખી શકાય એ પ્રશ્ન છે અને એટલે જ એમાં પ્રવેશ કરતા પહેલાં સ્વસ્થચિત્તે વિચારી લેવા જેવું તો છેજ.



30 સંસારમાં

કેટલાય અનિષ્ટો એવા છે કે

જેમને જીવનમાં પ્રવેશી જતાં આપણે અટકાવી શકતા તો નથી, પણ કદાચ એમના પર આપણે અંકુશ પણ જમાવી શકતા નથી છતાં એ અનિષ્ટોને સહજતાથી અપનાવી લેવાની ભૂલ તો આપણે ન જ કરાય ને ?

વાસના એ આવું અનિષ્ટ છે. મનને એ આકર્ષિત કરે છે, પણ એને આમંત્રણ તો ન જ અપાય ને ?



31 ચીકણા રસ્તા પર ચાલતા ચાલતા પડી જવાની સંભાવના જેમ અનેકગણી વધુ હોય છે તેમ પેટમાં મિષ્ટાન્ન-ફરસાણાદિ ચીકણાં અને તામસી દ્રવ્યો જ પધરાવતા રહીને બ્રહ્મચર્યનું પાલન પણ દુષ્કરવત્ બની રહેતું હોય છે.

વાંચી છે ને આ પંક્તિ ?

‘પાલો પત્તિ ખાતહે ઉન્હે સતાવે કામ,

નિશદિન હલવા નિગલતે ઉનકી જાને રામ’

સંદેશ સ્પષ્ટ છે. વિગઈત્યાગ એટલે વિકૃતિત્યાગ.

32 સતત સક્રિય રહેતા બાબાના હાથ વિષ્ટા તરફ ન જાય એટલા માટે મમ્મી એના હાથમાં કાં તો રમકડાં પકડાવી દેતી હોય છે અને કાં તો પીપર-ચોકલેટ!

સતત વિચારોમાં જ વ્યસ્ત રહેવા ટેવાયેલ મન ગંદા વિચારોમાં રમમાણ ન બન્યું રહે એ માટે એને સ્વાદિષ્ટ કોઈપણ શુભયોગોમાં રમમાણ રાખી દેવું અતિ જરૂરી છે.

ચાદ રાખજો, ખાઈ રહેલ કૂતરો ભસી શકતો નથી.



33 વાસનાના ક્ષેત્રે વિજતીય શરીરનું આકર્ષણ તો જોખમી બની જ શકે છે, પણ એ આકર્ષણ પણ જ્યારે બિનઅસરકારક પુરવાર થાય છે ત્યારે આંસુ ખતરનાક પુરવાર થાય એવી પૂરી શક્યતા છે.

લીમડાના રસથી નહીં મરતો માણસ ક્યારેક ગોળના પાણીથી મરી જતો હોય છે એવું તો સાંભળ્યું છે પણ આકર્ષણથી બચી ગયેલો આંસુથી પતી ગયો છે એવું તો આંખ સામે જોયું છે. સાવધાન!



34 શેરબજાર માટે એમ કહેવાય છે કે એ બજારમાં પ્રવેશવા માટે કદાચ ૩૬ ની છાતી જોઈએ છે, પણ એ બજારમાં પ્રવેશ કરી લીધા પછી નીકળી જવા તો ૫૬ ની છાતી જોઈએ છે.

વાસનાનું સુખ પણ આ શેરબજાર જેવું છે. એ સુખનો પ્રથમ વખતનો અનુભવ કદાચ ક્ષોભપૂર્વકનો હોઈ શકે છે, પણ એકવાર એ અનુભવ લઈ લીધા પછી એમાંથી બહાર નીકળી જવા તો પ્રચંડ સંકલ્પ બળ જોઈએ છે.

35 પ્રકાશનું પ્રવેશદ્વાર જેમ બારી છે, પ્રેમનું પ્રવેશદ્વાર જેમ આત્મીયતા છે, પુણ્યનું પ્રવેશદ્વાર જેમ ઉદારતા છે તેમ પાપનું પ્રવેશદ્વાર આંખ છે અને પતનનું પ્રવેશદ્વાર આકર્ષણ છે.

સાચે જ પાપથી બચવું છે ? આંખને નિયંત્રણમાં રાખો. સાચે જ પતનથી જાતને ઉગારી લેવી છે ? આંખને આકર્ષિત કરતા પદાર્થોને 'ના' પાડવાની હિંમત કેળવી લો.



36 સ્ટીમર ગમે એટલી મોટી કેમ નથી ? સાગર કરતા તો એ નાની જ રહેવાની. લાકડાઓની સંખ્યા ટનબંધ કેમ નથી ? આગની સામે એ મામૂલી જ રહેવાની. મડદાઓની સંખ્યા સેંકડોમાં કેમ નથી ? સ્મશાનની વિરાટતા સામે એ નાની જ રહેવાની.

ભોગ સામગ્રીઓના કપડાં ગમે એટલા વિરાટ અને અમાપ કેમ નથી ? વાસનાના શરીર સામે એ નાનાં જ છે અને ઓછા જ છે. વાસનાપૂર્તિની દિશામાં સમજીને આગળ વધજો.





37 જેમ આગને સળગવા હવા જોઈએ છે, પતંગિયાને જીવન સમાપ્ત કરવા દીવાની જ્યોત જોઈએ છે, ભ્રમરને બીડાઈ જવા પુષ્પની પાંખડી જોઈએ છે, માછલીને ફસાઈ જવા કાંટા પર આટો જોઈએ છે, હાથીને હોમાઈ જવા હાથાળીના સ્પર્શનું આકર્ષણ જોઈએ છે તેમ વાસનાને સળગતી અને ઘબકતી રહેવા રંગબેરંગી કલ્પના જોઈએ છે.



38 પેટ્રોલને પાણી સમજી લઈને લાગેલ આગને ઠારી દેવા એનો ઉપયોગ કરનાર સરવાળે જેમ આગને જ વધારી બેસે છે, સાગરના જળને ‘તૃપ્તિકારક જળ’ સમજી લઈને તૃષ્ણાને શાંત કરવા એનાં શરણે જનાર સરવાળે જેમ તૃષ્ણાને જ વધારી બેસે છે.

તેમ સામગ્રીઓને ‘વાસના પૂર્તિ’નું કારણ સમજી લઈને સામગ્રીઓના શરણે જનાર સરવાળે તો પોતાની વાસનાની ભૂખને વધારતો જ રહે છે.



39 આંખ સામે સર્પ આવી જાય છે ત્યારે માણસ સર્પને શેં પહોંચી વળવું એ વિચારતો નથી, પણ સીધો ભાગવા જ લાગે છે.

બસ, એ જ ન્યાયે આંખ સામે જ્યારે પતન માટેનું મનગમતું અને લપસણું પ્રલોભન ઉપસ્થિત થઈ જાય ત્યારે એને શી રીતે પહોંચી વળવું, એ વિચારવાને બદલે ત્યાંથી તરત ભાગી છૂટવું એ જ જાતને પતનથી ઉગારી લેવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.



40 એક નક્કર વાસ્તવિકતા આંખ સામે રાખજો કે, વાસનાના માર્ગે શરીર એક કલાકમાં પણ થાકી જાય છે જ્યારે મન અનંતકાળ પછી ચ થાકવાનું નામ નથી લેતું.

કાચબો સસલાની ગતિને પહોંચી વળે, હરણની ગતિને નહીં. શરીર પેટની ભોજનની ભૂખને પહોંચી વળે, મનની વાસનાની ભૂખને નહીં.

41 મનના કમજોરને વાસનાનું સેવન કદાચ અનિવાર્ય લાગતું હોય તો ય જીવનમાં એને 'ઈષ્ટ'નું સ્થાન તો ક્યારેય ન આપી શકાય.

એમ તો જેને ઝાડા થઈ ગયા હોય છે એને વારંવાર સંડાસમાં જવું અનિવાર્ય બની જતું હોય છે, પણ એટલા માત્રથી સંડાસમાં જતા રહેવાનું એને ઈષ્ટ તો નથી જ લાગતું ને ?

સંદેશ સ્પષ્ટ છે.

વાસનાને અનિવાર્ય અનિષ્ટની કક્ષામાં મૂકી દો.



42 પડછાયાને પકડવા જેણે પણ દોટ લગાવી છે કે પ્રબળતમ પુરુષાર્થ કર્યો છે એ તમામના નસીબમાં પછડાવાનું આવ્યું જ છે.

વિષયોનું સુખ એ પડછાયાનું સુખ છે. ન એની નીચે બેસીને હંડક અનુભવી શકાય કે ન એને પકડીને અમીરીનો અનુભવ કરી શકાય.

સાવધાન !



43 બધા જ બજારો છેલ્લે તો જેમ 'પેસા'ને જ મળે છે, બધી જ નદીઓ છેલ્લે તો જેમ સાગરને જ મળે છે તેમ બધી જ ઇન્દ્રિયો છેવટે તો 'સ્પર્શનેન્દ્રિય'ને જ બહેકાવતી રહે છે.

આનો અર્થ ?

આ જ કે જો તમે સ્પર્શનેન્દ્રિય સંયમ જાળવવા માગો છો તો તમારે બાકીની ચારેય ઇન્દ્રિયોનો સંયમ જાળવવો જ પડશે. એકાદ પણ ઇન્દ્રિયના સંયમ સાથે ગલત બાંધછોડ અને પવિત્રતાની સ્મશાનયાત્રા !



44 લોભાંધ ગમે તેટલો લોભને આધીન બનીને ગલત માર્ગે જાય પણ છે તો ય સમૂહ વચ્ચે એ ભારે તિરસ્કારપાત્ર બને જ છે એવું નથી, પણ કામાંધ વાસનાને આધીન બનીને ગલત માર્ગે જાય છે ત્યારે સમૂહ વચ્ચે એ ભારે તિરસ્કારપાત્ર બને જ છે.

કારણ ? લોભમાં શરીર નથી ખરડાતું જ્યારે વાસનામાં તો શરીર ખરડાઈને જ રહે છે.

45 ખોરાક, પાણી અને પ્રાણવાયુ એ ત્રણેય શરીરની જરૂરિયાત છે. તમે લાખ એની અવગણના કરો કે લાખ વિષયાંતર કરો, તમારે શરીરને એ બધું આપવું જ પડે, પણ વાસનાપૂર્તિ એ તો મનની માંગ છે. તમે એની અવગણના કરો કે એની સામે તમે વિષયાંતર કરો તો મન એની મેળે શાંત થઈ જ જાય.

ટૂંકમાં, પ્રાપ્તિ પછી તૃપ્તિ એ ક્ષેત્ર શરીરનું. ગમે તેટલી પ્રાપ્તિ પછીય અતૃપ્તિ એ ક્ષેત્ર મનનું!



46 આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન-આ ચાર સંજ્ઞામાં ચોથા નંબરની સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને કર્ણેન્દ્રિય-આ પાંચ ઇન્દ્રિયોમાં ચોથા નંબરની ઇન્દ્રિય છે ચક્ષુરિન્દ્રિય.

ચોથા નંબરની મૈથુન સંજ્ઞાને તથા ચોથા નંબરની ચક્ષુરિન્દ્રિયને જે વશમાં રાખવામાં સફળ થાય છે એ ચોથા નંબરના બ્રહ્મચર્યવ્રતના પાલનમાં સક્ષમ બનીને જ રહે છે.



47 આપણી અનાદિકાલીન મલિન વિષયો તરફની રતિને સમ્યક્ વિષયો તરફ કેન્દ્રિત કરી દેવામાં આપણે જો સફળ બનીએ છીએ તો નિશ્ચિત સમગ્ર રાખવું કે આપણે ‘સન્મતિ’ના સ્વામી બની ચૂક્યા છીએ.



48 આપણે જો એમ માની બેઠા હોઈએ કે ‘પેટમાં પઘરાવાતા દ્રવ્યો એ જ ભોજન છે’ તો આપણી આ માન્યતા ગલત છે. પાંચેય ઇન્દ્રિયો દ્વારા જે પણ ગ્રહણ કરવામાં આવે છે એ બધું જ જીવન માટે અને મન માટે ભોજનનું કામ કરી રહ્યું છે. જે પણ ગ્રહણ કરીએ, એમાં વિવેકને અચૂક હાજર રાખીએ. જીવન અને મન, બંને બચી જશે.

49 થાળીને કે ઘરને ખાલી રાખવામાં સફળતા મળી શકે છે, પણ મનને વિચારોથી ખાલી રાખવામાં સફળતા નથી જ મળવાની.


આ વાસ્તકિવતાને આંખ સામે રાખીને આપણે મનને સમ્યક્ વિચારોથી હર્થુ-ભર્થુ રાખવાનું છે.


એમાં જો થાપ ખાઈ ગયા તો ગલત-ગંદા વિચારોથી મન વ્યાપ્ત બન્યું જ સમજો.



50 ઈંટને ભટ્ટામાં પકવવા જ્યારે મૂકવામાં આવે છે ત્યારે ભટ્ટાની ચારે ચ બાજુ ‘છંટી’ કરી દેવામાં આવે છે કે જેથી આગથી સર્જાતી બાફ બહાર નીકળી જાય.

જીવનની પવિત્રતા ટકાવી રાખવા માગનારે પોતાના જીવનની આસપાસ સમ્યક્ નિયંત્રણોની છંટી કરી જ દેવી પડે છે. એમાં કરાતી ઉપેક્ષા, પવિત્રતાને જોખમાવીને જ રહે છે.





51 મઝ્મીનો મોટા ભાગનો સમય બાબાને સમજવામાં અને સમજાવવામાં જ જતો હોય છે, પણ આપણાં જીવનનો મોટા ભાગનો સમય મનને સમજવામાં અને સમજાવવામાં જ જો જતો હોય તો એ તો આપણાં જીવનની કરુણતા છે.

52 મનુષ્યને પશુથી અલગ પાડતો કોઈ એક માત્ર ગુણ હોય તો એ ગુણનું નામ છે, વિવેક.

અબ્રહ્મના સેવનમાં ય મનુષ્ય બન્યા રહેવું છે ? વિવેકને તો હાજર રાખી જ દો. અન્યથા માતેલા સાંઢ જેવા બની જશો. સાવધાન !

53 લપસતો પથ્થર લીસો જરૂર બની શકે, પણ પ્રતિમા તો એ ત્યારે જ બની શકે કે જ્યારે ટાંકણાના માર



ખાવાની એની સજ્જતા પણ હોય અને એનામાં ક્ષમતા પણ હોય.

વાસનાપૂર્તિ માટે એની સામગ્રીઓ પાછળ લપસતું રહેતું મન, સુંવાળું જરૂર બની શકે, પણ એ જો વંદનીય બન્યું રહેવા માગે છે તો વાસનાની સામગ્રીઓ સામે એણે પક ની છાતી દેખાડવી જ પડે છે.



54 બિલાડી પોતાની સામે જ રહેલ દૂધની તપેલીની અવગણના કરી શકે છે, પણ ઉંદર દેખાતા જ એના પર એ તૂટી પડે છે.

વાસનાલોલુપ માણસ એકવાર સંપત્તિના પ્રલોભન સામે આંખમીંચામણા કરી શકે છે, પણ વિજતીય શરીર દેખાતા જ એ પોતાની તમામ સૂઝ-બૂઝ ગુમાવી બેસે છે. સાવધાન !



55 કષાય ક્ષેત્રે કલ્પના એટલી ભયંકર નથી જેટલો ભયંકર સંકલ્પ છે જ્યારે વિષય ક્ષેત્રે સંકલ્પ એટલો ભયંકર નથી જેટલી ભયંકર કલ્પના છે.

વિષય ક્ષેત્રે અને ખાસ તો વાસના ક્ષેત્રે પતનની ગર્તા તરફ મનને ઘડેલાતું બચાવી લેવું છે ?

એ કામ કરો. એને કલ્પનાના કીચડમાં જવાની રજા આપો જ નહીં.

56 ચિનગારીને જો લાકડા આપવામાં નથી આવતા તો એ આપોઆપ બૂઝાઈ જાય એવી જેમ પૂરી શક્યતા છે તેમ મનમાં જાગતી વાસનાની ઈચ્છાને જો કલ્પનાનું બળ આપવામાં નથી આવતું તો વાસનાની એ ઈચ્છા આપોઆપ શાંત થઈ જાય એવી પૂરી શક્યતા છે. ઈચ્છાને આપણે કદાચ રોકી ન શકીએ, પણ કલ્પનાને તો અટકાવી શકીએ ને ?

57

જમીન પર દાણાંઓ વેર્યા

પછી માળી હજી કદાચ એને ભૂલી જાય છે, પણ
જમીન તો જેમ એને નથી જ ભૂલતી તેમ મનની ભૂમિ પર
વાસનાના બીજ વેરતા રહીને આપણે કદાચ ભૂલી પણ
જશું, પણ મનની ભૂમિ એને નથી જ
ભૂલવાની એ આપણે ખાસ યાદ
રાખવા જેવું છે.

58

‘નવરું

મન એ શેતાનનું કારખાનું છે’

આ ઊક્તિને આંખ સામે રાખીને મનને
નવરું ન પડવા દેતા કો’કને કો’ક સમ્યક્ કાર્યોમાં વ્યસ્ત
રાખીએ એ તો સારું જ છે, પણ વાસનાની આધીનતાથી બચવા
મનને નવરા લોકોની દોસ્તીથી પણ બચાવતા રહેવા જેવું છે.
કારણ ? નવરા લોકો પાસે નબળા વિચારો જ હોય છે જે
આપણી પથારી ફેરવી શકે છે.

59 શાંતિના સમયમાં લીધેલા

નિર્ણયો યુદ્ધના સમયમાં ટકાવી રાખવા હજી
કદાચ શક્ય બનતા પણ હશે, પણ જ્યાં લાગણીનો
અતિરેક આવી જાય છે ત્યાં ઊંચા આદર્શોનું ઉદ્ધન
થઈને જ રહેતું હોય છે અને ઉત્તમ આલંબનો
પણમૂલ્યહીન પુરવાર થઈને જ રહેતા હોય
છે. સાવધાન!



60 સપનામાં ફૂલના દર્શન અને
જાગતા હાથમાં કાંટા...કલ્પનામાં
નંદનવન અને વાસ્તવિકતામાં
ઉકરડો, શરીર પરના અલંકારો સોનાના
અને ચામડી કૅન્સરથી ગ્રસ્ત, શબ્દોમાં
સોહામણી અને અનુભવે બિહામણી, આગળ
ઉત્તેજના અને પાછળ વિષાદ.

આવી જે એક જ ચીજ, એનું નામ
વાસના.

61 સંપત્તિના ખુલ્લેઆમ પ્રદર્શન પછી પણ ‘મારી સંપત્તિને સુરક્ષિત રાખી દેવામાં કોઈ જ તકલીફ નહીં પડે’ આપું માનનાર યુવક અને રૂપના ખુલ્લેઆમ પ્રદર્શન પછી પણ ‘મારા શીલને સાચવવામાં મને લેશ પણ વાંધો નહીં આવે’ આપું માનનાર યુવતિ બંને જણા મૂર્ખાઓના સ્વર્ગમાં જ રાચે છે એમ કહેવું જ પડશે.



62 વાસનાને મિત્ર બનાવો, વાસના પથારી ફેરવી નાખે. વાસનાને દુશ્મન બનાવો, વાસના પછાડી નાખે. વાસનાનું શરણું સ્વીકારી લો, વાસના ખતમ કરી નાખે, પણ અંતરમાં ઉપાસનાની પ્રતિષ્ઠા કરી દો. વાસના ચાલતી પકડે.

63 ઉત્તમ લક્ષ્યને આંબી જવામાં આપણે સફળ ન બનીએ એ આપણાં જીવનની કરુણતા નથી, પણ અદમ લક્ષ્યને આંબી જવામાં આપણે સફળ બની જઈએ એ આપણાં જીવનની કરુણતા છે.

વાસનાને વશમાં રાખવામાં મળતી નિષ્ફળતા એ જીવનની કરુણતા નથી, પણ વાસનાને છુટ્ટો દોર આપી દેવામાં મળતી સફળતા એ જીવનની કરુણતા છે.



64 યુદ્ધ પહેલા તો મનમાં આકાર લેતું હોય છે. કેટલીય વાર મનમાં યુદ્ધ ખેલાયા પછી જ મેદાનમાં ખેલાતું હોય છે.

વાસનાજન્ય પતન સૌ પ્રથમ તો મનમાં આકાર લેતું હોય છે અને સેંકડો વખતના માનસિક પતન પછી એ કાયામાં રૂપાંતરિત થતું હોય છે.

પણ સબૂર ! માનસિક પતન પણ ગલત નિમિત્તના દર્શન-આકર્ષણ વિના સંભવિત બનતું નથી. સાવધાન !

65 ઘોડાને વશમાં રાખવા લગામ જોઈએ અને હાથીને વશમાં રાખવા અંકુશ જોઈએ એની તો આપણને ખબર છે, પણ એ લગામ અને એ અંકુશ જેના હાથમાં હોય એ ઘોડેસવાર પાસે અને મહાવત પાસે બળ અને આવડત જોઈએ એની આપણને ખબર છે ખરી ?

વાસનાને વશમાં રાખવા મનોબળ મક્કમ જોઈએ એ તો બરાબર છે, પણ એ મનોબળ પણ સમ્યક્ સમજપૂર્વકનું જોઈએ એ આપણે સતત આંખ સામે રાખવાનું છે.



66 સારો માણસ ખરાબ સમયમાં વધુ સારો થતો જાય છે જ્યારે ખરાબ માણસ સારા સમયમાં વધુ ખરાબ થતો જાય છે.



આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને આપણે ખુદનું સતત આત્મનિરીક્ષણ કરતા રહેવાનું છે.

જો સારા સમયમાં મનમાં નબળા જ વિચારો ચાલતા હોય તો પ્રલોભનોના સ્થળથી વિના વિલંબે આપણે જાતને દૂર રાખતા જવાની જરૂર છે. અન્યથા જીવન ગંદવાડગ્રસ્ત બનીને જ રહેશે.

67 પાણીની તરસનું અને તૃપ્તિનું મિલન હજી શક્ય છે. ભોજનની ભૂખનું અને તૃપ્તિનું મિલન પણ હજી શક્ય છે, પણ વાસનાની તરસનું અને તૃપ્તિનું મિલન તો સર્વથા અશક્ય છે.

કારણ ? વાસનાની તરસ એ મનની તરસ છે અને એને છિપાવવા જે શરીરના શરણે જવું પડે છે એ શરીર સંખ્યાબંધ મર્યાદાઓને લઈને બેઠું છે.

શું કહું ? લીટરથી દૂધ મપાય, મીટરથી કાપડ મપાય, પણ સામગ્રીથી વાસના તૃપ્ત ન કરી શકાય.



68 આ જગતના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જડ પદાર્થો કદાચ વધુ છે તો ચદુર્લભ તો નથી જ.

જ્યારે પવિત્રતાના

આસમાનમાં વિહરતા રાખતા ઉત્તમ વિચારો વધુ છે જ, પણ સાથોસાથ દુર્લભ પણ છે. આપણે આ જીવનમાં એ દિશામાં જ પ્રયત્નશીલ બન્યા રહેવાની જરૂર છે.

69

બારી-બારણાં ખુદાં

રાખીને સૂઈ જવાનો કરેલ પ્રમાદ જો સંપત્તિના ચોરાઈ જવાનું કારણ બની શકે છે, બૉલને સમજવામાં બેંટ્સમેન તરફથી થઈ જતો પ્રમાદ જો બેંટ્સમેનની કારકીર્દિ પર પૂર્ણવિરામ મૂકાઈ જવાનું કારણ બની શકે છે, તો અબ્રહ્મના સેવન માટે પાંચેય ઈન્દ્રિયોને છૂટો દોર આપી દેવાનો થતો પ્રમાદ આત્મગુણોના લૂંટાઈ જવાનું કારણ બની શકે છે.



70

વિષ્ટા ખરાબ છે જ એટલું જ નહીં, પણ આપણને એ ખરાબ લાગે પણ છે અને એટલે જ એનાથી જાતને દૂધ રાખવા કડક નિયંત્રણોની જરૂર પડતી નથી, પણ વાસના ખરાબ હોવા છતાં આપણને એ સારી જ લાગે છે અને એટલે જ એનાથી જાતને દૂર રાખવા કડક નિયંત્રણો રાખવા અતિ જરૂરી છે. આપણે આ માટે સજ્જ ખરા ?

71 ચંદન ગમે તેટલું

શીતળ હોય કે સુપાસિત હોય,
પોતાનામાં પડેલ આ ક્ષમતાને બહાર
લાવવા એણે ઘસાવું તો પડે જ છે.

પથ્થર ગમે તેટલો આકર્ષક કે મુલાયમ હોય,
પોતાનામાં 'પ્રતિમા' બનાવવાની પડેલ ક્ષમતાને બહાર લાવવા
એણે ઘડાવું તો પડે જ છે.

મનમાં આત્માને પરમાત્મા બનાવી દેવાની પડેલ
ક્ષમતાને બહાર લાવવા ઈન્દ્રિયોને ઘસાવું પણ પડે
છે અને મનને ઘડાવું પણ પડે છે.



72 કડવાશ એ કારેલાનો દુર્ગુણ નથી, પણ સ્વભાવ છે.

દુર્ગંધ એ વિષ્ટાનો દુર્ગુણ નથી, પણ સ્વભાવ છે. તીખાશ એ
મરચાનો દુર્ગુણ નથી, પણ સ્વભાવ છે. બસ, એ જ ન્યાયે
અતૃપ્તિ એ વાસનાનો દુર્ગુણ નથી, પણ સ્વભાવ છે.

ચાદ રાખજો, દુર્ગુણને તો હજી પડકારી
શકાય છે, પણ સ્વભાવનો તો કોઈ જ
ઈલાજ નથી. સાવધાન !

73 કબૂલ, અવાજ માઈકના કારણે ખૂબ દૂર સુધી સંભળાય છે અને માઈક પાછળ ઊભો રહેલો બોલ્યા જ કરે છે. એક કામ કરીએ, માઈક બંધ કરી દઈએ, અવાજ ઘીમો થઈ જશે.

કબૂલ, મનમાં વિકારો જાગ્યા જ કરે છે. આપણે એક કામ કરીએ. આંખના માઈકની સ્વીચ બંધ કરી દઈએ. ખૂબ દૂર સુધી ફેલાતા વિકારો અચૂક નિયંત્રિત થઈને જ રહેશે.

74 પાણીનો

પ્રત્યેક ઘૂંટ તૃષાને
ઓછી કરે છે. ભોજનનો
પ્રત્યેક કોળિયો ભૂખને
ઓછી કરે છે, પણ વાસનાશાંતિનો પ્રત્યેક
પ્રયાસ વાસનાની આગને શાંત કરવાને બદલે આગને વધુ ને વધુ
પ્રજ્જ્વલિત કરનારો બની રહે છે.

આ વાસ્તવિકતા એટલું જ સૂચવે છે કે કાંટો કદાચ કાંટાથી
નીકળતો હશે, લોખંડથી કદાચ લોખંડ કપાતું હશે, પણ ભોગથી
ભોગો ક્યારેય શાંત થતા નથી, ક્યારે પણ નહીં.



75 બીજા પર આક્રમણ કરવાની ક્ષમતા કીડી-મંકોડા પાસે ભલે નથી હોતી, પણ પોતાનું રક્ષણ કઈ રીતે કરવું એની ક્ષમતા તો એમની પાસે હોય જ છે.

વાસના પર આક્રમણ કરતા રહીને એને હરાવી દેવાની ક્ષમતા આપણી પાસે ન પણ હોય તો ય એના હુમલા વખતે જાતનું રક્ષણ કરી લેવાની ક્ષમતા તો આપણી પાસે હોવી જ જોઈએ.



76 જે સુખના કેન્દ્રમાં માત્ર શરીર જ હોય છે એ સુખ કોઈ પણ પળે દુઃખનું કે કંટાળાનું કારણ બનવાનું જ છે.

કારણ ? શરીર ક્ષણભંગુર છે, કોઈ પણ પળે એ રોગનું કારણ પણ બની શકે છે તો થાકનું કારણ પણ બની શકે છે.

પાણીના રંગબેરંગી પરપોટાના આકર્ષણમાં સરવાળે આંસુ જ બચે છે એ ખાસ યાદ રાખવું.

77 જે સુખના નિર્ણયના કેન્દ્રમાં મન જ હોય છે એ સુખ પાછળ પસ્તાવાનું પાકું જ છે.

કારણ ? મન પરિવર્તનશીલ છે અને ડગલે ને પગલે પોતાના નિર્ણયો બદલાવતું જ રહે છે.

કાર્યીંડાના કોઈ પણ એક રંગની સ્થિરતા પર દાવ લગાડનાર બુકી જે જીતી જાય તો વાસનાના સુખને પામી લેવાનો નિર્ણય કરનાર મન સુખને પામી જાય.



78 આસક્તિ અને વિરક્તિ વચ્ચે આમ તો અનેક તફાવતો છે, પણ મુખ્ય તફાવત એ છે કે શક્તિની ક્ષતિ કરે એનું નામ આસક્તિ છે અને શક્તિની પૂર્તિ કરે એનું નામ વિરક્તિ છે.

એ જ રીતે વ્યક્તિને દાતા બનાવી દે એનું નામ વિરક્તિ છે તો વ્યક્તિને ભિખારી બનાવતી રહે એનું નામ આસક્તિ છે.

આપણે આસક્તિના શિકાર ? કે પછી વિરક્તિના માલિક ?

79 આવેશ-આસક્તિ-અતિરેક અને અવિવેક આ ચંડાળ ચોકડી વાસનાના વેગનું આવેગમાં રૂપાંતરણ કરીને જ રહે છે અને વેગ જ્યારે આવેગમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે સિવાય હાહાકાર બીજું કશું જ બચતું નથી.

ચિનગારી વેગ છે જ્યારે દાવાનળ આવેગ છે...ભરતી વેગ છે જ્યારે પૂર આવેગ છે...તલવાર વેગ છે જ્યારે બૉમ્બ આવેગ છે...સોય વેગ છે જ્યારે એ.કે. ૪૭ આવેગ છે.

સાવધાન !



80 વાસનાનું ઉત્પાદક કેન્દ્ર મન છે અને મનની સૌથી મોટી વિલક્ષણતા એ છે કે એ મલિન તો છે જ, પણ એના કરતાં ય વધુ તો ચંચળ છે.

કચરો એકલો મલિન જ હોય તો એટલો નુકસાનકારક નથી બનતો, પણ મલિન સાથે ચંચળ પણ હોય છે ત્યારે સર્વત્ર ફેલાતો રહીને એ ખતરનાક બની શકે છે.

વાસનાગ્રસ્ત મન મલિન જ હોય છે, પણ વાસનાના પાત્રો બદલતું રહેતું મન તો ચંચળ પણ હોય છે.

રેકરુણતા !





81 આપણાં ઘરમાં સજ્જનો ભલે ને પચાસની સંખ્યામાં આવી રહ્યા છે, આપણે રાજી જ થવા જેવું છે અને દુર્જન ભલે ને

એક જ આવી રહ્યો છે, આપણે ચેતી જવા જેવું છે.

જે વાત ઘર માટે સમજવાની છે, મન માટે પણ એ જ વાત સમજવાની છે. પવિત્રતાના વિચારો ૫૦૦ આવતા હોય તો રાજીના રેડ થતા રહેવાનું છે અને અપવિત્રતાનો વિચાર એક પણ આવતો હોય તો સાવધ થઈ જવા જેવું છે.

વિષ્ટાનો એક જ કણિયો પુષ્પોની સુવાસને હરાવી દેતો હોય છે.



82 ખેતરમાં પડી જતી તિરાડને પૂરી દેવાની મહેનત કોઈ જ ખેડૂત કરતો નથી અને કરવા જાય છે તો એના લમણે હતાશા સિવાય બીજું કશું જ ઝીંકાતું નથી. ખેતરમાં પાણી આવી જાય છે અને બધી જ તિરાડો આપોઆપ પૂરાઈ જાય છે.

મનમાં ઉદ્ભવતી વાસનાની પ્યાસને બુઝવવાના પ્રયાસોમાં કોઈનેય સફળતા મળતી નથી. ઉત્તમની ઉપાસનાનું જળ મનમાં આવી જાય છે અને વાસનાની પ્યાસ આપોઆપ શાંત થઈ જાય છે.



83 પીડા અને પ્રલોભન વચ્ચેનો એક મહત્વનો તફાવત ખાસ આંખ સામે રાખવાની જરૂર છે.

પીડા માણસને ઘરની અંદર રહેવા મજબૂર કરે છે જ્યારે પ્રલોભન માણસને ઘરની બહાર નીકળી જવા મજબૂર કરે છે.

સાચે જ બ્રહ્મચર્યપાલનને સહજ બનાવવું છે ? પ્રલોભનથી દૂર રહો અને એ માટે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો.



84 જે લાકડું કપાવા તૈયાર ન થાય એ લાકડું કાં તો સ્મશાનમાં જાય અને કાં તો ચૂલામાં જાય.

વાસનાગ્રસ્ત મન જો કપાવા અર્થાત્ સંસ્કારિત થવા તૈયાર ન થાય તો જીવન કાં તો અમાસના અંધકારનું પ્રતિનિધિત્વ ધરાવતું થઈ જાય અને કાં તો ગટરના ગંદવાડનું પ્રતિનિધિત્વ ધરાવતું થઈ જાય.

મનને સદ્ગતિગામી બનાવવું છે ? એને સંસ્કારિત કરતા રહેવામાં પાછા ન પડો.

85 આપણને હરાવતા રહે એ જો વિષયો છે તો આપણને
હંફાવતા રહે એ કષાયો છે.

જે પણ વ્યક્તિ પાસે મનોબળ મક્કમ છે એ જ વિષયો
સામે જીતતો રહે છે અને જેની પાસે સમજ સમ્યક્ છે એ જ
કષાયોને પડકારવામાં સક્ષમ બનતો રહે છે.

ચાદ રાખજો, મજબૂત દુશ્મનોને જીતવા
દરેક વખતે બળ જ કામ નથી લાગતું,
ક્યારેક છળ અને કળ પણ જોઈએ છે.

86 જીવનને ગલતની દિશામાં જતું
અટકાવવા અનુભવ લેવાની જરૂર
નથી, પણ અનુભવીના અનુભવોને
આંખ સામે રાખવાની જરૂર છે.

સહરાના રણમાં ‘પાણી’ મળી
ગયાના અનુભવો કદાચ હરણો પાસે
છે, પણ વાસનાના જંગલમાં તૃપ્ત થઈ
ગયાના અનુભવો તો એક પણ
વાસનાલંપટ પાસે નથી. આપણે
એમાંથી કંઈક શીખ્યા ખરા ?

87 વેલણને ફરતા રહેવાની છૂટ છે, પણ પાટલાને છોડીને તો નહીં જ. ધજાને અલગ અલગ દિશા તરફ ફરકવાની છૂટ છે, પણ દંડને છોડીને તો નહીં જ. ટ્રેનને દોડતા રહેવાની છૂટ છે, પણ પાટાને છોડીને તો નહીં જ.

બસ, એ જ ન્યાયે સમ્યક્ રસ્તે વાસનાને નિયંત્રણમાં રાખવાની છૂટ છે, પણ વ્યભિચારના કે સ્વચ્છંદતાના માર્ગે તો નહીં જ. બળદ હજી સુરક્ષિત રહી જાય છે, પણ સાંઢ ? એ તો માર જ ખાય છે.

88 વજનદાર ગાંસડીને બાંધવામાં કમજોર દોરડું કામ આવી જશે, પણ એ ગાંસડીને ઉપાડવાની વાત આવશે ત્યાં કમજોર દોરડું નપુંસક પુરવાર થઈ જશે.

કમજોર મન પણ પવિત્રતાના વિચારોમાં રમમાણ તો બની શકશે, પણ પ્રલોભનોની ઉપસ્થિતિમાં પવિત્રતાને ટકાવી રાખવામાં તો મક્કમ અને દૃઢ મનોબળને જ સફળતા મળશે.

89

કષાયવિજયના ક્ષેત્રે સફળ બનવું છે ? એક કામ ખાસ કરો. મનની આગળ 'ન' મૂકી દો. જ્યાં મન 'નમન' માટે તૈયાર થઈ ગયું ત્યાં નમ્રતા આવી અને કષાયો ગયા જ સમજો. વિષયવિજયના ક્ષેત્રે સફળ બનવું છે ? એક કામ ખાસ કરો. મનની પાછળ 'ન' મૂકી દો. જ્યાં મન 'મનન' માટે તૈયાર થઈ ગયું ત્યાં વિવેક આવ્યો જ સમજો અને વિવેક આવ્યો ત્યાં વાસના મોળી પડી જ સમજો.

90

કુસ્તીમાં જમીન પર પડી જનાર હારી ગયેલ ગણાતો નથી, પડી ગયા પછી ઊભો ન થનાર હારી ગયેલ ગણાય છે.

મનમાં વાવાઝોડાની જેમ ત્રાટકતા વાસનાના વિચારો સામે ઝૂકી જનાર કમજોર નથી, પણ હંમેશ માટે ઝૂકતો અને ઝૂકેલો રહેનાર જ કમજોર છે.

પડીએ ભલે, પણ પડ્યા તો ન જ રહીએ. ફાવી જશું.

91 કોઈ પણ સેનાધિપતિને યુદ્ધમાં જો વિજેતા બનવું છે તો એની મુખ્ય શરત આ છે કે એણે પોતાની તાકાતની જાણકારી રાખવાને બદલે દુશ્મનની નબળી કડીની જાણકારી મેળવી લેવી પડે છે.

વાસનાવિજેતા બની જ રહેવું છે ? વાસનાની બે નબળી કડી-વિવેક અને અનુરાગ-એને બરાબર જાણી લો અને સમજી લો.



92 જેના સ્મરણમાં મનમાં ગલગલિયાં અનુભવાતા હોય છે એનાં દર્શન માટે મન ઉત્તેજિત બન્યું જ રહેતું હોય છે અને જ્યાં એનું દર્શન થઈ જાય છે ત્યાં એના સ્પર્શન માટેની લાલસા મનમાં જાગી જ જતી હોય છે.

કદાચ આ જ કારણસર વિષયોને શાસ્ત્રકારોએ વિષ કરતાં ભયંકર કહ્યા છે. વિષ પેટમાં ગયા પછી મારે છે.

વિષયો મનમાં આવતા જ પવિત્રતાને ખતમ કરવા લાગે છે.



93

પ્રશ્નપત્રમાં આવતા ‘ખાલી જગા પૂરો’ના પ્રશ્નનો વિદ્યાર્થી કોઈ જ જવાબ ન લખે અને એ પછી ચ પરીક્ષામાં એ પાસ થઈ જાય એ સંભવિત છે.

પણ મન પાસે જ્યારે ‘ખાલી જગા પૂરો’નો પ્રશ્ન આવે છે ત્યારે એણે એ પ્રશ્નનો સાચો જવાબ જ લખવો પડે છે અને ત્યારે જ જીવનની પરીક્ષામાં એ પાસ થાય છે.



94

જમીન પર રહેલા ખાડાને ગંદા પાણીથી કે કચરાથી ભરાતા બચાવી લેવો છે ? એ ખાડાને સ્વચ્છ પાણીથી કે માટીથી પૂરી દેવો જ રહ્યો.

મનને વરવા વિચારોનું શિકાર બનતું અટકાવવું છે ? એને નવરું રાખવાથી બચવું જ રહ્યું.

ચાદ રાખજો, કડવું મન હજી એટલું બધું ભયંકર નથી પણ બનતું, પણ નવરું મન તો જીવનની પવિત્રતા માટે અણુબોંબનું જ કામ કરે છે !

95 કેટલાક પાપો એવા છે કે જે સ્મૃતિપથ પર આવતાં મન વિષાદથી ઘેરાઈ જતું હોય છે તો કેટલાક સુખો એવા છે કે જે સ્મૃતિપથ પર આવી પણ જતા હોય છે તો ય મન એના પુનરાવર્તન માટે કાંઈ ઉત્સાહિત કે લાલાયિત નથી બની જતું, પણ અબ્રહ્મસેવનનું પાપ કહો તો પાપ અને સુખ કહો તો સુખ એવું છે કે જે સ્મૃતિપથ પર આવી જાય છે તો ય ગલગલિયા કરાવતું રહે છે અને એના પુનઃ સેવન માટે મનને ઉશ્કેરતું રહે છે. આ જ કારણસર એનાં સ્મરણનો નિષેધ છે.



96 આગ અને પોલાદનો સહવાસ પોલાદના અસ્તિત્વ માટે પ્રશ્નાર્થચિહ્ન નથી બની રહેતો, પણ આગ અને મીણનો સહવાસ તો મીણના અસ્તિત્વ પર પૂર્ણવિરામ મૂકીને જ રહે છે.

બે વિજાતીય શરીરોના સહવાસ એ આગ અને મીણના સહવાસ જેવો છે. બે-રોકટોક એ સહવાસમાં જો આગળ વધવાનું બન્યું તો કોઈપણ પળે વિવેકાન્ધતાના રસ્તે પવિત્રતાના અસ્તિત્વ પર પૂર્ણવિરામ મૂકાઈ જવાનું પાકું જ છે. પવિત્રતા ટકાવી રાખવી છે ? જવાબ સ્પષ્ટ છે.

97

રસનેન્દ્રિયનું સુખ

કર્ણોન્દ્રિય દ્વારા નથી જ

અનુભવાતું. ઘ્રાણોન્દ્રિયના સુખને

અનુભવવા ચક્ષુરિન્દ્રિયનું સરનામું કામ નથી

જ લાગતું. કર્ણોન્દ્રિયના સુખની અનુભૂતિ માટે ઘ્રાણોન્દ્રિયનું શરણું

કામ નથી જ લાગતું, પણ સ્પર્શનેન્દ્રિય તો સંપૂર્ણ શરીરવ્યાપી

હોવાના કારણે કોઈ પણ ઇન્દ્રિયના સરનામે એનાં સુખ-દુઃખની

અનુભૂતિ આત્માને થતી જ રહે છે.

કદાચ આ જ કારણસર સ્પર્શનેન્દ્રિય કેન્દ્રિત બ્રહ્મચર્યનું પાલન અતિ દુષ્કર લાગી રહ્યું છે.



98

મેદાનની કિઝ અને મર્યાદાની કિઝ વચ્ચેનો એક મહત્વનો તફાવત ખાસ આંખ સામે રાખવાનો છે કે-

મેદાનની કિઝની બહાર નીકળી ગયા પછી પુનઃ કિઝની અંદર આવી જવામાં ખેલાડીને બહુ વાંધો આવતો નથી, પણ મર્યાદાની

કિઝની બહાર નીકળી ગયા પછી પુનઃ એ કિઝની

અંદર આવી જતાં તો વ્યક્તિને

નવનેજાં પાણી ઉતરી જતા હોય

છે. વધુ સારું એ છે કે મર્યાદાની

કિઝ ક્યારેય ઓળંગીએ જ

નહીં.





99 ‘અભાવ’ના દુઃખને તો હજી કદાચ પહોંચી વળાય છે. ‘અલ્પતા’ના દુઃખને પણ હજી કદાચ પહોંચી વળાય છે, પણ ‘આભાસ’ના સુખને તો કોઈ કાળે પહોંચી શકાતું નથી.

‘વાસના દુષ્પૂર છે’ કારણ ? એ આભાસનું સુખ છે.



100 કંઠની તૃષા જળ તરફ દોડાવે છે અને જળ મળતા તૃષા શાંત પણ થઈ જાય છે, પણ વાસનાની તૃષ્ણા તો મૃગજળ તરફ દોડાવે છે અને શરીર લાકડા ભેગું થઈ જાય છે ત્યારે પણ એ શાંત થવાનું નામ નથી લેતી.





101 પુરુષનું શરીર એ પુરુષની સંપત્તિ નથી, પણ સ્ત્રીનું શરીર એ તો સ્ત્રીની સંપત્તિ છે અને એ ચ એવી સંપત્તિ છે કે એ જ્યાં જાય ત્યાં એની સાથે જ જાય છે અને એટલે જ હવસખોર પુરુષોથી એને બચાવતા રહેવું એ એને માટે બહુ મોટો પડકાર બની રહે છે.



102 શરીરક્ષેત્રે ઊભી થતી વેદના વધુમાં વધુ શરીરને લમણે અશાતા ઝીંકે છે, પણ મનના ક્ષેત્રે ઉદ્ભવતી વાસના તો મનને વિષાદનું શિકાર બનાવીને મનની પ્રસન્નતાને તહસ-નહસ કરી નાંખે છે.

વિષાદને આમંત્રણ આપીને જ રહેતી વાસના સાથે આપણી દોસ્તી શેની ?






103 છિદ્રને બાકોરું બનતા અને તિરાડને ખાઈ બનતા હજી સમય લાગે છે, પણ અપરાધને પાપ બનતા અને પાપને પતન બનતા તો કોઈ જ વાર લાગતી નથી.


આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને આપણે પતનના પ્રથમ પગથિયે જ અટકી જવા જેવું છે.




104 ભાખરીની કોર ખાઈ લીધા પછી આખી ભાખરી ખાઈ લેવાનું મન જેમ થઈને જ રહે છે તેમ રૂપનું આકર્ષણ અંદરમાં સ્પર્શની ઈચ્છા જગાડીને જ રહે છે.

સંદેશ સ્પષ્ટ છે. સ્પર્શસંયમના માલિક બનવું છે ? રૂપસંયમના સ્વામી બનીને જ રહો.





105 જે સુખ વંદનીય પણ ન હોય અને અનુકરણીય પણ ન હોય એ સુખ ગમે તેટલું રમણીય દેખાતું પણ હોય તો ય એને કરણીય પણ બનાવવા જેવું નથી અને રમણીય પણ બનાવવા જેવું નથી. અબ્રહ્મના સુખનો સમાવેશ આવા સુખમાં થાય છે.



106 ઘરના ડ્રોઇંગરૂમને સાફ રાખવાનું મન થયા કરે છે કારણ કે એના પર સહુની નજર હોય છે, પણ માળિયાને સાફ રાખવાનું મન લગભગ થતું નથી કારણ કે ત્યાં કોઈની ય નજર હોતી નથી.

વાસનાના વિચારો એ મનના માળિયાની પેદાશ છે. ખૂબ સમજીને એને અપનાવજો.

107 ભૂલનો ચહેરો ગમે તેટલો માસૂમ હોય તો પણ એનું પરિણામ બહુ ભયંકર આવી શકે છે.

એમ તો ચિનગારીનું કદ બહુ નાનું હોય છે છતાં એ જો દાવાનળને જન્મ આપી શકે છે તો વાસનાક્ષેત્રનું એકાદ વખતનું નાનકડું પણ સ્ખલન વરસોથી જાળવેલ આબરૂ પર પાણી ફેરવી શકે છે. સાવધાન!



108 એમ કહેવાય છે કે ઘુવડને સૂર્યના પ્રકાશમાં કશું દેખાતું નથી તો કાગડાને રાતના અંધકારમાં કશું દેખાતું નથી, પણ જે કામાંઘ હોય છે એને તો દિવસે કે રાતે કશું જ નથી દેખાતું.

કશું જ નથી દેખાતું એટલે ? આ જ કે સારાસારનો એ વિવેક જ નથી કરી શકતો. નિંદ્ય-અનિંદ્ય વચ્ચેનો ભેદ એ સમજી નથી શકતો. આવી કામાંઘતાથી સાવધાન!



109 આપણી પાસે પદ કોઈ પણ હોય, વડાપ્રધાનનું હોય કે રાષ્ટ્રપતિનું હોય, ડૉક્ટરનું હોય કે વકીલનું હોય, અરે, સજ્જનનું હોય કે સંતનું હોય, આપણાં જીવન માટે નિર્ણાયક તો આપણું પોતાનું મન જ બનવાનું છે.

આનો અર્થ ? આ જ કે જો આપણાં મનને સાચવવામાં આપણે સફળ બન્યા રહ્યા તો આપણું પદ ગૌરવવતું બન્યું રહેવાનું. અન્યથા ?

.....

110 બહિર્જગતમાં વ્યક્તિની રક્ષા એની પાસે કયું પદ છે ? એના આધારે થાય છે. વિધાન સભ્ય, સંસદ સભ્ય, મુખ્યપ્રધાન, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ-ઉત્તરોત્તર સુરક્ષા વધુને વધુ મજબૂત.

પણ સબૂર ! આભ્યંતરજગતમાં વ્યક્તિની રક્ષા એનું મન કેવું છે ? એના આધારે થાય છે. મન જો તુરુષ્ઠ તો રક્ષા બિલકુલ નહીં, મન જો ઉદાર તો રક્ષા વધુ. મન જો ઉદાત્ત તો રક્ષા શ્રેષ્ઠ અને મન જો પવિત્રતમ તો રક્ષા કલ્પનાતીત !





111 ક્રોધના આવેગમાં

થઈ જ તો વિધવંસ
ક્રોધસેવનની સમાપ્તિ
પછી જો પસ્તાવાનું કારણ

બનીને જ રહે છે તો, કામના

આવેગમાં થઈ જતું સર્જન કામસેવનની

સમાપ્તિ પછી પસ્તાવાનું કારણ નહીં જ બને કે નથી જ બનતું
એવું માની લેવાની પણ જરૂર નથી જ.



112 પર્યાપ્ત ઊંઘ લીધી પછી ય શરીર જો સ્ફૂર્તિનો અનુભવ

ન કરતું હોય તો એ ઊંઘ માટે ફેરવિચારણા કરવી જ પડે એવું

જો આપણું મન કહેતું હોય તો વિષયોના અનેકવારના સેવન

પછી પણ મન જો તૃપ્તિનો અનુભવ

ન જ કરતું હોય તો વિષયોના

એ સુખ પર ફેરવિચારણા

કરવી જ જોઈએ એવું નથી

લાગતું?





113 ગુટખાનું સેવન કૅન્સરજનક બન્યું રહેતું હોવા છતાં કેટલોક વર્ગ એના સેવન માટે લાલાયિત બન્યો જ રહેતો હોય છે.

કારણ ? તત્કાલ અનુભવાતું સુખ ! બસ, એ જ ન્યાયે અબ્રહ્મનું સેવન ત્રાસદાયક, દુર્ગતિદાયક બન્યું રહેતું હોવા છતાં બહુજનવર્ગ એના સેવન માટે સદાય લાલાયિત જ હોય છે. કારણ ? તત્કાલ આપતી મજા! સાવધાન!

114 દુશ્મનની ઉપસ્થિતિ વખતે જે સતર્ક ન હોય અને દુશ્મન સામે સંઘર્ષ કરી લેવાની જેનામાં તાકાત ન હોય એ જેમ દુશ્મન સામે હારી જાય છે તેમ, પ્રલોભનોની ઉપસ્થિતિમાં જે સતર્ક ન હોય અને પ્રલોભનો સામે સંઘર્ષ કરવા જે સક્ષમ ન હોય એ પવિત્રતાના ચુદ્ધમાં પરાજિત થઈ જાય છે.



115 લીમડાનો પ્રથમ સ્વાદ ભલે કડવો છે,
લીંબુનો પ્રથમ સ્વાદ ભલે ખાટો છે,
મરચાનો પ્રથમ સ્વાદ ભલે તીખો છે, પણ
એ તમામનો અંતિમ સ્વાદ પણ એવો જ છે.



જ્યારે વાસનાનો પ્રથમ સ્વાદ ભલે મીઠો છે, પણ એ પછીના
એના સ્વાદમાં તો વિષાદ-વિલાપ અને વેદના સિવાય બીજું કશું જ
નથી.

સાવધાન!

116 જેના સંપર્કમાં કે સહવાસમાં, સાંનિઘ્યમાં કે સંબંધમાં મન
ગલગલિયા અનુભવવા લાગે, એના સંપર્ક વગેરેના સમયને
લંબાવવા માગે, એના સ્પર્શની અંદરમાં માગ ઉઠવા લાગે ત્યાં સમજી
લેવું કે પતનનો દારૂગોળો તૈયાર થઈ ચૂક્યો છે. નાનકડી જ
ચિનગારી અને એ દારૂગોળો ફૂટ્યો જ સમજો.





117

સ્વાદના અને શ્રવણના
સુખમાં, દર્શનના અને સુવાસના
સુખમાં વિવેકને હાજર રાખવામાં ખાસ
તકલીફ પડતી નથી, પણ સ્પર્શનું સુખ તો
સૌ પ્રથમ વિવેકનું જ બલિદાન લઈ લેતું હોય છે. અને
કમાલનું આશ્ચર્ય એ છે કે મનને વિવેકની
ગેરહાજરીવાળું સુખ જ સૌથી વધુ જામતું હોય છે
અને ફાવતું હોય છે. સાવધાન!

118

પેટ્રોલ ન મળે તો
ગાડીનું ચાલવું જેમ અશક્ય બની જાય
છે, જળ ન મળે તો બીજનું અંકુરિત થવું જેમ
અશક્ય બની જાય છે, અહંનો ખોરાક ન
મળે તો મનનું પાગલ બનવાનું જેમ
અશક્ય બની જાય છે તેમ કલ્પનાનું
આસમાન ન મળે તો વાસનાના
પંખીને ઊડવાનું જ નહીં, જીવવાનું
પણ અશક્ય બની જાય છે.



119 કતલખાનાઓના

વાતાવરણ વચ્ચે જ રહેનારને
જીવદયાના પરિણામ ટકાવવા જે
અશક્યપ્રાયઃ બની રહે છે, ગુંડાઓની વચ્ચે જ
રહેનારને જે શોભન શબ્દોનો પ્રયોગ અશક્યપ્રાયઃ જ
બની રહે છે તો વિલાસી વાતાવરણ વચ્ચે જ રહેનારને
પોતાના મનને પવિત્ર બનાવી રાખવું અશક્યપ્રાયઃ જ બની રહે
છે.

મનના વિચારો પવિત્ર રાખવા છે ? અપવિત્ર વાતાવરણથી
જાતને દૂર કરીને જ રહો.

120 ભ્રષ્ટ આચરણ કરનારને જેમ ભ્રષ્ટાચારી કહેવાય છે, દુષ્ટ
આચરણ કરનારે જેમ દુરાચારી કહેવાય છે, સદ્-આચરણ કરનારને
જેમ સદાચારી કહેવાય છે, ઈચ્છા મુજબ આચરણ કરનારને જેમ
સ્વેચ્છાચારી કહેવાય છે તેમ જે અજર છે, અમર છે,
ઈન્દ્રિયોની પહોંચની બહાર છે, સત્-ચિત્ત અને આનંદ
સ્વરૂપ છે એ બ્રહ્મ છે અને એને અનુકૂળ જે આચરણ
કરે છે એને બ્રહ્મચારી કહેવાય છે.





121 શરીરને પીડામુક્ત રાખવાના ચીવટપૂર્વકના લાખ પ્રયાસો પછી ચ કોઈ પણ વ્યક્તિને કાયમ માટે તો એમાં સફળતા નથી જ મળતી. કો'ક પળે તો શરીર રોગગ્રસ્ત બને જ છે અને પીડાને સ્વીકારવી જ પડે છે.

એ જ રીતે જીવનને પરાજય મુક્ત રાખવાના પ્રયાસોમાં ચ ક્યારેક તો પછડાટ ખાવી જ પડે છે અને લમણે પરાજય ઝીંકાઈને જ રહે છે.

પણ, જીવનને જો આપણે પતનમુક્ત રાખવા માગીએ છીએ તો એમાં સો ટકા સફળતા મળી શકે છે. શરત એક જ છે, જાતને પ્રલોભનોથી દૂર રાખવાની !



122 એક નગ્ન વાસ્તવિકતા આંખ સામે રાખજો કે-સાગર નદીઓને માગતો નથી. નદીઓ સામે ચડીને સાગરને મળવા આવે છે. સ્મશાન મડદાંઓને માગતું નથી, મડદાંઓ સામે ચડીને સ્મશાનમાં આવે છે.

આગ લાકડાઓને માગતી નથી, લાકડાઓ સામે ચડીને આગ પાસે આવે છે.

પણ સબૂર ! અતૃપ્ત એવું મન અને ભિખારણ એવી ઈન્દ્રિયો વાસનાપૂર્તિ માટે સામે ચડીને વિષયો માગતી રહે છે. સાવધાન !





123 રાવણ સીતાને લક્ષ્મણરેખાનું ઉદ્ધંધન કરવા મજબૂર કરતો નથી અને સીતા લક્ષ્મણરેખાનું ઉદ્ધંધન કરી દે છે એ પછી રાવણ એને છોડતો નથી.

વાસનાના નિમિત્તો સામે ચડીને આપણને મર્યાદાનું ઉદ્ધંધન કરવા પ્રેરિત કરતા નથી અને આપણે મર્યાદાનું ઉદ્ધંધન જો કરી બેસીએ છીએ તો એ પછી એ નિમિત્તો આપણી હાલત બગાડી નાખીને જ રહે છે.



124 શિખર પર પહોંચતા રોકે એવી તમામ લાલચોથી પર્વતારોહકે જો દૂર જ રહેવું જોઈએ તો પવિત્રતાના શિખર સુધી પહોંચતા રોકે એવા તમામ પ્રકારના પ્રલોભનો સામે સાઘકે લાલ આંખ જ રાખવી જોઈએ અને એવા પ્રલોભનોથી જાતને દૂર જ રાખવી જોઈએ.



125

વાસનાપૂર્તિના કેન્દ્રમાં
વિચારના પથ્થરો નથી હોતા, પણ
લાગણીનો કીચડ હોય છે. પથ્થરો આપણને
લપસવા માટે તૈયાર નથી કરતા, પણ કીચડ તો
આપણને લગભગ લપસાવીને જ રહે છે.

ટૂંકમાં, વાસનાકેન્દ્રિત લાગણી એ એવી
લપસણી ભૂમિ છે જે આપણને લગભગ તો
પાડીને જ રહે છે.

126

બધા જ અપરાધોમાં વાસના એ એક એવો
અપરાધ છે કે જેના સેવન માટે મન સદાય તત્પર પણ
હોય છે અને જેના સેવનમાં મન સદાય આનંદ પણ
અનુભવતું હોય છે.

આના પરથી ખ્યાલ આવશે કે વાસનાવિજય તો
મુશ્કેલ છે જ, પણ વાસનાનફરત પણ મુશ્કેલ જ છે.

127 માઈકના માધ્યમે ખૂબ દૂર સુધી સંભળાતો અવાજ એ જેમ માઈકનો અવાજ નથી હોતો, પણ માઈક પાછળ ઊભા રહીને બોલનારનો અવાજ હોય છે તેમ, વિજ્ઞાતીય દર્શને આંખમાં પ્રગટ થઈ જતો વિકાર એ આંખનો વિકાર નથી હોતો, પણ આંખને પ્રેરિત કરનાર મનનો વિકાર હોય છે.

અને એટલે જ સાચા અર્થમાં ઈલાજ આંખના વિકારનો કરવાનો નથી હોતો, મનના વિકારનો કરવાનો હોય છે.



128 નદીને ખળભળાવવા એક કાંકરી કાઢી છે. કચરાના ઢેરને સગળગાવવા એક ચિનગારી કાઢી છે. ગાઢ અંધકારને દૂર કરવા પ્રકાશનું એક કિરણ કાઢી છે. વરસોની અર્જિત કરેલ આબરૂને ઘૂળઘાણી કરવા એક અપકૃત્ય કાઢી છે.

સંદેશ સ્પષ્ટ છે. વિવેકનો નાનકડો અંશ પણ વાસનાવિજેતા બનાવી દેવા સક્ષમ છે, તો એક જ વખતની પ્રતોભન સામેની નબળી પણ વાસનાની ગટરમાં ફેંકી દેવા પર્યાપ્ત છે.



129 દીવાલ એક બાજુથી ચાલી શકાય છે, પણ પુલનું નિર્માણ તો બે બાજુથી ચલાવવાથી જ થાય છે.

અહંવિજેતા માત્ર મનને મજબૂત કરવાથી હજી બની શકાય છે, પણ વાસનાવિજેતા બનવા તો ઇન્દ્રિય અને મન બંનેને વશમાં રાખવા પડે છે.

કદાચ એટલે જ એકલા મન સાથે હિસાબ સમજી લેવાને બદલે ઇન્દ્રિય તથા મન, બંને સાથે હિસાબ સમજી લેવાનું વધુ કપરું છે.

130 કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચેનો એક મહત્વનો તફાવત આંખ સામે રાખવા જેવો છે. મડદાનું જ્યાં દફન થાય છે એ સ્થળને કબ્રસ્તાન કહેવાય છે જ્યારે મડદાને જ્યાં બાળી નાખવામાં આવે છે એ સ્થળને સ્મશાન કહેવાય છે. ભોગનો માર્ગ એ કબ્રસ્તાનનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એ માર્ગ પર વાસના કામચલાઉ શાંત અને તૃપ્ત તો થાય છે, પણ ખતમ તો નથી જ નથી. જ્યારે યોગનો માર્ગ એ સ્મશાનનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એ માર્ગ પર વાસના ખતમ જ થઈ જાય છે.

131 એક લાખના મોબાઇલને બાબો રમકડું માનીને એની સાથે રમી શકે છે, પણ એના પપ્પા તો ન જ રમી શકે, કારણ કે એમની પાસે સમજદારી હોય છે.

જેની કિંમત આંકવામાં તમામ શબ્દો ટૂંકા પડે એમ છે એ મનને વાસનાના જ વિચારોમાં રમતું અણસમજુ માણસ રાખી શકે. જેનીપાસે સમજદારી હોય છે એ તો હરગિજ નહીં.



132 બિલાડીના મસ્તક પર રહેલ ટીવો ત્યાં સુધી જ સ્થિર છે જ્યાં સુધી બિલાડાની નજરે ઉંદર ચડ્યો નથી.

‘વાસના ખતરનાક છે’ ની કેળવેલ સમજણ ત્યાં સુધી જ સલામત છે જ્યાં સુધી વિજતીય સાથેના એકાંત, અંધકાર અને અતિ પરિચયથી જાત દૂર રહી નથી !

પતનથી બચવું છે ? વાસનાને ઉદ્દીપ્ત કરતા નિમિત્તોથી દૂર જ રહો. પતનની સંભાવના પર પૂર્ણવિરામ મૂકાઈ જ જશો.



133 જવાબદારી યાહે પૈસા સાચવવાની હોય કે પ્રતિષ્ઠા સાચવવાની હોય, કુટુંબને સાચવવાની હોય કે સમાજને સાચવવાની હોય, ટેન્શન વિનાની જો નથી હોતી તો મનને વાસનાના વિચારોથી ખરડાતું અને ગલત નિમિત્તોથી લૂંટાતું અટકાવવાની જે જવાબદારી આપણાં શિરે છે એ જવાબદારી પણ ટેન્શન વિનાની શેં હોઈ શકે ?

યાદ રાખજો, ટેન્શનમાં સામર્થ્યને પ્રગટાવવાની ક્ષમતા છે.



134 જવાબદારી નિભાવવામાં ટૂંકો પડેલ માણસ જો એની કબૂલાત કરી દેવાની ઇમાનદારી દાખવે છે તો એ ભૂલના પુનરાતર્પનથી જાતને બચાવી લેવામાં અચૂક સફળ બને છે.

કો'ક નબળી પળોમાં ગલત નિમિત્તોને આધીન બનીને મનની પવિત્રતાને સાચવી રાખવાની જવાબદારી નિભાવવામાં આપણે ઊંચા ઊતરી પણ ગયા હોઈએ તોય એની કબૂલાત કરી દેવાની ઇમાનદારી દાખવીને જીવનના પત્તા આપણે નવેસરથી ગોઠવતા રહેવાની જરૂર છે.

135 કષાયો અને વિષયો વચ્ચેના એક અતિ મહત્વના તફાવતને આંખ સામે રાખજો કે કષાયોનું સેવન મનને બહાર પણ નથી ગમતું અને અંદર પણ નથી ગમતું જ્યારે વિષયોનું સેવન મનને કદાચ બહાર નથી ગમતું, પણ અંદર તો ગમે જ છે. આ જ કારણસર વિષયોથી મનને પાછું વાળવું એ બહુ મોટો પડકાર બની રહે છે.



136 રોજ મળતાં રોટલી-દાળ-ભાત-શાક અને કવચિત્ જ મળતી મીઠાઈ આ બે વચ્ચે પસંદગી કરવાની આવે તો માણસ મીઠાઈ જ પસંદ કરે ને ?

અનંતકાળ મળેલા પાંચે ય ઈન્દ્રિયોના વિષયો અને અનંતકાળે મળેલ બ્રહ્મચર્યપાલનની તક.

આ બે વચ્ચે પસંદગી કરવાના આપણી સમક્ષ આવેલા પડકારને જો આપણે ઝીલી લેવા માગીએ છીએ તો બ્રહ્મચર્ય પાલનની તકના પડકારને ઝીલી લેવા જેવો છે.





137 ઘોડાગાડીએ કઈ દિશામાં જવું ? એ નક્કી કરવાનું કામ ઘોડાને ન સોંપાય, પણ ઘોડેસ્વારને સોંપાય એ તો બરાબર છે, પણ ઘોડેસ્વારે જો દારૂ પીધો હોય તો એને ચ ન સોંપાય.

જીવનના રથને કઈ દિશામાં લઈ જવો ? એ નક્કી કરવાનું કામ ઇન્દ્રિયોને ન સોંપાય, પણ મનને જ સોંપાય એ તો બરાબર છે, પણ મન જો અવિવેકી જ હોય તો એને પણ ન સોંપાય એ ચ એટલું જ મહત્વનું છે.

138 સત્યવાદી યુધિષ્ઠિર નિષ્ક્રિય થઈ જાય અને નાલાયક દુર્યોધન સક્રિય બની જાય ત્યારે તો જે હાહાકાર સર્જતો હોય તે પણ પવિત્ર ગણાતું અંતઃકરણ નિષ્ક્રિય થઈ જાય અને પતનપ્રેમી મન સક્રિય બની જાય ત્યારે જે હાહાકાર સર્જાય છે એ હાહાકાર એક જ મહાભારતના યુદ્ધને નહીં, પણ અનેક મહાભારતના યુદ્ધોને જન્મ આપીને જ રહે છે.



139 દરિદ્રના શરીર પર રહેલ વસ્ત્રો અમીરને જામતા નથી. રોગીના જમવાના વાસણો તંદુરસ્તને જામતા નથી. અધમનો વેભવ ઉતમને પસંદ પડતો નથી.

પ્રશ્ન એ છે કે દરિદ્રના, રોગીના અને અધમના મનમાં વાસનાના જે અને જેવા વિચારો ચાલતા હોય છે એ અને એવા વિચારો આપણાં મનમાં નથી જ ચાલતા એવું જો આપણે છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં ન હોઈએ તો એના પરથી સમજી લેવું કે વાસનાવિજય કે વાસનાનિયંત્રણ વર્લ્ડ કંપની મેંચ જીતી જવા કરતાં ય વધુ કપરું છે.



140 સીડી તમને નથી તો ઉપર લઈ જતી કે નથી તો તમને નીચે લઈ જતી.

ફૂવાની અંદર જો તમે સીડી ગોઠવો છો તો એ તમને નીચે જવામાં સહાયક બને છે અને દીવાલ આગળ જો તમે સીડી ગોઠવો છો તો એ તમને ઉપર પહોંચવામાં સહાયક બને છે.

બસ, મન આ સીડી જેવું છે. એ સ્વયં તમને ક્યાંય પહોંચાડવાનું નથી, પણ તમે પોતે જ્યાં પહોંચવા માગો છો ત્યાં પહોંચાડી દેવામાં અચૂક સહાયક બનવાનું છે.

મન વાસનાના ફૂવા પર ગોઠવ્યું તો નીચે જવાનું પાકું અને દીવાલ પર ગોઠવ્યું તો ઉપર જવાનું પાકું!

141

દૂધમાં આવતા ઊભરાને જોઈને દૂધના કદનું અનુમાન કરવામાં થાપ ખાઈ જવાની જો સો ટકાની સંભાવના છે, સાગરની છાતી પર ઊઠતાં મોજાઓને નિહાળીને સાગરના સ્વરૂપનો નિર્ણય કરી લેવામાં થાપ ખાઈ જવાની જો પૂરેપૂરી સંભાવના છે. તો, કો'ક ઉત્તેજક નિમિત્તને પામીને મનમાં જાગી જતાં વાસનાના વિચારોને જોઈને મનની અવસ્થા અંગે નિર્ણય લઈ લેવામાં ભૂલા પડી જવાની અને થાપ ખાઈ જવાની પૂરી સંભાવના છે. સાવધાન!

142

જ્યાં જવું છે એનો નિર્ણય કોણ કરે ? ડ્રાઈવર કરે ? કંડક્ટર કરે ? બસ કરે ? કે પછી મુસાફર કરે ? જવાબ સ્પષ્ટ છે, મુસાફર જ કરે.

શરીર બસ છે, ઇન્દ્રિયો કંડક્ટર છે, મન ડ્રાઈવર છે અને આત્મા મુસાફર છે.

આ ઓળખ જો હૃદયમાં જડબેસલાક પ્રતિષ્ઠિત થઈ જાય તો તાકાત નથી મનમાં જાગતા વાસનાના વિચારોની કે આત્માને એ વાસનાની ગટરમાં આળોટવા મજબૂર કરીને જ રહે.

ચાદ રાખજો, અકસ્માતો જે પણ થાય છે એ ડ્રાઈવર જેવા મનની ગફલતના કારણે જ, મુસાફર જેવા આત્માના કારણે નહીં જ. સાવધાન!




143 જેમ પગથિયા ચડ્યા વિના મંદિરના રંગમંડપમાં પહોંચી શકાતું નથી અને રંગમંડપમાં પહોંચ્યા વિના જેમ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકાતો નથી તેમ, ઈન્દ્રિયો પરના નિયંત્રણના પગથિયા ચડ્યા વિના મનોસંયમના રંગમંડપમાં આત્મા પહોંચી શકતો નથી અને મનોસંયમના રંગમંડપમાં પ્રવેશ્યા વિના આત્મા સાચા અર્થમાં ‘બ્રહ્મ’ના ગર્ભગૃહમાં પ્રવેશી શકતો નથી.

આપણી આંખ સામે આ ક્રમની સ્પષ્ટતા ખરી ?

144 ગાડી એક કરોડની હોય અને એનું પાર્કિંગ ઊકરડે ? ન જ કરાય.

મન કોહીનૂર હીરા કરતાં ય મૂલ્યવાન અને કલ્પવૃક્ષ કરતાં ય મહાન અને એનું પાર્કિંગ વાસનાના ઊકરડે ? ન જ કરાય ને ?





145 નૈતિકતા અને નિષ્ઠા વચ્ચે મહત્વનો તફાવત આ છે કે બહારથી આપણે જે કરીએ છીએ એ નૈતિકતા છે અને અંદરથી આપણે જે માનીએ છીએ એ નિષ્ઠા છે. આ હિસાબે જ નૈતિક બનવું સરળ છે, પણ નિષ્ઠાવાન બન્યા રહેવું મુશ્કેલ છે.



146 યુદ્ધના જગતમાં એક યુદ્ધ 'કિલ્લા યુદ્ધ' છે. દુશ્મન રાજા જ્યારે બળવાન હોય છે ત્યારે એના આક્રમણને ખાળવા નગરનો રાજા કિલ્લાના દરવાજા બંધ કરી દઈને અંદર રહીને પોતાની ક્ષમતા પ્રમાણે લડતો રહે છે.

આપણને પોતાને જો એમ લાગતું હોય કે વાસનાના નિમિત્તો સામે આપણું મન નબળું છે તો આપણે ય આ 'કિલ્લા યુદ્ધ'ના અભિગમને જ અપનાવવા જેવો છે.


નિમિત્તો જ નહીં, મનની અને જીવનની પવિત્રતા સો ટકા નહીં, હજાર ટકા સુરક્ષિત.



147 દૂષિત પર્યાવરણ શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે અને કાંટા પર પડી જતો પગ લોહી કાઢે છે એની તો આપણને ખબર છે, પણ વિષયો અને કષાયો શું કરે છે, એની આપણને ખબર ન હોય તો સમજી લેવા જેવું છે કે, આપણને લઙ્કુ અર્થાત્ આસક્ત બનાવવાનું કામ જો વિષયો કરે છે તો આપણને લઘુ અર્થાત્ બેવકૂફ બનાવવાનું કામ કષાયો કરે છે. આપણે લઙ્કુ અને લઘુ ક્યાં સુધી બન્યા કરશું?



148 સંપત્તિના સુખનું કોઈ પણ વયને આકર્ષણ હોય છે. ૨૫ મા વરસે અને ૭૫ મા વરસે પણ મનને સંપત્તિ પ્રત્યે ખેંચાણ હોય જ છે, પણ વાસનાના સુખની આખી વાત ન્યારી છે. એ સુખનું આકર્ષણ કિશોરાવસ્થામાં જાગે છે અને વૃદ્ધાવસ્થા આવતા આવતા તો પ્રાયઃ નામશેષ થઈ જાય છે. જે સુખ વચકેન્દ્રિય જ હોય એ સુખને મનકેન્દ્રિત બનાવી દેવામાં સિવાય વિષાદ, લમણો કશું જ ઝીંકાતું નથી.



149 શરીર માટે જે લાભદાયી છે એ બધું મનને પસંદ નથી અને મનને જે પસંદ છે એ આત્મા માટે હિતકારી નથી.

વિષયો સાથેનો વિવેકપૂર્ણ વ્યવહાર શરીરને માફક છે, પણ મનને પસંદ નથી. વિષયો સાથેનો વિવેકહીન વ્યવહાર મનને પસંદ છે, પણ આત્મા માટે હિતકર નથી. મનને પડકારવાની હિંમત કેળવવી જ પડશે.

→ → → → → → → → → → →

150 પુરુષની કોઈ એક જબરદસ્ત કમજોરી જો હોય તો એ કમજોરીનું નામ છે, એની બુદ્ધિની પ્રશંસા અને સ્ત્રીની કોઈ એક જબરદસ્ત કમજોરી જો હોય તો એ છે એના સૌંદર્યની પ્રશંસા. બુદ્ધિની પ્રશંસામાં પુરુષ બેવકૂફ બની જતો હોય છે તો સૌંદર્યની પ્રશંસામાં સ્ત્રી મૂરખ બની જતી હોય છે. જે આ કમજોરીને જીતી જાય છે એ પુરુષ અને સ્ત્રી બહુમોટી નુકસાનીમાંથી ઉગરી જાય છે.

153 યુદ્ધના જગતમાં એક યુદ્ધ હોય છે ‘મેદાન યુદ્ધ’ જેમાં સૈનિકો આમને-સામને આવી જઈને એકબીજાને પતાવી દેવા અને પરાસ્ત કરવા જાનની બાજુ લગાવી દેતા હોય છે.

લાખ પ્રયાસો છતાં વાસનાને ઉત્તેજિત કરતા નિમિત્તો આંખ સામે આવી જ જાય ત્યારે વ્યક્તિએ સમ્યક્ સમજના અને મક્કમ મનોબળના સહારે વાસનાના નિમિત્તોને પ્રભાવહીન બનાવી દેવા જે લડત લડવાની હોય છે એ લડતને ‘મેદાન યુદ્ધ’ની કક્ષામાં મૂકી શકાય છે.



154 યુદ્ધના જગતમાં એક યુદ્ધ હોય છે, ‘ગેરીલા યુદ્ધ’ દુશ્મનો ગડલતમાં હોય છે ત્યારે કે અસાવધ હોય છે ત્યારે એના પર આક્રમણ કરીને એમને ખતમ કરી નાખવામાં આવે છે એ યુદ્ધને ‘ગેરીલા યુદ્ધ’ કહેવામાં આવે છે.

વાસનાના નિમિત્તો આંખ સામે આવે એ પહેલાં મનને વિષયોની વિરસતા અને નિરસતાથી એ હદે ભાવિત કરી દેવામાં આવે કે વિષયોના નિમિત્તો સ્વતઃ જ મનને વાસનાથી ગ્રસ્ત બનાવી દેવાની ક્ષમતા ગુમાવી બેસે. આપણે આવા ગેરીલા યોદ્ધા ખરા ?

155 સાગરમાં આવતી ભરતીને તો પહોંચી વળાય છે, પણ નદીમાં આવતું પૂર તો વિનાશ વેરીને જ રહેતું હોય છે.

મનમાં જાગતી વાસના જો 'ભરતી'નું પ્રતિનિધિત્વ ધરાવી રહી છે તો એને નિયંત્રિત કરવી તો સહેલી છે, પણ એ વાસના જો 'પૂર'નું પ્રતિનિધિત્વ ધરાવી રહી છે તો એ હાહાકાર સર્જ્યા વિના નથી રહેવાની એ નિશ્ચિત વાત છે.

એટલું જ કહીશ કે 'ભરતી'થી પણ બચી શકાય તો સારું છે, પણ ભરતી 'પૂર' ન બની જાય એનું ધ્યાન તો આપણે સહુએ અચૂક રાખવાનું જ છે.



156 ૫૦ રૂપિયા જ સાચવવા છે ? ખીસું પર્યાપ્ત છે. ૫૦૦૦ રૂપિયા સાચવવા છે ? પાકીટ પર્યાપ્ત છે. ૫૦,૦૦૦ રૂપિયા સાચવવા છે ? કબાટ પર્યાપ્ત છે, ૫,૦૦,૦૦૦ રૂપિયા સાચવવા છે ? તિજોરી પર્યાપ્ત છે, પણ કરોડો સાચવવા છે ? લોકર જરૂરી છે.

બ્રહ્મચર્ય એ કેટલું બધું કિમતિ ધન હશે કે એને સાચવવા માટે અનંત જ્ઞાનીઓએ નવ-નવ પ્રકારની વાડનું પાલન અગત્યનું અને મહત્વનું બતાવ્યું છે.

ચાદ રાખજો, જે કિમતિ હોય છે એને લૂંટનારા પરિબળો ઘણાં હોય છે. મામૂલી જ અસાવધગીરી અને મૂલ્યવાન વસ્તુ તમારા હાથમાંથી ગાયબ ! સાવધાન !

157

જે જળ ખાબોચિયું બનવા નથી માગતું એને સતત વહેતા જ રહેવું પડે છે અને જે જળને સતત વહેતા જ રહેવું છે એણે ખાડા-ટેકરાને તો ઠીક, પણ રણપ્રદેશને પણ ઓળંગી જવાની તાકાત કેળવી લેવી પડે છે.

આપણાં મનને જો આપણે ખાબોચિયું બનવા દેવા નથી જ માગતા તો મનમાં આવી જતાં વાસનાના વિચારો મનમાં રહી ન જાય એવું આપણે ધ્યાન રાખવું જ પડશે અને એ નબળા વિચારો વહેતા રહે એ માટે પ્રલોભનોના ખાડા-ટેકરા પાસે દૃઢ મનોબળ સાથે ઊભા રહી જવું જ પડશે.



158

જે પણ વ્યક્તિ પાસે સમજનો અભાવ છે એ વ્યક્તિ કદાચ અંધ છે, પણ જેનાં મન પર ગેરસમજનો પ્રભાવ છે એ વ્યક્તિ તો મોહાંધ છે.

વાસનાના વિચારોમાં જ રમતું મન એ સમજના અભાવને આભારી નથી, પણ ગેરસમજના પ્રભાવને આભારી છે.

શું કહું ? સામે જ રહેલ ગટર ‘ગટર’ તરીકે ન દેખાય એ સમજનો અભાવ છે, પણ ગટર ગંગા તરીકે દેખાય એ તો ગેરસમજનો પ્રભાવ છે.

વાસનામાં ઉકરડો ન દેખાય એ હજી ચાલી જાય, પણ નંદનવન દેખાવા લાગે એ તો શીં ચાલી શકે ?



159 રાતના સમયે હાઈ-વે પર દોડી રહેલા વાહનો સામસામે આવી જાય ત્યારે અકસ્માતથી બચવા ડ્રાઈવરો હેડલાઈટના પ્રકાશને ડીપર પાડીને નિયંત્રિત કરી દેતા હોય છે. વિજાતીયના દર્શને આંખ વિકારગ્રસ્ત ન થઈ જાય એ માટે આંખની પાંપણ આપણે નમાવી દેવાની છે.



160 સાચે જ જીવનને

વાસનાનું શિકાર બનતા જો આપણે અટકાવવા માગીએ છીએ તો બે બાબતથી જાતને દૂર રાખવાની ખાસ જરૂર છે.

૧. વિજાતીયના પરિચયથી અને
૨. સજાતીયના સ્પર્શથી.




161 ઉંદર બિલાડીને

જીતી જાય કે કાચબો
સસલાને હરાવી જાય એ આશા
હજી કદાચ સફળ પુરવાર થઈ
શકશે, પણ ઉંમર કે અક્કલ વાસનાને
જીતી જશે એ આશા તો કાચમ
ઠગારી જ નિવડવાની છે.



162 આપણને ભલે એમ લાગતું
હોય કે ભૂકંપ કે સુનામી એકાએક
આવે છે, ના. એની અંદરમાં
તૈયારી તો ક્યારની ય

ચાલતી જ હોય છે. બસ, એ જ
ન્યાયે કોઈ પણ પતન એકાએક
નથી હોતું. એક એક થયા પછી
જ પતન એકાએક થતું
લાગતું હોય છે.



163 પાંચ પાંચ વરસ સુધી ઘાસતેલ ભલે ને ફિજમાં રહ્યું છે, પણ ચિનગારી મળતાં જ સળગી ઉઠવાના એના સ્વભાવમાં તો કોઈ જ ફરક પડતો નથી.


ગલત નિમિત્તોથી દૂર રહીને તથા શુભ નિમિત્તો વચ્ચે રહીને તમે વાસનાને સુષુપ્ત રાખવામાં ભલે સફળ રહ્યા છો, પણ યાદ રાખજો કે નિમિત્ત મળતાં જ સક્રિય થઈ જવાનો એનો સ્વભાવ તો અકબંધ છે.



164 હોય બ્લોટિંગ પેપર, પણ તમે એને માની બેસો ટ્રેસિંગ પેપર અને એમ માનીને તમે એના પર સ્થાહીનું ટીપું નાખો. થાય શું ? આખા કાગળ પર ફેલાઈ જાય.

વાસનાના સુખની કલ્પના માટે મન છે બ્લોટિંગ પેપર જેવું, પણ બદમાશ મન એને માની બેસે છે ટ્રેસિંગ પેપર જેવું.

પરિણામ ? વાસનાનો એક જ નાનકડો વિચાર મનમાં પ્રવેશે છે અને ગણતરીની પળોમાં વાસનાનો એ વિચાર પૂરા મનનો કબજો જમાવી બેસે છે. સાવધાન !



165 વાસનાનું સંપૂર્ણ જગત એ અભાવનું જગત નથી, અલ્પતાનું જગત પણ નથી, અધિકનું જગત પણ નથી, અસંતોષનું જગત પણ નથી, પણ છે કેવળ આભાસનું જગત.

ગટરમાં પડેલ દારૂકિયાને ‘હું ગંગાજળ વચ્ચે છું’ એવો આભાસ થઈ શકે. વાસનાની ગંદકીમાં આળોટનારને ‘હું સ્વર્ગમાં છું’ આવો ભ્રમ થઈ શકે છે.



166 દીપકને પ્રજ્જ્વલિત રાખતું ધી સદા અને સર્વત્ર ઉપલબ્ધ નથી પણ હોતું તો ચ દીપકને બુઝવી નાખતો પવન તો ક્યાં અને ક્યારે હાજર નથી હોતો એ પ્રશ્ન છે.

બસ, એ જ ન્યાયે પવિત્રતાને અકબંધ રાખતા શુભ નિમિત્તો આપણને સદા અને સર્વત્ર નથી જ મળવાના, પણ પવિત્રતાને ખતમ કરી નાખતા પ્રલોભનો તો આપણને ક્યાં અને ક્યારે નથી મળવાના એ પ્રશ્ન છે. દીપકને પવનથી, પવિત્રતાને પ્રલોભનોથી બચાવવી જ રહી.





167 અહિંસા, સંયમ અને તપરૂપ

ધર્મ જો ઉત્કૃષ્ટ મંગળ છે તો બ્રહ્મચર્યના પાલનમાં સંખ્યાબંધ જીવોની હિંસાથી બચી જવાયું હોવાથી એ ‘અહિંસારૂપ’ પણ છે, તો બ્રહ્મચર્યના પાલનમાં કષાયો પર વિજય અને ઇન્દ્રિયોનો નિગ્રહ હોવાથી એ ‘સંયમરૂપ’ પણ છે અને બ્રહ્મચર્યના પાલનમાં ઇચ્છાનો નિરોધ હોવાથી એ ‘તપરૂપ’ પણ છે.

આનો અર્થ ? આ જ કે બ્રહ્મચર્યપાલન અહિંસા-સંયમ-તપરૂપ હોવાથી ઉત્કૃષ્ટ મંગળ છે.



168 મેદાનની હારને હજી પહોંચી વળાય છે, પણ મનની હારને પહોંચી વળતા તો નવનેજાં પાણી ઉતરી જાય છે અને વાસના એ એવું ચુદ્ધ છે કે જ્યાં મનને હારતાં રહેવાનું જ સૌથી વધુ ગમતું હોય છે.





169 ઉઘઈ ખાઘેલ ઝાડને પડવા માટે ભૂકંપની જરૂર નથી પડતી. એક જ ઘક્કો લાગે છે અને ઝાડ પડી જાય છે. વાસનાગ્રસ્ત મનને પતિત થવા આકર્ષક રૂપની જરૂર નથી પડતી.

મામૂલી પણ રૂપ અને પતન પાકું.



170 બ્રહ્મચર્ય પાલનને સહજ અને આનંદપૂર્ણ બનાવવા માટે સમ્યક્ સમજ અને સુંદર વાતાવરણ જેટલું સહાયક બન્યું રહે છે, કદાચ એટલું જ સહાયક શ્રમયુક્ત શરીર બન્યું રહે છે.

જેની પાસે શરીરનો શ્રમ નથી એનું શરીર સુંવાળું બન્યું રહે છે અને સુંવાળા શરીરમાં વાસનાના સાપોલિયાને આંટાઓ લગાવવા માટે ખુલ્લું મેદાન મળી રહે છે.

ચાદ રાખજો, ‘સુંવાળો બ્રહ્મચારી એ ગુપ્ત સંસારી છે.’ આ કહેવત ખોટી તો નથી જ.

171 સાચી પ્રભુભક્તિ કોને કહેવાય ?
એ અંગે આમ તો જાતજાતના
સમાધાનો છે, પણ મનને ગળામાં
ઉતરી જતા શીરાની જેવું સમાધાન આ
છે કે જ્યાં બુદ્ધિ કરતાં શુદ્ધિ વધુ
મહત્વની હોય અને રાગ કરતાં પ્રેમ વધુ
મહત્વનો હોય એ જ સાચી પ્રભુભક્તિ
છે. આવી પ્રભુભક્તિ આપણી પાસે
ખરી ?



172 જે પણ વ્યક્તિ ક્યારેય મિત્ર
બની શકવાની જ ન હોય અને કાયમ
માટે દુશ્મન જ બની રહેવાની હોય
એનો આપણે બહિષ્કાર કરતા
રહીએ એ તો બરાબર છે, પણ મન
એ આત્માનું એવું દુશ્મન છે કે જેને
કેળવીએ તો એ આપણું મિત્ર બની
શકે તેમ છે અને એટલે જ આપણે
એનો બહિષ્કાર નથી કરવાનો, પણ
પરિષ્કાર કરવાનો છે.



173 વાસનાની આધીનતાને કલંકનું કારણ બનતા અટકાવવી હોય તો એક બાબતનો ખાસ ખ્યાલ રાખવો કે, વિજાતીય સાથેના જે પણ સંબંધને શિષ્ટ પુરુષોથી પણ છુપાવવો પડે એ સંબંધમાં આગળ વધવું જ નહીં.

બની શકે કે આગળ વધતો એ સંબંધ ક્યારેક જીવનભર મેળવેલ ઈજજતની સ્મશાનયાત્રા કાઢીને જ રહે.




174 લોખંડને લોહચુંબક તરફ ખેંચાતું અટકાવવું હોય તો બે જ વિકલ્પ છે.

૧. કાં તો એ લોહચુંબકથી દૂર થઈ જાય અથવા ૨. એ પોતે કાટવાળું બની જાય.

મનને વાસનાને આધીન બનતું અટકાવવાના બે જ વિકલ્પ છે.

૧. કાં તો વાસનાના નિમિત્તોથી દૂર થઈ જવું ૨. અથવા મનોબળ મક્કમ બનાવી દેવું.



175 ખુફી રહેલ દર્દીની તપેલી જેમ કાગડા માટે આમંત્રણનું કારણ બની રહે છે, હાથમાં ખુફી રહેલ સંપત્તિ જેમ ગુંડા માટે આમંત્રણનું કારણ બની રહે છે તેમ, શરીર પરની વિભૂષા, ઉદ્ભટ વસ્ત્રોનું પરિધાન વિજાતીયને શીલ લૂંટવા માટેનું અને શરીરને ચૂંથવા માટેનું આમંત્રણ બની રહે છે એ સો ટકાની વાત છે.

સાવધાન!



176 રોગ સાથે મનનું થઈ જતું સમાધાન રોગને જો શરીરમાં રહી જવાની અનુકૂળતા કરી આપતું હોય છે તો વાસના સાથે થઈ જતું મનનું સમાધાન વાસનાને મનમાં રહી જવાની અનુકૂળતા કરી આપતું હોય છે, યાદ રાખજો, રોગ અસાધ્ય હોય તો એની સાથે સમાધાન કરી પણ લેવું પડે છે, પણ વાસના તો સાધ્ય જ છે. એની સાથે સમાધાનની જરૂર નથી જ.



177 મન જેનું વશમાં નથી,
સમ્યક્માં જેને રસ નથી. સત્વ ક્ષેત્રે
જેની પાસે કોઈ કસ નથી. પ્રવૃત્તિ જેની પાસે
સરસ નથી અને જીવનમાં પ્રવેશવા માગતા
અનિષ્ટોને 'ખસ' કહેવાની જેની પાસે હિંમત નથી એ
આત્માનું વાસનાની સામે ઘૂંટણિયે પડી જવાનું પાકું જ છે.
યાદ રાખજો, વાસના એ મનને પસંદ એવું અનિષ્ટ છે.
એ સીધું ટળવાનું તો નથી જ.



178 પેટ્રોલ એ જો ગાડીનો ખોરાક છે અને ભોજન એ જો
પેટનો ખોરાક છે, પૈસા એ જો વેપારનો ખોરાક છે અને જળ એ
બગીચાનો ખોરાક છે, તો શરીરની વધુ પડતી
આળપંપાળ અને મનની વધુ પડતી નવરાશ એ
વાસનાનો ખોરાક છે.

વાસનાનાં શરીરને કમજોર બનાવી
દેવું છે? શરીરને શ્રમ આપો અને મનને
વ્યસ્ત રાખો. બહુ મોટો જંગ
જીતી જવાશે.

179 જે રસ્તા પર END હોય છે એ રસ્તા પર ચાલતા ચાલતા પગને ક્યાંક તો અટકી જ જવું પડે છે, પણ જે રસ્તા પર END હોતો જ નથી એ રસ્તા પર ચાલતા ચાલતા પગને ક્યાંક અટકાવી દેવા પડે છે.

જરૂરિયાત એ END વાળો રસ્તો છે. શરીર ક્યાંક તો અટકવાનું જ છે, પણ ઈચ્છા એ END LESS રસ્તો છે. ત્યાં કો'ક બિંદુ પર મનને અટકાવી જ દેવું પડશે. જો એમાં થાપ ખાઈ ગયા તો જીવનની શાંતિ અને મનની પ્રસન્નતા રફે-દફે થઈ જશે.



180 આવશ્યકને 'કલંક'નું અને 'પતન'નું કારણ બનતું અટકાવવામાં ખાસ વાંધો નથી આવતો, પણ જે આકર્ષક છે અથવા તો મનને આકર્ષક લાગે છે એ જીવન માટે કોઈ પણ પળે 'કલંક'નું અને 'પતન'નું કારણ બની શકે છે.

આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને જીવનને 'આકર્ષક'થી દૂર રાખવા ખાસ પ્રયત્નશીલ બન્યા રહેવા જેવું છે.



181 યુદ્ધના મેદાનમાં
ક્યારેક સાધન નથી પણ
હોતું તો ય કેવળ સામર્થ્યના

જોરે પણ સેનાધિપતિ યુદ્ધને જીતી લેતો હોય છે.

વાસના પર વિજય પ્રાપ્ત કરવાના અન્ય જે પણ સાધનો હોય
તે પણ સામર્થ્ય તો એક જ છે, એના પ્રત્યેનો તીવ્રતમ નફરતભાવ.

ઍટ્સમૅનની વિકેટ લેવામાં બૉલરને મળતી સફળતામાં
ઍટ્સમૅન પ્રત્યે બૉલરના મનમાં ઘઘકતો તીવ્રતમ નફરતભાવ
અતિ મહત્વનો ભાગ ભજવતો હોય છે. આ વાસ્તવિકતા આપણે
સતત આંખ સામે રાખવાની જરૂર છે.



182 વર્તમાનયુગની આમ તો જાતજાતની અનેક ઓળખાણ છે,
પણ એમાંની એક ઓળખાણ આ છે કે-વર્તમાનયુગ એ
અંગપ્રદર્શનનો યુગ છે.

આવા યુગ વચ્ચે જીવતા રહીને મનને વાસનાથી ઉત્તેજિત
થતું અટકાવવામાં જો સફળ બન્યા રહેવું હોય તો એનો શ્રેષ્ઠતમ
વિકલ્પ આ છે કે અંગનિરીક્ષણથી
આપણે બચતા રહેવું. એમાં આપણે
જેટલા સજાગ, આપણી પવિત્રતા
એટલી સહજ!



183 શરદીથી પીડાતો બાબો દહીં માટે રડતો હોય એટલા માત્રથી મમ્મી એને દહીં આપી દેવાની ઉદારતા (?) જો નથી જ કરતી તો વિષયલંપટ મન વાસનાપૂર્તિ માટે તડપતું હોય અને તરફડતું હોય એટલા માત્રથી એને વિષયોની સામગ્રીઓ આપતા રહેવાની ઉદારતા (?) આત્માએ પણ કરવા જેવી નથી જ.

યાદ રાખજો, લોહીથી ખરડાયેલા વસ્ત્રો લોહીથી સાફ થતા નથી અને થવાના પણ નથી.

184 પેટ સીમિત હોવાના કારણે પેટની ભૂખને એક સીમાએ તો શાંત કરી જ શકાય છે, પણ મન અસીમ હોવાના કારણે ત્યાંથી ઉદ્ભવતી વાસનાની ભૂખને તો કોઈ કાળે શાંત કરી શકાતી નથી.

યાદ રાખજો, મનમાં જાગતી વાસનાની ભૂખને શરીરના માધ્યમે શાંત કરવાના પ્રયાસોમાં શરીર થાકી જશે, કદાચ રોગોનું શિકાર બની જશે ત્યારેય મન તો ભૂખ્યું ડાંસ જ હશે.

185 એક વાત સતત આંખ સામે રાખવા જેવી છે કે કોઈ પણ પ્રકારના આચરણનું સાતત્ય કદાચ આદત બની પણ જાય છે તો ય આદત ક્યારેય સ્વભાવરૂપ તો ન જ બની શકે અને ખરેખર જે સ્વભાવરૂપ જ હોય છે એને ક્યારેય આચરણના સાતત્યની અપેક્ષા રહેતી નથી. ૧૮૦ ઉપવાસ કરશો તો ય શરીર એક સમયે તો ભોજન માગશે જ, પણ વાસનાનું લક્ષ્ય કદાચ જીવનભર શરીર નહીં માગે, કારણ કે વાસના એ આત્માનો સ્વભાવ જ નથી.

186 ગુટખા ખાવામાં જેને સુખનો અનુભવ થતો હોય એના સુખના અનુભવને પડકારવાનો ભલે હોતો નથી, પણ એ અનુભવ પર પસંદગી એટલા માટે ઉતારવાની નથી હોતી કે એ અનુભવ પરિણામે લમણે કૅન્સર ઝીંકતો હોય છે.

વાસનાપૂર્તિના સુખ માટે એટલું જ કહી શકાય કે ‘અલ્પ સુખ અનંત અપાય.’ શેં એ સુખ પર પસંદગી ઉતારાય ?



187 વાસનાના વિચારો કદાચ શરીરની પુખ્તતાની અપેક્ષા રાખતા હશે, પણ વાસનાના એ વિચારો પર સહજ અને સમ્યક્ નિયંત્રણ મનની પરિપક્વતા વિના સંભવિત નથી. અને યાદ રાખવું કે શરીરથી પુખ્ત તો ગદેડાઓ પણ થઈ જાય છે, પણ પડકાર છે એ મનની પરિપક્વતાનો જ છે.

188 ગાડીનો જે ડ્રાઈવર સ્પીડબ્રેકર પાસે પણ ગાડીની ગતિને ધીમી પાડતો નથી એ ડ્રાઈવર કદાચ ગાડી સાથે પોતાની જાનને પણ ખતરામાં નાખતો હોય છે.

વિવેક એ વાસનાના રસ્તા પરનું સ્પીડબ્રેકર છે. જે વ્યક્તિ એ સ્થળે પણ જો પોતાના વાસનાના આવેગને ‘વેગ’માં રૂપાંતરિત કરી દેવા તૈયાર થતી નથી એ વ્યક્તિ પોતાના આત્મા સાથે પોતાના શરીરને પણ નુકસાનીમાં ઉતારી બેસે છે.





189 આમ જોવા જઈએ તો જીવનના ત્રણ મહા દોષો કોઈ હોય તો એ છે, કામ, ક્રોધ અને લોભ.

શરીરનો સંયમ કામને હાહાકારસર્જક બનવા દેતો નથી.

વચનનો સંયમ ક્રોધને જીવનમાં પગદંડો જમાવવા દેતો નથી અને મનનો સંયમ લોભને બેકાબૂ બનતો અટકાવવામાં ગજબનાક સહાયક બને છે.



190 એક મસ્ત વાસ્તવિકતા આંખ સામે રાખવા જેવી છે કે લોભનું આયુષ્ય જેટલું લાંબુ હોઈ શકે છે, વાસનાનું આયુષ્ય એટલું લાંબું ક્યારેય હોઈ શકતું નથી.

કારણ ? લોભની ભૂખને શમાવવા શરીરની જરૂર નથી પડતી જ્યારે વાસનાની ભૂખને શમાવવા વચ્ચે શરીરને લાવવું જ પડે છે અને ‘થાકવું’ એ શરીરનો સ્વભાવ છે, ક્યાં સુધી શરીરને વાસનામાં જોડી શકાશે ?

191 જંગલમાં રહેતું હરણ વાઘ વચ્ચે ય સુરક્ષિત રહી જાય એટલા માત્રથી વાઘને સામે ચડીને મળવા જવાની ભૂલ તો એણે ન જ કરાય.

પ્રલોભનો વચ્ચે ય પવિત્રતા અકબંધ રાખવામાં સફળતા મળતી હોય તો ય સામે ચડીને પ્રલોભનો વચ્ચે જવાની બેવકૂફી અને બાલિશતા તો ન જ દાખવાય એ સતત યાદ રાખવું.



192 કોઈ પણ દેશના શાસકો પોતાના દુશ્મનોને નષ્ટ કરી દેવામાં ક્યારેય સફળ નથી જ બનતા છતાં ય એમને નિયંત્રિત કરી દેવામાં તો સફળ બનતા જ હોય છે.

વાસનાના વિચારોને નષ્ટ કરી દેવામાં આપણે સફળ ન પણ બનતા હોઈએ તો ય નિયંત્રિત કરી દેવાના આપણાં પ્રયાસો ચાલુ છે ખરા ?



193 ઉપાસના અને વાસના વચ્ચેનો એક અતિ મહત્વનો તફાવત આંખ સામે રાખવાની જરૂર છે.

ઉપાસનાની બુદ્ધિ જ્યારે પણ જાગે છે ત્યારે ઉપાસ્ય પાત્ર સાધ્ય બને છે, પણ વાસનાની બુદ્ધિ જ્યારે પણ જાગે છે ત્યારે વાસનાનું પાત્ર સાધન બને છે. ક્યાં ઉપાસનાનું શિખર અને ક્યાં વાસનાની ખાઈ ?

194 જીવનભર જો કીચડવાળા રસ્તા પર ચાલવાનું હોય અને ચાલતા ચાલતા ન જ પડવું હોય તો બે વિકલ્પના શરણે જવું જ પડે.

પગ મજબૂત અને હાથમાં રહેલ લાકડી મજબૂત.

પ્રલોભનો વચ્ચે જ જીવવા છતાં પતનથી બચવું હોય તો મનોબળ મક્કમ અને સદ્-આલંબનો મજબૂત આ બે જ વિકલ્પો છે.




195 સિન્નલની લાલ લાઈટ આગળ ડ્રાઈવરે ગાડી ઊભી રાખી જ દેવી પડે.

શિષ્ટ પુરુષોએ આંકેલી લક્ષ્મણરેખા પાસે વ્યક્તિએ ઊભા રહીજ જવું પડે. કારણ ? એકમાં ગાડીની સલામતી છે, બીજામાં પવિત્રતાની સલામતી છે. સાવધાન!

196 ‘મનમાં વાસનાના વિચારો ચાલ્યા જ કરતા હોય તો પછી મનનું દમન કરતા રહેવાનો અર્થ શો છે ?’ આવો દુઃખદ તર્ક આપતા મનને એટલું જ પૂછી લેવું કે ‘એમ તો દુશ્મનના ખૂનના વિચારો પણ મનમાં ચાલ્યા કરતા હોય છે. એ વિચારોને દબાવતા રહેવું કે પછી એને અમલમાં મૂકીને મનને એ વિચારોથી મુક્ત કરી દેવું ?

197 દેશ બંધારણથી ચાલે, કોર્ટ કાયદાથી ચાલે, સમાજ વ્યવસ્થાથી ચાલે, પણ જીવન ?

આગ્રહબુદ્ધિથી અર્થાત્ દમનથી અર્થાત્ નિયંત્રણથી જ ચાલે. જે જીવન દમનમુક્ત એ જીવન પતનયુક્ત બન્યું જ સમજો.



198 ‘મનમાં ચાલતા નબળા-નકામા-નીચ અને નુકસાનકારી વિચારોને દબાવવા નહીં. કારણ કે સ્પ્રિંગને દબાવતા રહેવાથી બમણા જોરથી એ ઉછળે છે’ આ માન્યતાનો જો જગત અમલ કરવા લાગે તો કોઈ પણ સંસ્થા, સમાજ, સરકાર કે પરિવાર શિષ્ટ રહી શકે જ નહીં. કારણ ? દરેકના મનમાં ઓછે-વતે અંશે ગંદા વિચારો આપતા જ રહેતા હોય છે.



199 વેગ અને આવેગ વચ્ચે જેમ આસમાન-જમીનનો ફેર છે, ક્રોધ અને ધેર વચ્ચે જેમ તળેટી-શિખરનો ફેર છે તેમ કામ અને કામાંધતા વચ્ચે સરસપ-મેરુ જેટલો ફેર છે. સદાચારથી નિયંત્રિત વાસના એ ‘કામ’ છે જ્યારે અનિયંત્રિત બે-કાબૂવાસના એ કામાંધતા છે.

આજે જે વાતાવરણ છે એ ‘કામ’નું નથી, ‘કામાંધતા’નું છે. એનાથી જાતને બચાવી લેવાની જરૂર છે.



200 વાસનાને સહજરૂપે નિયંત્રિત રાખવામાં જે પણ સફળ બનવા માગે છે એની પાસે બે વિકલ્પ છે.

૧. એ સદ્બુદ્ધિનો માલિક બની જાય.

૨. એ સંભિવત ન હોય તો છેવટે સાત્ત્વિક બુદ્ધિનો માલિક બની જાય.

સદ્બુદ્ધિ એ પ્રકાશવત્ છે જે પાપવિચારના અંધકારને ટકવા જ નથી દેતી જ્યારે સાત્ત્વિક બુદ્ધિ એ પોલિસ કમિશનરવત્ છે જે પાપવિચારના ગુંડાને ફાવવા-જીતવા જ નથી દેતી.



201 આંખ સામે થેપલા આવી જતા જો રોટલી સહજ જ છૂટી જતી હોય અને ઢોંસા આવી જવાથી થેપલા જો સહજ જ છૂટી જતા હોય તો આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે મંદરસ તીવ્રસ્થી બાધિત થાય છે.

વાસનાના વિચારોને નબળાં પાડી દેવા છે ? ઉપાસનાના ઉદાત્ત વિચારોમાં મનને રમમાણ કરી દો.

ઉદાત્ત અનુરાગ ગલત અભ્યાસ માટે અને ગલત સંસ્કારો માટે ચમદૂત સમાન પુરવાર થઈને જ રહે છે એ યાદ રાખવું.



202 રન-વે પર દોડતું વિમાન અને હાઈ-વે પર દોડતી ટ્રક એ વચ્ચેનો તફાવત ખ્યાલમાં છે ?

રન-વે પર દોડતું વિમાન કોઈ પણ પળે આસમાન તરફ ઉંચકાઈ જાય છે જ્યારે ટ્રક તો જીવનભર હાઈ-વે પર જ દોડતી રહે છે.

જીવનભર જે વાસનાપૂર્તિમાં જ ગળાડૂબ રહે છે એ ‘ટ્રકવત્’ છે. અલ્પ સમયમાં એમાંથી જે બહાર આવી જાય છે એ ‘વિમાનવત્’ છે.

આ તકને વધાવી લો

હજારો યાવત્ લાખો આત્માઓના વૈચારિક પરિવર્તનમાં, હૃદય પરિવર્તનમાં અને જીવન પરિવર્તનમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ લિખિત જે સાહિત્ય મંગળ નિમિત્તભૂત બની રહ્યું છે એ સાહિત્યની આપના ઘરમાં વહેલી તકે મંગળ પધરામણી થઈ જાય એવું જો આપ ઈચ્છતા હો તો આપ રૂ. ૫૦૦૦/- ભરીને આજે જ રત્નત્રયી ટ્રસ્ટના આજીવન સાહિત્ય સદસ્ય બની જાઓ.

અમે હાજરમાં રહેલ પુસ્તકોમાંથી ૨૫૦ રૂ. ની કિંમતના પુસ્તકો તથા ભાવિમાં પ્રકાશિત થનાર તમામ પુસ્તકો આપને વ્યવસ્થિત પહોંચતા કરશું.

તા.ક.પૂજ્યશ્રીનું સાહિત્ય હિન્દી ભાષામાં તથા અંગ્રેજી ભાષામાં પણ અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. આપ જો એ ભાષાના સાહિત્યને ઘરમાં વસાવવા માગતા હો તો એમાં પણ આજીવન સદસ્ય માટે આ જ યોજના છે.

રકમ ભરવાનું સ્થળ

રત્નત્રયી ટ્રસ્ટ
પ્રવીણકુમાર દોશી
૨૫૮, ગાંધી ગલી, સ્વદેશી માર્કેટ,
કાલબાદેવી રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૦૨
ફોન : ૦૨૨-૨૨૦૬૦૮૨૬
(બપોરે : ૧૨થી ૭)

રત્નત્રયી ટ્રસ્ટ
કલ્પેશ વિ. શાહ
૧૪, ઈલોરા પાર્ક સોસાયટી,
નારણપુરા ચાર રસ્તા પાસે, દેરાસર સામે,
નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩
ફોન : ૦૭૯-૨૭૬૮૦૭૪૬
(બપોરે ૧૨થી ૭)
Email: rttamd@yahoo.com

તા.ક.: સભ્ય બનનારને હાજરમાં રહેલાં પુસ્તકો આપવામાં આવશે. પુસ્તક પ્રકાશન થયા બાદ એક મહિનાની અંદર આપને મળી જશે. છતાં ન મળે તો ત્યાર બાદ સંસ્થાની ઓફિસે પૂછપરછ કરવા નમ્ર વિનંતી. આજીવન સભ્યોને પુસ્તક વિમોચન બાદ વ્યવસ્થિત વિતરણ કરવામાં આવે છે. છતાં કોઈ આજીવન સભ્યને પુસ્તક નહીં મળવા બાબત ફરિયાદ હોય તો સંસ્થાની ઓફિસે રૂબરૂ અથવા લેખિત ફરિયાદ મોકલવી. ટેલિફોન પર જવાબ આપવામાં આવશે નહીં તેની નોંધ લેવા વિનંતી.

ઘણાં લાંબા સમય સુધી આજીવન સભ્યો પુસ્તકો લઈ જતા નથી. તથા સરનામું બદલાયાની વિગત જણાવતા નથી તો આજીવન સભ્યોને ખાસ જણાવવાનું કે સંસ્થા છ મહિના સુધી રાહ જોશે અને ત્યાર બાદ લેવા આવશે તો તમારું આજીવન સભ્યમાંથી નામ રદ કરી નાખવામાં આવશે. જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.

આજે જ વસાવો



૧. જામી રાખો આરસની તકલી પર - ૭૦.૦૦

જે પુસ્તકની ૩,૬૫,૦૦૦ નકલ, ૬૩ આવૃત્તિ દ્વારા બહાર પડી છે એ આ પુસ્તક એક વાર તમે હાથમાં લો. તમારી આંખ આંસુ વહાવ્યા વિના નહીં રહે. અનેક મા-બાપોને પ્રસન્નતા આપવામાં સહાયક બનેલું અને અનેક પુત્રોને કૃતજ્ઞતાના ગુણ તરફ આંગળીચીધણું કરવામાં સહાયક બનેલું આ પુસ્તક તમારે ત્યાં હોવું જ જોઈએ.



૨. ઝેર જ્યારે લીલરી જાય છે - ૭૦.૦૦

જે પુસ્તકની ૨,૦૭,૦૦૦ ઉપરાંત નકલોનો ફેલાવો ધરાવતા આ પુસ્તકે અનેકાનેક સાસુ-વહુના સંબંધોમાં જામી ગયેલી દ્વેષની કડવાશ દૂર કરીને પ્રેમની પ્રતિષ્ઠા કરવામાં ગજબનાક સફળતા હાંસલ કરી છે. વહુને દીકરી બનવા મજબૂર કરતું અને સાસુને મા બનવા પ્રોત્સાહિત કરતું આ પુસ્તક તમે વસાવી જ લો.



૩. ALL THE BEST (કેલેન્ડર) - ૧૫૦.૦૦



૪. કલિયુગનો ચમત્કાર : કલ્પેશ વિ. શાહ - ૩૦૦.૦૦

સૂકા રાગમાં લીલોછમ ભગીચો ઊભો થઈ જાય એ ચમત્કાર નથી, આસમાન તરફ ઉઠાવેલ હાથમાં નીચે આવતા જ કંકુ આવી જાય એ ચમત્કાર નથી, સાગરનાં ખારાં જળ ગાગતરીની પળોમાં મીઠાં બની જાય એ ચમત્કાર નથી, પાગ ગઈકાલ સુધી જેનું જીવન ખુદને માટે ય ભારરૂપ હોય એનું જીવન આજે જાત અને જગત માટે ય આશીર્વાદરૂપ બની જાય એ જ અસલી ચમત્કાર છે. આવા ચમત્કારની સત્ય યશોગાથા એટલે જ કલિયુગનો ચમત્કાર : કલ્પેશ વિ. શાહ



૫. નહીં ભૂલાય ઈન્દૌર - ૨૦૦.૦૦

‘શ્રુતિ’નો વૈભવ તો આપણી પાસે કદાચ પર્યાપ્ત માત્રામાં છે, પાગ શ્રુતિના એ વૈભવને ‘કૃતિ’માં રૂપાંતરિત કરવા માટે આપણી પાસે ‘રુચિ’નો અને ‘સ્મૃતિ’નો વૈભવ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોવો જરૂરી છે. ઈન્દૌરની સ્થિરતા દરમ્યાન શ્રુતિ-રુચિ-સ્મૃતિ અને કૃતિના મંગળ ચતુષ્કના વૈભવને ધારાગ કરીને બેઠેલા જે કેટલાક વિરલાઓના જીવન પ્રસંગોને સાંભળવા-નિહાળવા મળ્યા એની યશોગાથા વાર્ણવતું પુસ્તક એટલે જ નહીં ભૂલાય ઈન્દૌર.



૬. કાયરતાનું સરનામું - ૧૦૦.૦૦

પકીચડ પગ બગાડે છે, કાંટો પગમાં પીડા ઉત્પન્ન કરે છે અને કાયરતા સામાને બદનામ કરતી રહે છે, પાણ મનનો એક દોષ એવો છે કે જે કીચડ, કંટક અને કાયરતા ત્રાણેયનું પ્રતિનિધિત્વ ધરાવે છે. કયો છે એ દોષ ? હાથમાં લો આ પુસ્તક, કાયરતાનું સરનામું.



૭. YES I CAN - ૨૦૦.૦૦

‘કાં તો બધું જ કરવું અને કાં તો ઘણું-બધું કરવું’ આ મનનું ગણિત છે, જ્યારે પ્રભુની આજ્ઞા આ છે કે ‘તારાથી થાય એટલું સારું બધું જ કરવું અથવા તો કરવાની તીવ્ર ભાવના રાખવી’ પ્રભુની આ આજ્ઞાને આંખ સામે રાખીને અહીં કેટલીક એવી વાતો લખી છે કે જેને વાંચતા અને જેના પર વિચાર કરતાં મનમાંથી તુર્ન જ આ અવાજ ઊઠવા લાગે કે YES I CAN.



૮. યાત્રા, મારાથી મારા તરફ... - ૭૦.૦૦

ધરતી પરથી આસમાન તરફની યાત્રા સુગમ છે, મુંબઈથી સમેતશિખર તરફની યાત્રા પાણ સુગમ છે, અરે, મનુષ્યલોકથી સ્વર્ગલોક તરફની યાત્રા પાણ સુગમ છે, પાણ કઠિનતમ યાત્રા છે, મારાથી મારા તરફની યાત્રા. શેં એ યાત્રા શરૂ કરવી ? અને શેં એ યાત્રાને મંજિલે પહોંચાડવી ? એની આગવી યુક્તિઓ દર્શાવતું પુસ્તક એટલે જ યાત્રા, મારાથી મારા તરફ...



૯. એમાં થઈ શું ગયું? - ૨૦૦.૦૦

ધારણા બહારનું કલ્પના બહારનું, કશુંક પાણ આગમતું જીવનમાં બની જાય છે અને મનમાં એક ભાવ ઊભો થઈ જાય છે કે ‘આ શું થઈ ગયું?’ પાણ આ ભાવથી ઊભી થઈ જતી મનની અસ્વસ્થતાને રવાના કરી દેવા, નપુંસક બનાવી દેવા, કમજોર બનાવી દેવા જે કેટલીક યુક્તિઓ હૃદયમાં ઊગી છે અને દર્શાવતું પુસ્તક એટલે જ ‘એમાં થઈ શું ગયું?’



૧૦. અમૃતની યાત્રા - ૨૦૦.૦૦

યાત્રા ! ધનલંપટ પાસે એક જ યાત્રા હોય છે, સંપત્તિની યાત્રા. અર્ધલંપટ પાસે એક જ યાત્રા હોય છે, શક્તિની યાત્રા. અધિકારલંપટ પાસે એક જ યાત્રા હોય છે, સત્તાની યાત્રા. આકર્ષણલંપટ પાસે એક જ યાત્રા હોય છે, સૌંદર્યની યાત્રા, પાણ જે સાધક છે, આરાધક છે, ઉપાસક છે એની પાસે તો એક જ યાત્રા હોય છે, અમૃતની યાત્રા. એ યાત્રાનું આપણાં મનમાં શેં આકર્ષણ ઊભું થાય ? હાથમાં લો આ પુસ્તક, ઘણાં સમાધાનો મળી રહેશે.



૧૧. અનહદ છે જેની સરહદ - ૨૦૦.૦૦

પથથરમાં પ્રભુની પ્રતિમાનું નિર્માણ થઈ શકે છે. પ્રકાશના માધ્યમે પ્રભુ પ્રતિમાના દર્શન થઈ શકે છે. પાણી અભિષેકના માધ્યમે પ્રભુની પ્રતિમાને સ્પર્શી શકે છે. પુણ્ય સાક્ષાત્ જીવંત પરમાત્માનો ભેટો કરાવી શકે છે, પાણ પ્રેમ ? એ તો આત્માને પરમાત્મા બનાવી શકે છે. આત્માને પરમાત્મા બનાવી દે છે. પરમાત્માની જગતના જીવમાત્ર પ્રત્યેની અનહદ કરુણા એ જ જે પરમાત્માની કરુણાની સરહદ છે તો આત્માને પરમાત્મા બનાવી દેતો જીવમાત્ર પ્રત્યેનો અનહદ પ્રેમ એ જ આત્માના પ્રેમની સરહદ છે. શી રીતે ? એ જાણવું હોય તો હાથમાં લો આ પુસ્તક અનહદ છે જેની સરહદ.

हिन्दी साहित्य

- दो कदम विस्मरण से स्मरण की ओर – किंमत : ७०.००
प्रेम की मीठी नजर, मिटे द्वेष का जहर – किंमत : ७०.००
कलियुग का चमत्कार कल्पेश वी. शाह – किंमत : ३००.००
एक यात्रा, भीतर की ओर... – किंमत : ७०.००
YES I CAN – किंमत : २००.००
ALL THE BEST (केलेन्डर) – किंमत : १५०.००
इसमें हो क्या गया ? – किंमत : २००.००
अनहद है जिसकी सरहद – किंमत : २००.००

अंग्रेज़ी साहित्य

- GUIDING STARS - Rs. 70.00
MY INDIA NOBLE INDIA - Rs. 150.00
ALL THE BEST (Calendar) - Rs. 150.00
NO END ZONE - Rs. 200.00

मराठी साहित्य

- मनाच्या आरश्यावर कोरून ठेवा – किंमत : ४०.००
हृदयाची गोष्ट – किंमत : ४०.००
संघर्ष – किंमत : ७०.००
प्रेममयी पत्रमाला – किंमत : ७०.००
परीक्षेचे जीवन-जीवनाची परीक्षा – किंमत : ७०.००
माझा भारत सुंदर भारत – किंमत : १५०.००
सात ओळी – किंमत : १५०.००

उर्दू साहित्य

- نقش کر لیجئے
آئینہ دل پر - Rs. 30.00
(‘दुषी राप्पो आरसनी तकती पर’ नो उर्दू भावानुवाद)

इन्थ साहित्य

- Engravez-le sur votre coeur - Rs. 100.00
(‘दुषी राप्पो आरसनी तकती पर’ नो इन्थ भावानुवाद)

જે બે પુસ્તકોએ સેંકડો-હજારો અને કદાચ લાખો કુટુંબોમાં પ્રેમ - પ્રસન્નતા -
પવિત્રતાનું વાતાવરણ સર્જ્યું છે એ બન્ને પુસ્તકોની આ છે વિકાસયાત્રા

ભાષા	નામ	આવૃત્તિ	નકલ
ગુજરાતી	લખી રાખો આરસની તકતી પર	૬૩	૩,૬૫,૦૦૦
હિન્દી	दो कदम विस्मरण से स्मरण की ओर	૨૯	૧,૩૫,૦૦૦
મરાઠી	मनाच्या आरश्यावर कोरून ठेवा	૧૧	૨૭,૫૦૦
અંગ્રેજી	Carve It On Your Heart	૧૦	૨૪,૫૦૦
ઉર્દૂ	نقش کر لیجئے آئینہ دل پر	૩	૭,૦૦૦
સિંઘી	जिन जे लाइ मुआसीं से कांधी बि न बणिया	૨	૫,૦૦૦
તમિલ	இதயத்தை செதுக்கிவிடு அன்பை அள்ளித்தந்திவிடு	૧	૨,૦૦૦
કન્નડ	ಮಠವೆಯಿಂದ ಅರಿವಿನೆಡೆಗೆ ಎರಡು ಹೆಜ್ಜೆ	૧	૩,૦૦૦
બંગાળી	শ্রীটা হোম্বার হৃদয়ে খোদাই করে রাখো	૧	૩,૦૦૦
ફ્રેન્ચ	Engravez-le sur votre coeur	૧	૨,૦૦૦
સંસ્કૃત	स्मरणं जीवनम् विस्मरणं मरणम्	૧	૭૫૦
		કુલ નકલ	૫,૭૪,૭૫૦

ગુજરાતી	એર જ્યારે નીતરી જાય છે	૩૭	૨,૧૨,૦૦૦
હિન્દી	प्रेम की मीठी नजर मिटे द्वेष का जहर	૨૫	૧,૦૦,૫૦૦
મરાઠી	विष जेव्हा उतरते तेव्हा	૫	૧૩,૦૦૦
અંગ્રેજી	Sweeten Your Heart	૩	૬,૦૦૦
સંસ્કૃત	विषवलय	૧	૫૦૦
		કુલ નકલ	૩,૩૨,૦૦૦

તમે આ બન્ને પુસ્તકો હજી સુધી ન વસાવ્યા હોય તો વસાવી લો અને હજી સુધી ન
વાંચ્યા હોય તો વાંચી લો - પ્રસન્નતાની કોક અલગ જ અનુભૂતિ તમે કરી શકશો.

દ. રત્નત્રયી ટ્રસ્ટ



આનંદનો અવસર

એક એવો સુવર્ણ અવસર જેમાં તમે આનંદના આકાશમાં ઊડી શકો છો...

એક એવું સ્થાન જ્યાં તમે પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. ની જિનશાસનપ્રભાવના અને રક્ષાનાં કાર્યોને નિકટથી નિહાળી શકો છો.

એક એવો સંવાદ જેના દ્વારા તમે તમારી સમસ્યાનાં સમાધાનની સુગંધને માણી શકો છો...

એક એવું સરનામું જ્યાં તમે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન પ્રવાહમાં ડુબકી લગાવી શકો છો...

આ સુવર્ણ અવસર એટલે

www.ratnaworld.com

એક સમય હતો જ્યારે લોકોને પાણી લેવા કૂવા પાસે જવું પડતું હતું. આજે નળ દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે છે. તેમ છેલ્લા કેટલાય વખતથી લોકોની માંગણીને માન આપીને રત્નત્રયી ટ્રસ્ટે આ વેબસાઈટ શરૂ કરી છે જેનાં દ્વારા તમે ઘરે બેઠાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં સાહિત્યને - સિદ્ધિઓને - સમાચારને જાણી-માણી શકશો...

આજે જ આ વેબસાઈટનાં પ્રવાસે પધારો. અકલ્પનીય આનંદની અનુભૂતિ તમને થઈને જ રહેશે.

૬. રત્નત્રયી ટ્રસ્ટ



એમને રત્નત્રયી ટ્રસ્ટના આધારસ્થંભ બનાવતાં અમે ગૌરવ અનુભવીએ છીએ

નરેશકુમાર નેમચંદ શાહ, મોટા ભમોદરાવાળા. હાલ સુરત

- પૂ. સુ. શ્રી તત્ત્વસુંદર વિ.મ. ની શુભ પ્રેરણાથી
અ. સૌ. વસંતબહેન રાયચંદ દોશી પરિવાર, દેપલાવાળા. શૈલેષ ● દીપક
- ઓતમચંદ ધરમચંદ દોશી પરિવાર, દેપલાવાળા. હ. વિનોદ ● કીર્તિ ● અજય - સુરત
- રજનીકાન્ત સારાભાઈ ઝવેરી, મુંબઈ. શ્રીમતી રજનીકાન્ત ઝવેરી - મુંબઈ
- અરવિંદકુમાર કેશવલાલ શાહ પરિવાર - મલાડ
- શાંતિલાલ ગિરધરલાલ દોશી, દેપલાવાળા. હ. લલિત ● પ્રકાશ ● હસમુખ
- અ. સૌ. જશુમતી બિપીનચન્દ્ર શાહ, નંદરબારવાળા. હાલ સુરત હ. પ્રીતિ ● સંજય ● મયૂરી ● બેલા ● સુનીષ
- પૂજ્ય મંગુબહેન ગફુરચંદ શેઠ પરિવાર - સાન્તાકુઝ
- કિશોરભાઈ ભીમજીભાઈ સંઘવી
- શ્રીમતી હસુબહેન શાંતિલાલ શાહ (સિહોર - હાલ મુંબઈ)
હ. નીલકમલભાઈ ● રજનીભાઈ ● ઈલાબહેન ● નીતાબહેન
- રાઘનપુરનિવાસી પ્રભાવતીબહેન રસિકલાલ મસાલિયા પરિવાર
હાલ બોરીવલી હ. પ્રકાશભાઈ ● દીનાબહેન ● અમીત ● ચૈતાલી
- વીરચંદભાઈ ભૂદરભાઈ શાહ પરિવાર - વાવવાળા
- રમણલાલ અમૃતલાલ શાહ, નિકોરાવાળા. હાલ સુરત
- પ્રવીણાબહેન પ્રવીણચન્દ્ર શાહ (લીંબડીવાળા) હાલ ઘાટકોપર
- ચન્દ્રાબહેન ચન્દ્રકાન્ત ખેતશીભાઈ શાહ પરિવાર હ. વિક્રમભાઈ ● પ્રીતિબહેન ● સંપ્રીત (યોગીનગર) - બોરીવલી.
- અ. સૌ. ભગવતીબહેન કાંતિલાલ સાલવી (પાટણ). હાલ અંધેરી. હ. હેમંત ● જયમીની ● જતીન ● ઉષ્મ
- ભાણભાઈ નાનજી ગડા પરિવાર. કચ્છ મેરાઉ. હાલ - વડાલા
- શ્રીમતી શાંતાબહેન ચંપકલાલ ગિરધરલાલ શાહ પરિવાર
(સિહોરવાળા) હાલ મુંબઈ. હ. હસમુખ ● જ્યોત્સ્ના ● વિરલ ● સલોની
- શારદાબહેન રમણલાલ શાહ - સાયન. હ. કિરીટભાઈ ● ચિ. રીહેન
- અનુપમા કિરીટભાઈ શાહ પરિવાર. હ. સૌરીન ● શીતલ ● રોમા
- પૂ. સાધ્વીજી શ્રી પુણ્યનિધિશ્રીજી મ.સા. ની પ્રેરણાથી શ્રીમતી કલાવતીબહેન મગનલાલજી કાંકરીયા
હ. ચેતન ● કુમારપાળ ● ભારતી ● ગુણમાલા ● સુષ્ટિ
● ઋષભ ● પ્રતીતિ ● આદિતી ● સંગીતા ● રાજેશ્રી ● આરતી
- સ્વ. પૂ. પિતાશ્રી હિંમતલાલ પોપટલાલ મહેતાના આત્મશ્રોયાર્થે હ. રમેશ ● કુમાર ● દીલેશ
- પ્રવીણાબહેન હિંમતલાલ મહેતા પરિવાર - માટુંગા હ. ભારતી ● હીના ● શિલ્પા
- સ્વ. મનુબહેન જમનાદાસ મહેતા પરિવાર - મુંબઈ
- લીલાચંદ તારાચંદ શાહ પરિવાર - વલસાડ
- જમુબહેન લીલાચંદ શાહ પરિવાર - વલસાડ
- સ્વ. પૂ. સાધ્વીજી શ્રી હેમરત્નાશ્રીજી મહારાજના સંયમજીવનની અનુમોદનાર્થે. શ્રીમતી પદ્માબેન નેમિચંદજી કોઠારી
- કે. પી. સંઘવી - સુરત
- સુલતાનસિંઘ ફત્તેહલાલ સંઘવી હ. રાજુલ ટેક્ષટાર્ઠલ મીલ, કડોદરા - સુરત
- ડુમસ (સુરત) મુકામે ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવની અનુમોદનાર્થે
અમી કુમાર મહેતા પરિવાર - માટુંગા
- ચંચળબહેન ઊગરચંદભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ
- શ્રી ભીખુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ - અમદાવાદ. હ. શ્રી વિજયભાઈ શાહ

- કિરીટભાઈ જમનાદાસ મહેતા પરિવાર - દાદર
- ઉત્પલ કિરીટભાઈ મહેતા - દાદર
- અ.સૌ. અરુણાબહેન કિરીટભાઈ - દાદર
- મનીષા કિરીટભાઈ - દાદર
- વિ. મનીષ અને અ.સૌ. હર્ષાના વરસીતપની અનુમોદનાથે માતુશ્રી પ્રવીણાબહેન પ્રવીણચન્દ્ર (લીબડીવાળા) હાલ. ઘાટકોપર
- સંઘવી લહેરીબહેન મોડીલાલ શાહ પરિવાર - સાયરાવાળા (હાલ સુરત)
- હ. ચન્દુભાઈ ● શોભાબહેન ● શ્વેતા ● મુશ્મૂ ● વિપુલ
- રાજેન્દ્રભાઈ અંબાલાલ શાહ - અમદાવાદ
- સ્વ. માતુશ્રી તથા પિતાશ્રી સંતોકબહેન બેચરભાઈના સ્મરણાર્થે
- હ. કાનજીભાઈ ● મંજુલાબેન ● જિજ્ઞેશકુમાર ● રેણુકા ● ઊર્જા (હાલ પુના)
- લીનાબહેન વિપુલભાઈ મોદી. હ. જીમિત ● મિલોની
- પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ની સૂરિમંત્રની પંચમ પીઠિકાની આરાધનાની અનુમોદનાથે
- હ. માતુશ્રી પ્રવીણાબહેન હીમતલાલ મહેતા. હ. કુમાર, હીના, અમી - માટુંગા
- પૂ. પં. શ્રી પદ્મસુંદરવિજયજી ગણિની શુભ પ્રેરણાથી
- શાંતાબહેન ચંપાલાલ કેશવલાલ - નાસિક હ. અનિલ તથા દિલીપ
- અ.સૌ. હેમલતાબહેન બાબુલાલ શાહ (લીબડી) - હાલ ઘાટકોપર
- હ. જિજ્ઞેશ ● છાયા, હિનેશ ● વૈશાલી, શીલ્યા ● વિશ્વા ● પ્રશ્મી
- પૂ. મુ. શ્રી યુગસુંદર વિ. મ. ના સંયમજીવનની અનુમોદનાથે પૂ. માતુશ્રી સ્વ. વીરબાળાબેન જયંતિલાલ મહેતા પરિવાર
- વાંકાનેરવાળા - હાલ મલાડ હ. કિશોર, હંસા ● હર્ષદ, દીપિકા ● જીતુ, જયશ્રી
- પૂ. પં. શ્રી પદ્મસુંદરવિજયજી મહારાજની શુભ પ્રેરણાથી વિદ્યાબેન અમૃતલાલ શાહ
- (પ્રાતિયાવાળા) હ. દીપક (મિકસરવાળા) ● ફાલના ● હાર્દિ ● કેશા હાલ - અમદાવાદ
- શ્રી દેવ-રત્ન-ચંપાબેન આરાધના ભવનના ઉદ્દઘાટન નિમિત્તે માતુશ્રી પ્રવીણાબેન હિંમતલાલ મહેતા તરફથી
- હ. દિલેશભાઈ ● શિલ્પાબેન ● પલક ● સનમ - વડોદરા
- પૂ. મુ. શ્રી તત્ત્વવર્ધન વિ. મ. સા. તથા પૂ. મુ. શ્રી તત્ત્વદર્શન વિ. મ. ની
- શુભ પ્રેરણાથી મહેતા મણીલાલ હરખચંદ પરિવાર રાપરવાળા - હાલ ભુજ
- પૂ. માતુશ્રી ઈન્દુબેન નટવરલાલ પ્રેમચંદ શાહ હ. કેતન ● નિશા, પ્રદીપ ● ભાવિની, અંકિત ● કેવન,
- હિરલ ● અર્પિત ● અક્ષિત તથા સમસ્ત સોલંકી પરિવાર વાગલધરા (વલસાડ)
- પાર્શ્વનાથ પ્રભુના જન્મકલ્યાણકના મંગળ દિને જ પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરિ મ. સા. ના
- આવતા જન્મદિનની ખુશાલીમાં - પ્રવીણાબેન પ્રવીણચન્દ્ર શાહ પરિવાર - (લીમડી) હાલ - ઘાટકોપર
- પ. પૂ. ઉપકારી આ. ભ. શ્રી રત્નસુંદરસૂરિ મ. સા. ના પદ, માં જન્મદિન નિમિત્તે પૂ. પં. શ્રી પદ્મસુંદર વિ. મ. ની શુભ પ્રેરણાથી
- સ્વ. માતુશ્રી કમળાબેન અંબાલાલ (ખદાણાવાળા) પરિવાર નારણપુરા - અમદાવાદ, નાગેશ્વર જૈન તીર્થ
- હ. ભૂપેશ ● પ્રકાશ ● સોહિણી ● સંગીતા ● એશા ● વર્ષાલ
- પૂ. આ. ભ. શ્રી રત્નસુંદર સૂ. મ. ના પદ મા જન્મદિનની ખુશાલીમાં પૂ. પં. શ્રી પદ્મસુંદર વિ. મ. ની
- શુભ પ્રેરણાથી રાજેશ કેસરીચંદ શાહ પરિવાર (રોહીડા - રાજસ્થાન) હાલ ભરૂચ હ. રૂપલબેન ● પામી ● ઋષભ
- ભુજ (કચ્છ) ચાતુર્માસ દરમ્યાન પૂ. મુ. શ્રી તત્ત્વવર્ધન વિ. મ. તથા પુ. મુ. શ્રી તત્ત્વદર્શન વિ. મ. ની પ્રેરણાથી
- “એક્સ-રે” પુસ્તકના કરેલ વિમોચનની ખુશાલીમાં કુબડીયા વેલજી મલુકચંદ પરિવાર (લાકડીયાવાળા) હાલ - મુંબઈ - દાદર
- પ. મુ. શ્રી ભાગ્યસુંદર વિ. મ. ના સંયમજીવનની અનુમોદનાથે
- તારાબેન અમરચંદ જી બેદમુથા હ : માણેકભાઈ ● દિનેશભાઈ - બોરડી
- પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરિ મ. સા. ના ઉપકારોની સ્મૃતિમાં તથા પૂ. મુ. શ્રી વાત્સલ્યસુંદર
- વિ. મ. અને પૂ. મુ. શ્રી પરાર્થસુંદર વિ. મ. ના સંયમજીવનની અનુમોદનાથે હ. મુદુલાબેન મુકુન્દભાઈ દોશી પરિવાર
- જયેશ ● પંકજ ● ચન્દ્રેશ ● સોનલ ● વર્ષા ● શૈલા ● અમી
- શીતલ ● વૈશાખી ● પારસ - સાન્તાકુઝ (મુંબઈ)
- પૂ. મુ. શ્રી વાત્સલ્યસુંદર વિ. મ. ની પ્રેરણાથી સ્વ. રમાબેન પ્રવીણચન્દ્ર કોઠારી
- હ. હેમંત ● પંકજ ● દીપક ● યોગેશ ● મીના મહેન્દ્ર દોશી પરિવાર
- દેવાશીપ ● સચીન ● કુમાર ● હર્ષ ● રિશિકા ● જિનેશ્વર ● મયંક - ઈન્દોર

- મનીષાના ભદ્રતપની અનુમોદનાર્થે ડ. કિરીટભાઈ - અરુણાબેન - ઉત્પલ - દાદર
- રીશીન રાજેન્દ્ર શાહ - ચાર્મી ચિંતન શાહ
- ડૉ. હરીશભાઈ મહેતા ● ઈલાબેન મહેતા ● મિલન મહેતા ● મહેંક મહેતા ● કૃપા મહેતા - રાજકોટ
- ૨૦૦ મા પુસ્તકના વિમોચનના મળેલ લાભની ખુશાલીમાં અ.સૌ. હીના કુમાર મહેતા - માટુંગા
- પૂજ્યશ્રીના આચાર્ય પદના ૧૨ મા વરસના પ્રવેશની ખુશાલીમાં અ.સૌ. મધુકાંતા પ્રતાપરાય દોશી
હ. મુકેશ ● રેખા ● જેનિલ ● વત્સલ - સાંતાક્રુઝ (મુંબઈ)
- કીરિટકુમાર જમનાદાસ મહેતા - દાદર
- અરુણાબેન કીરિટકુમાર મહેતા - દાદર
- પૂ.પં.શ્રી સત્યસુંદર વિ.મ. ની પ્રેરણાથી સ્વ. સીતાબેન કાંતિલાલ ભીખાભાઈ પરિવાર અનાવલવાળા - બારડોલી
હ. રમેશભાઈ - જાગૃતિબેન ● રસિકભાઈ - આશાબેન ● મહેન્દ્રભાઈ સાવિત્રીબેન ● જીતેશભાઈ - રૂપાબેન
- પૂ.પં.શ્રી સત્યસુંદર વિ.મ.ના ૨૬ વરસના સંયમજીવનની અનુમોદનાર્થે હ. સત્યમૂ ફેન્ડ્સ ટ્રુપ
● હસ્તીમલભાઈ ● સુરેશભાઈ ● પરેશભાઈ ● ભાવેશભાઈ ● મહેન્દ્રભાઈ
- પૂ.પં.શ્રી પદ્મસુંદર વિ. ગણિવરની પ્રેરણાથી માતૃશ્રી મનોરમાબેન નેમિચંદજી કણાવટના
આત્મશ્રેયાર્થે અનોપચંદનજી, રીતેશ - સતીષ નેમિચંદજી કણાવટ - દહાણુરોડ
- વિ. અમૃતાના માસખમણની તથા અઢારિયાની અનુમોદના નિમિત્તે હ. સોના પ્રીત - મુંબઈ
- પૂ.આ.ભ. શ્રી રત્નસુંદર સૂ.મ. દ્વારા દિલ્લીમાં થઈ રહેલ
ધર્મ-શીલ-સદાચાર-સંસ્કાર રક્ષાના કાર્યોની અનુમોદનાર્થે તથા
પૂ.મુ. શ્રી પરાર્થસુંદર વિ.મ.ના છ વરસના સંયમ પર્યાયની અનુમોદનાર્થે
હ. પ્રતિભાબેન બકુલભાઈ કાપડીયા. મિહિર ● રીના ● આર્ય - વિલે પાલાં (મુંબઈ)
- પૂ. પિતાશ્રી લલિતભાઈ ગુલાબચંદ શાહના ૭૧ મા વરસના મંગળ પ્રવેશની ખુશાલીમાં
હ. હિતેશ ● સોના ● અમૃતા ● પ્રીત (વેરાવળ)
- પ.પૂ. માતૃશ્રી શાંતાબેન તથા પ.પૂ. પિતાશ્રી વનમાળીદાસ શાહના
સુકૃત સંભારણા સ્વરૂપે રાખેલ જીવિત મહોત્સવ પ્રસંગે...
હ. ધાત્રિકાબેન કલ્પેશભાઈ શાહ - સેટેલાઈટ, અમદાવાદ. ● પુત્ર: કર્તવ્ય, રૈવત ● પુત્રી: દેશના
- પૂ.પં.શ્રી પદ્મસુંદર વિ. ગ.ની પ્રેરણાથી
ચંદનબેન કેશવલાલ દેવચંદના આત્મશ્રેયાર્થે, ગામ - થલવાડા, હાલ મુંબઈ. હ. શોભનાબેન રજનીકાંત શાહ,
● અમિત ● નીકુંજ ● રાખી ● શીતલ ● મૈત્રી ● આયુષી ● મહેંક ● આરવ
- પ્રવીણાબેન મનસુખલાલ શાહ - રોનક પરિવાર હ. રાજુ-સંગીતા, મુકેશ-ગીતા, નયન-ચેતના,
પરેશ-બીના, રોનક-સુરભિ, રોશની-રાહુલ, મુંબઈ / સુરત / ભાવનગર
- શ્રીમતી મંજુલાબેન ઈન્દ્રવદનભાઈ શાહ તથા ચીં. રાજુલ ધીમંતભાઈ શાહના આત્મશ્રેયાર્થે યુનાભટ્ટી - મુંબઈ
- સ્વ. ગુલાબચંદભાઈ હરજીવનદાસ ઘેલાણી - ધારીવાળા - (હાલ - દિલ્લી)
- લીલાવંતીબેન ગુલાબચંદભાઈ ઘેલાણી - ધારીવાળા - (હાલ - દિલ્લી)
- દિનેશભાઈ ગુલાબચંદભાઈ ઘેલાણી - ધારીવાળા - (હાલ - દિલ્લી)
- વિજયભાઈ ગુલાબચંદભાઈ ઘેલાણી - ધારીવાળા - (હાલ - દિલ્લી)
- કલિયુગની કમાલ, કુમારપાળ વિ. શાહ ! પુસ્તકના વિમોચનના મળેલ લાભની ખુશાલીમાં
અ.સૌ. જશુમતી બિપીનચંદ્ર શાહ, નંદરબારવાળા, હાલ સુરત
હ. ડૉ. સંજય, પ્રીતિ, સુનીષ, શ્રદ્ધા, ભાવિક, નૈતિક, મેઘ, વ્યૈમા
- શારદાબેન મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ હ. શ્રમણોપાસિકા શ્રીમતી શારદાબેન યુ. મહેતા (ટોરેન્ટ પરિવાર)
- પરમ ઉપકારી શ્રી નાથાલાલ (ડીસા) શ્રી ચમનલાલ, ગગલદાસ, શાંતીલાલ, ચંપકલાલ,
અ.સૌ. મોંઘીબેન અમૃતલાલ દોશીના આત્મશ્રેયાર્થે દોશી વીજુબેન ચીમનલાલ પરિવાર (થરાદવાળા)
દીપક, અનીલ, નિલાંગ (હાલ મુંબઈ) ભવ્યા જેમ્સ, પી. મૈત્રી એન્ડ કું.
- પૂ.પં.શ્રી સત્યસુંદર વિ.મ.ના રાજકોટ-જાગનાથ સંઘના ચાતુર્માસની અનુમોદનાર્થે
હિંમતલાલ કપૂરચંદ પારેખ પરિવાર હ. મંજુલાબેન ● દિનેશ ● રીટા ● રિશી ● ધ્વનિ
- સ્વ. પ્રહુલ્લાબેન વિનોદભાઈ શાહની સ્મૃતિમાં
હ. નિલેશ ● ખ્યાતિ, સચિન ● નેહા, સાંજલ ● પારખી - દિલ્લી

- पू.आ.ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજની ૪૨ મી દીક્ષાતિથિની અનુમોદનાથે માતૃશ્રી પ્રવીણાબેન પ્રવીણચંદ્ર શાહ (લીબડી) હાલ - ઘાટકોપર
- પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂ.મ.ની ૪૩ મી દીક્ષાતિથિ નિમિત્તે પૂ.પં.શ્રી પદ્મસુંદર વિ.મ.ની પાવન પ્રેરણાથી સ્વ. મદનબેન કચરદાસજી નાહરના આત્મશ્રેયાર્થે ડ.અ.સૌ. લીનાબેન પ્રકાશભાઈ - દહાણું રોડ
- પ.પૂ.પં. શ્રી સત્યસુંદર વિ.મ.સા. ની શુભ પ્રેરણાથી કપિલાબેન હસમુખલાલ શાહ (લાલાજી પરિવાર) - નેત્રંગવાળા ડ. સંજયભાઈ, વિજયભાઈ, રેણુબેન, વૈશાલીબેન, અભિષેક, હિમાની, જૈનમ... (ભરૂચ)
- પૂ.મુ. શ્રી નમ્રસુંદર મ.સા. ના સંયમજીવનની અનુમોદનાથે ડ. નયનાબેન, શ્રેયસ, શ્રેણિક, સ્મીતલ, પરિતા - સુરત
- પ.પૂ.પં. શ્રી સત્યસુંદર વિ.મ.સા. ની શુભ પ્રેરણાથી મહેન્દ્રભાઈ ● જ્યોતિબેન, વિપુલભાઈ ● શિવાની બેન, સમીરભાઈ ● હેતલબેન - સુરત
- પૂ. માતૃશ્રી ઈન્દુબેન નટવરલાલ પ્રેમચંદ શાહ ડ. કેતન ● નિશા, પ્રદીપ ● ભાવિની, અંકિત ● કૈવન, હિરલ ● અર્પિત ● અક્ષિત તથા સમસ્ત સોલંકી પરિવાર - વાગલધરા (વલસાડ)
- શ્રી શંકરભાઈ જોઈતાભાઈ પટેલના આત્મશ્રેયાર્થે, મનીપુર - તા. સાણંદ ડ. ગણપતભાઈ મંગળદાસ પટેલ
- સંઘવી બાબુલાલજી પુનમચંદજી ડ. કે.પી. સંઘવી પરિવાર કોટામાં તીર્થના નામકરણ પ્રસંગે પ.પૂ. પંન્યાસ પદ્મસુંદર વિ.મ.સા. ની પ્રેરણાથી
- પૂ.પં.શ્રી પદ્મસુંદર વિ.મ.ની પ્રેરણાથી સ્વ. પૂ. માતૃશ્રી તથા પિતાશ્રી કંચનબેન સુમનભાઈ ચોકસી (પાટણવાળા)ના સ્મરણાર્થે ડ. હીરેન ● જાગૃતિ ● પરિન ● ચાર્મી - અમદાવાદ
- પૂ.પં.શ્રી પદ્મસુંદર-યુગસુંદર વિ.મ.ની પ્રેરણાથી પૂજ્યશ્રીની ગૃહાંગણે થયેલ પથરામણી નિમિત્તે અ.સૌ. પ્રીતિબેન પ્રવીણભાઈ સીસોદીયા - નાસિક
- મંજૂષા રામરાવ પાટિલ - ડ. અપૂર્વ ● હિતેશ ● મનીષ ● ઉર્વશી
- માતૃશ્રી વસુબેન નટવરલાલ શાહ પરિવાર - સાન્તાકુઝ (વેસ્ટ)
- ક્રિષ્નાના જન્મની ખુશાલીમાં - ડ. રાહુલ ● રોશની શરાફ - જૂહુ, મુંબઈ
- લક્ષ્મીબેન શામજીભાઈ વોરા પરિવાર (અમર સન્સ) ડ. પ્રફુલ્લ ● બિપીન ● જ્યોતિ ● ભારતી ● કિંજલ ● દેવાંશી ● તન્વી ● ચિરાગ - મુંબઈ
- સ્વ. પૂ. માતૃશ્રી માનકુંવરબેની અંત સમયની મસ્ત સમાધિની અનુમોદનાથે ખાંતિભાઈ હરિલાલ મહેતા - ઘેટીવાળા ડ. મનીષ - હાલ મુલુંડ
- પૂ.આ.ભ. શ્રી જયઘોષસૂરિજી મ., રત્નસુંદરસૂરિજી મ., હરિકાંતસૂરિજી મ. આદિ ઠાણાના, મુલુંડ - ૨૦૧૦ ના યાતુર્માસ પરિવર્તનના મળેલ લાભની ખુશાલીમાં વોરા પ્રાગજીભાઈ દલીચંદભાઈ પરિવાર (બેબા - વાગડવાલા) હાલ ગાંધીધામ - મુલુંડ
- સા. શ્રી જયણાનિધિશ્રીજીનાં સંયમજીવનની અનુમોદનાથે માતૃશ્રી જયાબેન અમૃતલાલ તલકચંદ ગાંધી (દાદાવાળા) ડ. અરૂણા - નરેશ, હર્ષા - હર્ષદ, શીતલ - સુરેશ, હીના - દિનેશ, નિશા - ચેતન
- ડૉ. સુનીલદત્ત ચૌધરી ડ. મિનેશ ચન્દ્રકાંત શાહ ● ધનેશ શાહ ● માનસી ● ઊર્જા ● નિશ્મા - જલગાંવ
- પૂ.સા. રાજરાત્નાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી 'વિપ્લવ' પુસ્તકના વિમોચન પ્રસંગે સા. વાલ્સલ્યનિધિશ્રીજી મ.સા. ના સંયમજીવનની અનુમોદનાથે - સૌ. વનીતાબેન જયંતિભાઈ મોથારીયા (મલાડ) ● રચના - પારસ ● રિંકુ - કામેશ ● મનિષા - જિજ્ઞેશ
- ભુવનભાનુસૂરિ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં પૂ.આ.ભ.શ્રી રત્નસુંદરસૂરિ મ. લિખિત ૨૫૦ મા પુસ્તકના વિમોચનના મળેલ લાભની ખુશાલીમાં માતૃશ્રી પ્રવીણાબેન હિંમલાલ મહેતા ડ. કુમાર ● હીના ● અમી
- માતૃશ્રી પાર્વતીબેન રતિલાલ મીરાણી
- શ્રીમતી નંદીતાબેન રાજા મીરાણી
- ડૉ. જીમ્મી રાજા મીરાણી
- લીસા રાજા મીરાણી
- શકુંતલાબેન પુખરાજજી મહેતા પરિવાર ડ. નવીનભાઈ ● મધુબેન, કપલ ● શ્વેતા, આશ, રાજ - પિંડવાડા
- જીમિત વિપુલકુમાર દોશી - માટુંગા

- પૂ.પં. શ્રી પદ્મસુંદર વિ.મ.ની પ્રેરણાથી પૂ.સા. શ્રી તરુણલતાશ્રીના શિષ્યા પૂ.સા. શ્રી નિર્વાણપુણ્યાશ્રીજી તથા અર્હપુણ્યાશ્રીજીના સંયમજીવનની અનુમોદનાર્થે લીલાબેન વેણીચંદ શાહ - ઘોટીવાળા - હાલ, સાંતાક્રુઝ
- પૂ.સા. શ્રી સંવેગનિધિ મ.સા. ની પ્રેરણાથી શ્રી ખીમજી તેજપાલ લોડાયા - કચ્છ-કોઠારા હાલ, ઔરંગાબાદના સુપુત્રી માતુશ્રી નવલબાઈ લીલાધર મેંસેરી પરિવાર કચ્છ-લાલા
- સ્વ.પૂ. પિતાશ્રી નરેન્દ્રભાઈ કાંતિલાલ રૂપાણીના અનેકવિધ સુકૃતોની અનુમોદનાર્થે હ. માતુશ્રી ઉષાબેન - પુત્રો : ચન્દ્રેશ ● જયેશ પુત્રવધૂઓ : મીરા ● સોનલ - પૌત્ર : મિહિર - રાજકોટ
- લલિતાબેન યશવંતરાય મહેતા
 - ભરત - વીણા ● વિપુલ - કવિતા ● દિવ્યેશ - હેતલ ● સાગર - જીજ્ઞા - પરિવાર અમદાવાદ
- પંચાસ પદ્મસુંદર વિજય ગણિની પ્રેરણાથી શ્રીમતી સુભદ્રાબેન રસિકલાલ સોમચંદ શાહ (જોટાણાવાળા પરિવાર) હ. પરેશ, યામિનિ, સંકેત, નેન્સી, નીલાંગ - શાંતિનગર, અમદાવાદ
- સ્વ. પૂ. પિતાશ્રી પ્રવીણચન્દ્ર હીરાલાલ શાહના અનેકવિધ સુકૃતોની અનુમોદનાર્થે હ. માતુશ્રી જયાબેન ● પુત્ર : સિદ્ધાર્થ ● પુત્રવધૂ : સોનલ ● પૌત્રી : તર્જની, ફોરમ
 - તન્ની અર્પણ શાહ ● અવનિ આસિત અપ્પા - અમદાવાદ
- નરેન્દ્રભાઈ કાંતિલાલ શાહ તથા રમાબેન નરેન્દ્રભાઈ શાહ - અમદાવાદ હ. સુકેતુ-ધુમા, આદિત-અનુજ
- માતુશ્રી લીલાબેન શાંતિલાલ ઠક્કરની સ્મૃતિમાં સૌ. શીલા રાજેશ ઠક્કર - નાગપુર
- પૂ.સા. સંવેગનિધિશ્રી મ.સા. ની પ્રેરણાથી સૌ. અદિતિ અક્ષય ઠક્કર - નાગપુર
- પૂ.સા. ધૈર્યનિધિશ્રી મ.સા. ની પ્રેરણાથી પરમ રાજેશ ઠક્કર - નાગપુર
- પૂ.સા. દેશનાનિધિશ્રી મ.સા. ની પ્રેરણાથી સનવી અક્ષય ઠક્કર - નાગપુર
- પ.પૂ. રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. ના નાગપુર-૨૦૧૨ ના ચાતુર્માસ નિમિત્તે શ્રીમાન રમણીકલાલ વીરચંદ વોરા પરિવાર
- પૂ.સા. સંવેગનિધિશ્રીજી મ.સા. ની પ્રેરણાથી સ્વ. હિંમતલાલ વીરચંદ વોરા પરિવાર
- પૂ.સા. દીપ્તીધર્માશ્રીજી મ.સા. ની પ્રેરણાથી શ્રીમાન અશોકકુમાર વીરચંદ વોરા પરિવાર
- સૌ. સુશીલાબેન રમણિકલાલ વોરા હ. કીર્તિ-અનિતા, લતેશ - કવિતા - નાગપુર
- માતુશ્રી વિમળાબેન જટાશંકર મહેતાના આત્મશ્રેયાર્થે (રાજકોટવાળા)
 - હ. કોકીલાબેન રમેશભાઈ - આરતી ધર્મેશભાઈ - અમીતા આશિતભાઈ - પલક - પાયલ - માહી (હાલ - નાગપુર)
- સ્વર્ગીય સરલાદેવી ધીરજલાલ ઘેલાણી પરિવાર - નાગપુર
- પૂ.સા. સંવેગનિધિશ્રી મ.સા. ની પ્રેરણાથી શ્રીમતી મંછાગૌરી નરભેરામ દોશી પરિવાર - રાયપુર
 - હ. અશ્વિન ● નયના, જીતેન્દ્ર ● પૂનમ, શૈલેષ ● દક્ષા, કપિલ
 - કૃપાલી, ચિરાગ-એકતા, ચાર્લી, જુલી, કોમલ, વૈદિક
- શ્રીમાન ભોગીલાલ રાયચંદ દોશી (સાવરકુંડલાવાળા)
 - હ. પ્રફુલ્લ ● વીણા, ભરત ● નીલા, રાજુ ● કલ્પના - નાગપુર
- પૂ.મુ. શ્રી વાસલ્યસુંદર વિ.મ. ના ૩૦ ઉપવાસની અનુમોદના નિમિત્તે તથા 'આ ઈતિહાસ નથી વર્તમાન છે' પુસ્તકના વિમોચનની ખુશાલીમાં અ.સૌ. વર્ષાબેન પંકજભાઈ દોશી - સાન્તાક્રુઝ
- ચંદ્રકાંતભાઈ શાંતિલાલ શાહ - સરોજબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર
 - વિપુલ ● કવિતા, પરાગ ● શલાખા, અલ્પેશ ● સારિકા - વિરેન
 - નિલય, અકાંક્ષા, કિશા, ખુશ, કલશ - ઔરંગાબાદ
- શ્રીમતી કમલબાઈ હસ્તીમલજી બોહરા પરિવાર - (રતનપુર)
 - હ. લીલાબાઈ રમણલાલજી, લલિતા જીવનલાલ, સુનિતા, ધર્મેન્દ્ર, કામિની, અજય, વનિતા, નરેશ, નમ્રતા, રિતેશ, દિશા, હેમલ, નમન, અમુલ્યા, ચિરાગ, ભાવિક, મનાલી, હિતાલી, પલક
- પૂ.પં.શ્રી સત્યસુંદર વિ.મ. ની પ્રેરણાથી વસંતબેન દીપચંદ દોશી - મોટી ખેરાળીવાળા - વસંત - દીપ વાટીકા - ગેંબીવલી
- પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિ મ.સા. લેખિત પુસ્તક નં. ૨૯૧ "આજ આનંદ ભયો" ના વિમોચનની મળેલ લાભની ખુશાલીમાં અ.સૌ. પ્રેમલતાબેન મફતલાલ પટેલ
 - પુત્ર : રશ્મિનભાઈ ● પુત્રવધુ : નીતાબેન આર. પટેલ ● પુત્રી : હેતલબેન એમ. પટેલ
 - પૌત્ર : નિષ્કલ આર. પટેલ તથા પંરતપ આર. પટેલ ● દૌહીત્ર : પ્રબુધ એમ. પટેલ

- પ.પૂ. આચાર્ય રત્નસુંદર મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી જગદીશચંદ મંગલચંદ શાહ પરિવાર
 - અરૂણાબેન ● પુત્ર: પવન ● પુત્રવધુ: જ્ઞાનવી ● પૌત્ર: જશ
- પ.પૂ. શ્રી શ્રી માં અનંતાનંદ આશ્રમ, દિવ્ય જ્યોત આયુર્વેદિક રીસર્ચ ફાઉન્ડેશન મુકામ-વહેલાલ (તા. દસકોઈ, જી. અમદાવાદ) ની શુભ પ્રેરણાથી સ્વ. રવજીભાઈ માલાભાઈ ચારોલા (પટેલ)
 - હ. વિજયાબેન, મહેશભાઈ, દિશાબેન, રિદ્ધિ
- સ્વ. જીરભાઈ મહેશભાઈ ચારોલા (પટેલ) હ. મહેશભાઈ, દિશાબેન, રિદ્ધિબેન, સંજયકુમાર, પૌત્ર - રૂદ્ર
- સ્વ. કડવીબેન હરખાભાઈ માલાભાઈ ચારોલા (પટેલ) સ્વ. શીવાભાઈ, સ્વ. માવજીભાઈના સર્વે પુત્રો
- સ્વ. ધનીબેન પોપટલાલ માલાભાઈ ચારોલા (પટેલ) સ્વ. દિવાળીબેન, સ્વ. ધરમશીભાઈના સર્વે પુત્રો જયાબેન, પ્રભુભાઈ તથા તેમના પુત્રો
- સ્વ. રંભાબેન દેવજીભાઈ માલાભાઈ ચારોલા (પટેલ)
 - હ. ખીમજીભાઈ, દુર્લભજીભાઈ તેમના સર્વે પુત્રો
- સ્વ. અમરશીભાઈ ડાહ્યાભાઈ સુવારીયા (પટેલ)
 - હ. શાંતાબેન, સ્વ. અશોકભાઈ, ધર્મીષ્ટાબેન વિનોદભાઈ, દમયંતીબેન અમરશીભાઈ પટેલ
- સ્વ. પ્રફુલાબેન રવજીભાઈ ચારોલા (પટેલ) હ. મહેશભાઈ, દિશાબેન, રીદ્ધિબેન ભાણેજ: નિધીબેન, દ્રઘ્નાબેન, નિષ્ઠાબેન તથા ગીરીશકુમાર જીવરાજભાઈ આદરોજી - ગામ - મોરબી
- દહાણુ રોડ સંઘના જિનાલાલયમાં નેમનાથ પ્રભુની તથા માણિભદ્રદેવની પ્રતિષ્ઠાના મળેલા લાભની ખુશાલીમાં પૂ.મુ. શ્રી ભાગ્યસુંદર વિ.મ. ની પ્રેરણાથી અ.સૌ. પ્રભાવતી સુભાષચન્દ્ર મહેતા
 - હ. અમિત ● ભાવિકા ● મિહિર ● શાશ્વત ● સ્વેતા રાજેશજી ● ભવ્ય બાફના - ધોલવડ (હાલ દહાણુ)
- પૂ. પિતાશ્રી માગીલાલ નાથાલાલ શેઠ પરિવાર - છોડવડી - જુનાગઢ, (હાલ મુલુંડ)
 - હ. પરેશ ● ચેતન ● રોહિત
- પૂ. પં. શ્રી પદ્મબોધિ વિ.મ.ની પ્રેરણાથી હેમુલ અલકા પરિમલ શાહ પરિવાર - અંધેરી, મુંબઈ
- પૂજ્ય માતૃશ્રી મંજૂલાબેન ઉત્તમચંદ મોદી તથા પૂજ્ય પિતાશ્રી ઉત્તમચંદ અજરામર મોદીના સ્મરાર્થે
 - હ. શ્રીમતી અરૂણા ભરતકુમાર મોદી ● શ્રી ભરતકુમાર ઉત્તમચંદ મોદી - બેંગલોર
- નવલબેન તારાચંદ ગોસર - મુંબઈ
- રાહુલ ગોસર એન્ડ એસોસીએટ્સ - દાદર, મુંબઈ
- શારદાબેન કાંતિલાલ છોટાલાલ શાહ પરિવાર હ. અશોકભાઈ - ખડકી, પૂના
- શ્રીમતી નાનુબેન ભીમશ્રી ગાલા પરિવાર
 - હ. મનોજભાઈ, ભારતીબેન, ધૃમ્મીલ, ખુશીબેન - પુસ્તક પ્રેમવનનાં વિમોચન નિમિત્તે
- પૂ. આ. શ્રી રત્નસુંદર સૂ.મ.ના સંયમજીવનના પાઠમા વરસના પ્રવેશ નિમિત્તે તથા દેવલાથી પાલીતાણાના છ'રી પાલિત યાત્રા સંઘની અનુમોદનાર્યે માતૃશ્રી વિમળાબેન ઓતમચંદ દોશી
 - અજય ● હીના ● નિમિત્ત ● ખુશાલી - દેવલાવાળા પરિવાર
- શાહ સૌભાગ્યચંદ માગીલાલ પરિવાર (ધર્મજવાળા)
 - ગં સ્વ. સુશીલાબા, અશ્વિનભાઈ-રેણુકાબેન, રોહિતભાઈ-સરોજબેન, કૌશિકભાઈ-મોશ્નાબેન, કલ્પેશ-અ. સૌ. નીતા, જિનેશ-અ.સૌ. રૂપલ
- શાહ રોહિતભાઈ સૌભાગ્યચંદ પરિવાર (પેટલાદ)
 - અ.સૌ. સરોજબેન, ચિ. જિનેશ, અ.સૌ. રૂપલ, ચિ. રિદ્ધિ-પ્રિયંતકુમાર, ચિ. સિદ્ધિ-ચીરાગકુમાર, ચિ. પરમ, ચિ. નમન, ચિ. આનલ, ચિ. આગમ, ચિ. ઊર્જ
- સી.એ. જિનેશ રોહિતભાઈ શાહ (ધર્મજવાળા) અ.સૌ. રૂપલ, ચિ. પરમ, ચિ. નમન (હાલ-આગુંદ)
- રસીલાબેન પ્રતાપભાઈ શાહ (ખંભાતવાળા) ચિ. નીરવ, અ.સૌ. જીગ્નાબેન, સમ્મક [હાલ કટારા (દોહા)]
- પૂ.સા. રિદ્ધિનિધીશ્રીજી મ.સા. ની પ્રેરણાથી
 - 'એક જ વાર' પુસ્તક વિમોચન પ્રસંગે જ્યાબેન નટવરલાલ શાહ પરિવાર દિપાલી ● જતીન / અમીયા ● યોગેન / કેશા ● આયુષ / શાર્દસા ● શાર્દના / વડોદરા (હાલ-કેનેડા)
- પૂ. રાજરત્નાશ્રીજી મ. ની પ્રશિખ્યા પૂ.સા.શ્રી પુનિતનિધિશ્રીજીના સર્ગંગ પાઠ આયંબિલની અનુમોદનાર્યે મીનાબેન પ્રકાશભાઈ શાહ - ● નિધિ ● પ્રેરક ● પંકિત ● ભાવિક ● નીર ● રુઆન
- પૂ.આ.ભ. શ્રી પદ્મસુંદરસૂરિ મ.ની પ્રેરણાથી ધનલક્ષ્મીબેન ચીમનલાલ દોશી (મહુવાવાળા)
 - હ. નલિન ● રાજુ ● ભરત ● ભાવેશ ● વિજય ● નયના ● આશા - હાલ વડોદરા

- પૂ. આ. ભ. શ્રી રત્નસુંદર સૂ. મ. ના સંયમ પર્યાયના ૫૦ વરસની અનુમોદનાર્થે પુ. મુ. શ્રી ભાગ્યસુંદર વિ. મ. ની પ્રેરણાથી સ્વ. માતુશ્રી લીલાવંતી વજ્રલાલ મહેતા (પરિવાર) ● દીપક ● નીતા પુત્રો : ભાવિક ● મહર્ષિ - પુત્રવધૂ : ભૂમિકા ● નિધિ શ્યાન : લાઈગર - વડોદરા
- નરેન્દ્રભાઈ રૂપાણી - રાજકોટવાળા ● પૌત્રી-જસવી
- કિરીટ શાહ - ન્યૂ જર્સી (યુ. એસ. એ.)
- સ્વ. શ્રીમતી કુસુમબેન અને સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમૃતલાલ શાહ (દિડગામ) સિદ્ધિ, રીદ્ધિ, કુશલ, પાણલ અને કિરીટ પ્રવિણચંદ્ર શાહ (USA)
- પદ્મભૂષણ ઉપકારી ગુરુદેવ પ. પૂ. જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મ. સા. ના “માનસ એકેડમી” (અમદાવાદ) માં થયેલ પાવન પગલાના મંગલકારી અવસરે ડ. મયુર ઓમપ્રકાશ દૂબેદી - ડિરેક્ટર
- પૂ. પં. શ્રી યુગસુંદર વિ. મ., પૂ. મુ. શ્રી દેવર્ષિસુંદર વિ. મ. ની પ્રેરણાથી પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરિ મ. ના સંયમજીવનના ૫૦ વરસની પૂર્ણાહુતિ નિમિત્તે તથા દીપિકાબેન હર્ષદભાઈ મહેતાના સુકૃતોની અનુમોદનાર્થે ● દેવાંગ-ફાલ્ગુની ● શીલાંગ-રીટા ● ધૃતિ ● સ્તુતિ ● શ્રીયા - મલાડ
- પ. પૂ. આચાર્ય શ્રી પદ્મસુંદરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી સરસ્વતીબેન ભીખુભાઈ શાહ ડ. અશોક, અનિલ, નિરવભાઈ શાહ - હાલ, વ્યારા-સુરત
- પ્રકાશચંદ્ર હગામીલાલજી પોખરાગુ પરિવાર
- પારસમલ નાથુલાલજી જૈન
- કૃપણકાંત ચીમનલાલ પંડ્યા
- પ. પૂ. ગુરુદેવશ્રી આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ને ભારત સરકાર તરફથી મળેલ “પદ્મભૂષણ” ખિતાબની ખુશાલીમાં...શ્રી અજયભાઈ સંચેતી પરિવાર
- પ. પૂ. ગુરુદેવશ્રી આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ના સંયમજીવનના ૫૦ વર્ષના પૂર્ણાહુતિ પ્રસંગે... શ્રી વિશાલભાઈ ચોપરા પરિવાર
- સરસ્વતીલબ્ધપ્રસાદ પ. પૂ. ગુરુદેવશ્રી આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ના ઉપકારોનું ઋણ સ્વીકાર શ્રી નરેશભાઈ બાફના અને સમસ્ત બાફના પરિવાર
- પૂ. સાધ્વી પુણ્યનિધિશ્રીજી મ. સા. ની પ્રેરણાથી સંગીતા ધનસુખલાલ બોરા પરિવાર ડ. હાર્દિક, હર્ષિત, હીરલ - નાસિક
- પૂ. પં. શ્રી યુગસુંદર વિ. મ. ના માસખમણની અનુમોદનાર્થે પૂ. મુ. શ્રી વાનસલ્યસુંદર વિ. મ. ની પ્રેરણાથી સુઆવિકા હેમાબેન સુધીરભાઈ શાહ પરિવાર ડ. સમીર ● ઉર્વશી ● મનન ● ખુશી - બાજીપુરાવાળા
- માતુશ્રી અ. સૌ. સૌભાગ્યવંતી દેવી સંતોકચંદજી અચલચંદજી ગુલેરછા પરિવાર ડ. મહાવીર ● કમલેશ ● રૂપા ● સંજુ ● પ્રજ્ઞાલ ● સંયમી ● આંગી ● મુક્તિ - બારડોલી
- પ. પૂ. રાજરત્નાશ્રીજી મ. સા. પ. પૂ. રિદ્ધિનિધિશ્રીજી મ. સા. ની પ્રેરણાથી “ટય ઇસ્કીન” પુસ્તક વિમોચન પ્રસંગે માતુશ્રી સુંદરબેન મુલતાનમલજી બ્રહ્મચારી પરિવાર નરેશભાઈ મંજુબેન - પુત્રી : મોજ્જા, સાક્ષી (કનકશ્રી) - બારડોલી
- બારડોલી વિભાગ ગ્રામ વિકાસ કો. ઓ. કેડીટ સોસાયટી ચેરીટેબલ ટ્રસ્ટ - બારડોલી
- હંસાબેન વસંતલાલ રૂપચંદ શાહ ડ. પિનાકીનભાઈ ● નિલ્શાબેન ● મોનિક ● નિધિ ● વિડા ● પ્રિયાંશ ● દર્શિત ● પાયલ ● હિશિતા ● કિઆરા - બારડોલી
- પુષ્પાબેન દીપચંદજી બાફના - દિનેશ-શોભા ● સુભાષ-અરૂણા ● રાજેન્દ્ર-હીના પુષ્પદીપ પરિવાર - બારડોલી
- પૂ. પૂ. સાધ્વી સૌમ્યરેખાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી ‘ઝેર જ્યારે નીતરી જ્ય છે (વિષ વિલય) તેની સંસ્કૃત ભાવાનુવાદની અનુમોદનાર્થે ડ. તૃતિબેન પીયુષભાઈ શાહ (ચાણસોલ-સુરત) મૌલિન-એકતા, મિટી-વિહાના
- પ. પૂ. સાધ્વી સૌમ્યરેખાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી પ્રિયંકાબેન ભાવેશકુમાર ઝવેરી (પાટણ-હાલ મુંબઈ) કિશ-યશવી
- રા ધૃતિચિંતક પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ના પાવન સાનિધ્યમાં કલિકુંડ તીર્થમાં કરાવેલ ઉપધાન તપ નિમિત્તે અ. સૌ. કુસુમબેન પ્રમોદભાઈ શાહ - કાંદીવલી (મુંબઈ)
- પૂ. સા. સંવેગનિધિશ્રીજી મ. સા. ની પ્રેરણાથી કરાવેલ શત્રુંજય ગિરિરાજની નવ્વાણુ યાત્રા નિમિત્તે અ. સૌ. કુસુમબેન પ્રમોદભાઈ શાહ - કાંદીવલી (મુંબઈ)
- પૂ. સા. ધ્યાનનિધિશ્રીજી મ. સા. ની પ્રેરણાથી હાર્દિકના માસજ્ઞમણ તપ નિમિત્તે અ. સૌ. નેહલબેન હાર્દિકભાઈ શાહ - કાંદીવલી (મુંબઈ) ● પર્વદા ● હિતસ્વી ● મોક્ષિલ
- પૂ. સા. ધ્યાનનિધિશ્રીજી મ. સા. ની પ્રેરણાથી જીગરના ઉપધાન નિમિત્તે અ. સૌ. જુલીબેન જીગરભાઈ શાહ - કાંદીવલી (મુંબઈ) ● મંથન ● નિસર્ગ

- પૂ. સા. ધ્યાનનિધિશ્રીજી મ. સા. ના સંયમજીવનની અનુમોદનાર્થે અ. સૌ. કુસુમબેન પ્રમોદભાઈ શાહ - કાંદીવલી (મુંબઈ)
- પર્ષદા ● મંથન ● નિસર્ગ ● હિતસ્વી ● મોક્ષિલ (સવિતા - સુવાસ પરિવાર)
- અ. સૌ. ઈલાબેન હરીશભાઈ મહેતા - ડ. મિલનભાઈ - મહેકબેન, કૃપાબેન - સૌમ્યા
- માતુશ્રી કસ્તુરબેન પદમશીભાઈ શાહ - દાદર (મુંબઈ)
- પ્રેરણા : શાસનપ્રભાક પૂ. આ. શ્રી અક્ષયબોધિસૂરિ મહારાજ, પ્રવચનશિખર પૂ. આ. શ્રી મહાબોધિસૂરિ મહારાજ
- મારા વ્હાલા ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ના અનંત ઉપકારો અને હિતશિક્ષાના ઋણી મનોજ ધનરાજ સીતારામ મંત્રી (મૂળ : હરનાવા, નાગોર, રાજસ્થાન, હાલ-અમદાવાદ અને સાઉદી અરેબિયા)
- પ. પૂ. સાધ્વીજી શ્રી પ્રીતિધર્માશ્રીજી મહારાજ તથા પ. પૂ. સાધ્વીજી શ્રી ભક્તિધર્માશ્રીજી મહારાજના સંયમજીવનની અનુમોદનાર્થે - ડ. શ્રીમતી કાશ્મીરાબેન મનીષભાઈ મહેતા પરિવાર - મલાડ, મુંબઈ
- અ. સૌ. અરૂણાબેન મહેન્દ્રભાઈ મીઠાણી પરિવાર ડ. જિજ્ઞાબેન કેતનભાઈ મીઠાણી - મુલુંડ, મુંબઈ
- હિંમતભાઈ ગાંધી ડ. કલ્પક ● પંકજ - ઈન્દોર
- શાસનરત્ન શ્રી કુમારપાળભાઈ વી. શાહની પ્રેરણાથી શ્રીમતી સુરેખાબેન હસમુખલાલ શાહ
- ડ. સોનલબેન મનીષકુમાર શાહ - ઈડરવાળા (આયુષી, મોક્ષ)
- ગણિશ્રી ધૈર્યસુંદરવિજયજી મ. સા. ની પંચાસ પદવી તથા નૂતનદિક્ષિત મુનિરાજજી ધરણેન્દ્રસુંદરવિજયજી મ. સા. ની દીક્ષા નિમિત્તે દીક્ષા દિન : પોષ સુદ-૧૩, ઈન્દોર - ડ. મયણાબેન ચેતનભાઈ શાહ પરિવાર - મુલુંડ (મુંબઈ)
- પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરિ મ. ના દીક્ષા જીવનના ૫૩ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે તથા સ્વ. દિવ્યાબેન (વાંઝ) તથા સ્વ. ડૉ. પ્રતિકભાઈ (બારડોલી)ના આત્મશ્રેયર્થે
- ડ. ગુણવંતભાઈ ● વાસંતીબેન ● નિરવભાઈ ● ડૉ. ભાવિનીબેન, દિયા, હિયા, પર્વ...વાંઝ-બારડોલી
- સ્વ. માતુશ્રી કાંતાબેન ચંદુલાલ મહેતા
- શ્રીમાત્ ચંદુલાલ મંગલદાસ મહેતા પરિવાર
- માતુશ્રી પલ્લવીબેન કિરીટભાઈ મહેતા
- શ્રીમાત્ કિરીટભાઈ ચંદુલાલ મહેતા
- બાળ સા. શ્રી શૌર્યનિધિશ્રીજીની પ્રેરણાથી માતુશ્રી લક્ષ્મીબેન રમણિકભાઈ છેડા - ડ. પૂતમ જયેશ છેડા - નાગપુર
- પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી ઉત્તમબેન નાનજીભાઈ પટેલ - ડ. કનકભાઈ-કિરણબેન (રાજકોટ)
- પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી અનીતાબેન મનસુખભાઈ પટેલ - ડ. મિતેશ, વંદના (ઈન્દોર)
- પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી 'કિકેટનું સિકેટ' પુસ્તક વિમોચન પ્રસંગે મંજુલાબેન મનસુખભાઈ સંઘવી પરિવાર - ડ. હિતેન અને હિમાની સંઘવી - ઈન્દોર (મે. અરિહંત એસોસીએટ્સ)
- પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી 'કિકેટનું સિકેટ' પુસ્તક વિમોચન પ્રસંગે દમયંતીબેન ગુણવંતભાઈ દેસાઈ પરિવાર - ડ. સંજય, જયેશ દેસાઈ - ઈન્દોર (મે. એચ. એમ. શાહની કનું)
- પૂ. સા. શ્રી સંવેગનિધિ મ. સા. ની પ્રેરણાથી સ્વ. રમાબેન પ્રવીણચંદ્ર કોઠારીની સ્મૃતિમાં યોગેશ કોઠારી - ઈન્દોર
- પૂ. સા. શ્રી સંવેગનિધિ મ. સા. ની પ્રેરણાથી સ્મીતાબેન યોગેશભાઈ કોઠારી
- ડ. જિનેશ્વર-હીરલ, મયંક-દિશા, હાસ્યા કોઠારી પરિવાર - ઈન્દોર
- પૂ. સા. શ્રી સંવેગનિધિ મ. સા. ની પ્રેરણાથી મંજુલાબેન અનિલકુમાર બોટાદરા
- ડ. હિમાંશુ-કલ્પના, સુવિધિ, પ્રાચી ઈન્દિરાબેન બોટાદરા પરિવાર - ઈન્દોર
- પં. યુગસુંદર વિ. મ. સા તથા મુ. શ્રી દેવર્ધિસુંદર વિ. મ. સા. ના સંયમજીવનની અનુમોદનાર્થે સ્વ. જ્યોતિબેન સૂર્યકાંતભાઈ મહેતા - ડ. દીપક-જગૃતિ, પારસ-ઉર્વશી, સમકિત - દાદર, મુંબઈ
- પૂ. સા. ધૈર્યનિધિશ્રીજીની પ્રેરણાથી માતુશ્રી શીલાબેન - કાન્તિલાલ શાહ ડ. રચનાબેન - કશ્યપભાઈ - વલસાડ
- પૂ. વાત્સલ્યસુંદર વિ. મ. ની પ્રેરણાથી શ્રીમતી કુસુમબેન હેમંતભાઈ કોઠારી
- ડ. દેવાશિષ-શીતલ, સચિન-કરિશ્મા, દિવ્યેશ, રિદ્ધિ, ધ્રુવ, મહક કોઠારી પરિવાર - ઈન્દોર
- પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી શ્રી રંભાબેન ગોપાલજી દામજી શાહ - ડ. દર્શના-દિનેશ શાહ - ધુલિયા
- પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી સેજલ - પરેશ શાહ - ભવ્ય, તન્વા શાહ પરિવાર - ધુલિયા
- પૂ. સા. અનંતકીર્તિશ્રીજીના સંયમજીવનના ૫૦ વર્ષની અનુમોદનાર્થે પૂ. સા. સંવેગનિધિશ્રીની પ્રેરણાથી માતુશ્રી પદ્માબેન નેમિચંદજી કોઠારી પરિવાર - અમલનેર
- મહાગીતાર્થ, સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તક
- પ. પૂ. આ. ભ. શ્રી હરિકાંતસૂરીશ્વરજી મ. સા. પં. શ્રી સૂર્યકાંત વિજય મ. શ્રી રવિકાંત વિજય મ. ૧૦૮ શિષ્યાના ગુરુગુણી
- પૂ. સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી પૂ. સા. શ્રી નંદીવર્ધનાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી

**સેંકડો હાથો અને હજારો આંખો સુધી પહોંચતા આ સાહિત્યને અમારે
હજારો હાથો અને લાખો આંખો સુધી પહોંચવું કરવું છે,
જરૂર છે આપના ઔદાર્યભર્યા સહકારની !**

પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે લખાયેલા સાહિત્યને લોકમાનસ તરફથી જે પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી અમારી છાતી ગજગજ ફૂલી રહી છે.
આ સાહિત્યને અમારે હજીય વધુ ને વધુ ફેલાવવું છે
અને એના દ્વારા અમારે અનેકના જીવનદીપકમાં ઉત્સાહનું તેલ પૂરવાનું મંગળ કાર્ય કરવું છે.
જો આ કાર્યમાં આપ સહભાગી બનવા માગતા હો તો અમે એક યોજના બનાવી છે.
રૂ. ૨૧,૦૦૦ નું દાન કરીને આપ રત્નત્રયી ટ્રસ્ટમાં 'શ્રુતપ્રેરક' તરીકે સામેલ થઈ શકો છો અને
રૂ. ૧૧,૦૦૦ નું દાન કરીને આપ 'શ્રુતપ્રેમી' બની શકો છો. સહકાર આપનો અને ઉત્સાહમાં વધારો અમારો !

શ્રુતપ્રેરક

- ❖ ગંગાસ્વરૂપ ભાનુબેન જશવંતરાય સલોત - ચોકવાળા
- ❖ મંજુબેન હરિલાલ ઝવેરી - પાલીતાણાવાળા
- ❖ સ્વ. ઓતમચંદ ધરમચંદ દોશી દેપલાવાળાના આત્માશ્રેયાર્થે હ. વિનોદ ● અજય ● કીર્તિ
- ❖ શ્રી મુનિસુવ્રતસ્વામી ગુહજિનાલયની પ્રતિષ્ઠાની ખુશાલીમાં શ્રી કીર્તિકુમાર યુનીલાલ શાહ - ભાઈદર
- ❖ રાજા રતિલાલ મીરાણી
- ❖ શ્રીમતી નંદીતાબેન રાજા મીરાણી
- ❖ પૂ. પં. શ્રી પદ્મસુંદર વિ. મ. ની પ્રેરણાથી ચિ. જિનલના ૩૦ ઉપવાસ તથા ચિ. કિંજલના ૮ ઉપવાસની અનુમોદના નિમિત્તે હર્ષદ મનસુખલાલ દોશી - દેપલાવાળા
- ❖ અ. સૌ. દિપીકાબેન ધનકુમાર પોપટલાલ વખારિઆ - વતન, કોલવડા - હાલ, બોરીવલી
- ❖ સ્વ. છોટાલાલ કેશવજી મહેતા, હસ્તે. પ્રફુલ્લાબેન સી. મહેતા - મૂળ રાજકોટ, (હાલ યુ.એસ.એ.)
- ❖ શ્રીમતિ રેણુકાબેન ભરતભાઈ શેઠ - ચિરાગ, પાયલ - નાગપુર
- ❖ દિનેશ પટેલ - મહેશ ટ્રેડિંગ કંપની - ગોંદીયા
- ❖ Dilip M. Vora - NAVI MUMBAI
- ❖ પૂ. પ. પ. શ્રી યુગસુંદર વિ. મ. સા. ની શુભ પ્રેરણાથી બીનાબેન નિતેશભાઈ પારેખ - નિધિ, શૈલી, રોનક - હાલ અમદાવાદ
- ❖ સ્વ. હર્ષ અતુલ ગોસલીયા - ઘાટકોપર
- ❖ ચિરાગ એ. લાલભાઈ - અમદાવાદ
- ❖ પૂ. આ. ભ. શ્રી પદ્મસુંદરસૂરિ મ. ની પ્રેરણાથી
- ❖ ૧. ઉજ્જબેન શેષમલજી શાહ (કવરાડાવાળા) ૨. પોપટલાલ શેષમલજી શાહ - માટુંગા હ. જિતેન્દ્ર ● અવિનાશ
- ❖ નવલબેન તારાચંદ ગોસર - મુંબઈ
- ❖ બિપીનભાઈ શાહ - વડોદરા
- ❖ વિકાસ ડુંગરચંદજી બાગરેયા - બારડોલી
- ❖ શ્રી કૌશિકભાઈ અરવિંદલાલ ઝવેરીના ઉપધાન તપ તથા માસખમણની તપસ્યાની અનુમોદનાર્થે - મુંબઈ
- ❖ પૂ. આ. ભ. શ્રી પદ્મસુંદરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી અ. સૌ. મધુરી મધુસુદન મહેતા - ગ્રાન્ટરેડ, મુંબઈ
- ❖ મધુબેન બાબુલાલ શાહ - આંબાવાડી, અમદાવાદ
- ❖ નીતિનભાઈ બાબુલાલ શાહ - આંબાવાડી, અમદાવાદ
- ❖ 'શોર્ટ એન્ડ સ્વીટ' પુસ્તકનું વિમોચન પંડિતજી - હીરાભાઈ - અનિલ - મદનભાઈ વગેરેના હસ્તે થયું એની અનુમોદના નિમિત્તે કુમારભાઈ મહેતા પરિવાર - માટુંગા
- ❖ સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમૃતલાલ શાહ (દહેગામવાળા)
- ❖ સ્વ. શ્રીમતી કુસુમબેન પ્રવિણચંદ્ર શાહ (દહેગામવાળા) હ. કિરીટ પી. શાહ - (ન્યૂજર્સી, અમેરીકા)
- ❖ પૂ. ગણિ શ્રી ધૈર્યસુંદર વિજયજી મ. કી પંન્યાસ પદવી નિમિત્તે શ્રી કાંતીલાલ ધરમચંદ દોશી પરિવાર ગુણવંતભાઈ - શારદાબેન, મહેન્દ્રભાઈ - કોકીલાબહેન, વિમલભાઈ - દર્શનાબેન
- ❖ શ્રીમતી મંજુલાબેન રતીલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ મમતાબેન બીપીનભાઈ શાહ (વડોદરા)
- ❖ પરમ પૂજ્ય સન્ય સુંદર મહારાજ સાહેબની પ્રેરણાથી સ્વર્ગસ્થ ગોંકટર પ્રફુલ વિ. શાહ - રાજકોટ
- ❖ પૂ. મુનિ શ્રી નિર્દોષસુંદર વિજયજી મ. સા. ના નિર્દોષ સંયમજીવનના ૧૮ માં વર્ષના પ્રારંભ પ્રસંગે ધરગેન્દ્ર અમૃતલાલ શાહ - કઠોર, જિ. સુરત હ. હર્ષિત, નિશિત, સમકિત, વિજયભાઈ

શ્રુતપ્રેમી

- ◆ પૂ. સા. શ્રી રત્નગુણાશ્રીજી મ. ની પ્રેરણાથી સ્વ. માયાબેન જશવંતલાલ ગાંધીના આત્મશ્રેયાર્થે
હ. રીટાબેન શ્રીપાલભાઈ - અમદાવાદ
- ◆ હરિશભાઈ ભાવસાર-અલકાપુરી - વડોદરા
- ◆ સ્વ. શાંતિલાલ લલ્લુભાઈ શાહના આત્મશ્રેયાર્થે - હ. બીનાબેન મુકેશભાઈ શાહ - સુરત
- ◆ એક ગુરુભક્ત પરિવાર તરફથી - બોહિસર
- ◆ રાહુલ ગોસર એન્ડ એસોસીએટ્સ - દાદર, મુંબઈ
- ◆ સૌ. માતુશ્રી લીલાવંતીબેન અમૃતલાલ શાહ પરિવાર ● અનિલ ● દક્ષાબેન ● મિતુલ ● ધારીબેન ● વિશ્વા - ઉદવાડા
- ◆ સ્વ. પરમ પૂજ્ય માતા-પિતા... સાસુ-સસરાનાં આશીર્વાદ થકી હ. સંતોષી... સુખી પરિવાર
- ◆ પૂ. મુનિ ધ્યાનસુંદર મ. સા. ના ૫૦૦ આયંબિલની અનુમોદનાર્યે અ. સૌ. ભાવનાબેન વિદ્યુતભાઈ શાહ - અમદાવાદ
- ◆ પૂ. મુનિરાજશ્રી નિર્દોષસુંદરવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીશ્રી નિર્દોષનિધિ મ. સા. ની પ્રેરણાથી
સ્વ. ચીમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર - સુરત
- ◆ પ. પૂ. સાધ્વી અનંતકીર્તિશ્રીજી મ. સા. ના શિષ્યા
- ◆ પ. પૂ. સાધ્વી સંસ્કારનિધિશ્રીજી મ. સા. ના શિષ્યા સા. શ્રી જિનાંગનિધિશ્રીજી અને
સા. શ્રી કિયાનિધિશ્રીજીના મૃત્યુજય તપ નિમિત્તે અડ્ડાગાબેન વિજયેન્દ્રજી - કાંદિવલી
શશિકલાબેન ભેરુલાલજી મોનાવત - બેંગ્લોર તરફથી
- ◆ પ. પૂ. અનંતકીર્તિશ્રીજી મ. સા. ના શિષ્યા સા. જિનદર્શનાશ્રીજીની પ્રેરણાથી સ્વ. લીલાબેન કવટલાલજી પારખના
પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે હ. અડ્ડાભાઈ - નિવાંગ-તત્તવ-રત્ન પરિવાર - અમદાવાદ
- ◆ પ. પૂ. ગુરુદેવશ્રીનાં આરટોલીમાં ભવ્ય ચાતુર્માસ નિમિત્તે સંવત-૨૦૭૩
હ. રાજેશ ● રેશ્મા ● મૌલિક ● સમતા ● સૌમ્ય ● ડિયાન ● રોયલ ઈનવેસ્ટમેન્ટ પરિવાર - આરટોલી
- ◆ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી યુગસુંદરવિજયજી મ. સા. ના માસશ્રમાગ તપની અનુમોદના નિમિત્તે તથા
પૂજ્ય મુનિરાજ શ્રી પાર્શ્વસુંદરવિજયજી મ. સા. ના પાંચ વર્ષના સંયમજીવનની અનુમોદના નિમિત્તે
ચેતનભાઈ સૂર્યકાંતભાઈ શાહ - મુલુંડ (મુંબઈ)
- ◆ જશવંતલાલ પ્રેમચંદ શાહ - આરટોલી
- ◆ જશવંતીબેન હસમુખલાલ શાહની ૮૫મી વર્ષગાંઠ નિમિત્તે હ. શોભનાબેન સુર્યકાંતભાઈ શાહ - સુરત
- ◆ લીનાબેન સંજયભાઈ પારેખ - આરટોલી
- ◆ પૂ. પ્રવર્તિની સા. શ્રી પુણ્યરેખાશ્રીજીના સુશિષ્યા પૂ. સા. શ્રી સૌમ્ય રેખાશ્રીજીના શિષ્યા સાધ્વીજી
શ્રી જ્ઞાતરેખાશ્રીજી મ. ની વડીદીક્ષા નિમિત્તે
● એમનો સાંસારિક શ્વસુર પક્ષ
● એમના સાંસારિક બેન દેવેન્દ્રાબેન તથા લીનાબેન
- ◆ સા. શ્રી જિનાંગનિધિશ્રીજીના સંયમજીવનની અનુમોદનાર્યે શ્રીમતી ચન્દ્રાબેન રમેશભાઈ શાહ - કાંદિવલી
● સંજય-જીજ્ઞા ● અજય-નીલસ ● પ્રતીક ● જાહનવી ● દિયા
- ◆ સ્વ. ઉમેશચંદ્ર પ્રેમચંદ્ર ઝવેરી પરિવાર - હ. ભાવનાબેન ઉમેશચંદ્ર ઝવેરી (દીકરી) - ભણ્ય
- ◆ પૂ. મુનિ ધ્યાનસુંદરવિજય તથા પૂ. મુનિ નિર્દોષસુંદરવિજયના સંયમજીવનના ૧૨ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે તથા
સા. તત્તવાર્થનિધિશ્રીજી મ. સા. ના સંયમજીવનના ૬ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે અ. સૌ. રીટાબેન રોહિતભાઈ શાહ - સુરત
અ. સૌ. ભાવનાબેન વિદ્યુતભાઈ શાહ - અમદાવાદ
- ◆ સ્વ. પરમાનંદભાઈ, સ્વ. મધુકાન્તાબેન શાહના આત્મશ્રેયાર્થે - ધંધુકાવાળા - હ. ભાવનાબેન, સૂર્યાબેન
- ◆ લીલાવતીબહેન મોહનલાલ ગાંધી તથા મોહનલાલ ફતેહભાઈ ગાંધીના શ્રેયાર્થે - હ. એમની પુત્રી પત્ના શાહ તરફથી
- ◆ શાહ અરવિંદભાઈ રમાગલાલ (ગોધરા) હ. દર્શન, પિન્કિતા, ભવ્યા, આર્યા
- ◆ અ. સૌ. કાનનબેન અરવિંદભાઈ શાહ (ગોધરા) હ. પારસકુમાર, શીતલ, ઋજુ, લલિધિ
- ◆ સ્વ. શ્રીમતી કુસુમબેન પ્રવિણચંદ્ર શાહ (દહેગામવાળા) - હ. કિરીટ પી. શાહ - (ન્યુજર્સી, અમેરીકા)
- ◆ શ્રી કુંભુનાથ જૈન યુવક મંડળ - આરટોલી - હ. રમેશ ટ્રેડર્સ
- ◆ ડૉ. રાહુલ વસંત શાહ એન્ડ ફેમીલી - U.S.A.

(ચેક, ડ્રાફ્ટ અથવા રોકડા નીચેના સરનામે મોકલવા)

રત્નત્રયી ટ્રસ્ટ
પ્રવીણકુમાર દોશી

૨૫૮, ગાંધી ગલી,
સ્વદેશી માર્કેટ, કાલબાદેવી રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૦૨.

ફોન : ૦૨૨-૨૨૦૬૦૮૨૬
(બપોરે ૧૨ થી ૭)

રત્નત્રયી ટ્રસ્ટ
કલ્પેશ વિ. શાહ

૧૪, ઈલોરા પાર્ક સોસાયટી,
નારણપુરા ચારરસ્તા પાસે,
જૈન ટેરાસર સામે,

નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩
ફોન : ૦૭૯-૨૭૬૮૦૭૪૬ (બપોરે ૧૨ થી ૭)
E-mail : ratnatrayeetrust@gmail.com